

વાચકો તથા વિજ્ઞાપનદાતાઓને  
**સ્વદેશ** પરિવાર  
તરફથી હોળીની હાર્દિક શુભેચ્છા

પરદેશમાં દેશની મહેક એટલે  
**સ્વદેશ**  
કેનેડાથી પ્રસિદ્ધ થતું સર્વોત્તમ ગુજરાતી સાપ્તાહિક SWADESH

**FOR BUYING, SELLING & LEASING**  
Investment In Real Estate Can Make Your Future Better...

**FOR SELLERS**  
Free Home Staging Consultation  
Professional Photography & Virtual Tour  
Attractive Advertising  
Social Media Marketing  
Customized Feature Sheet  
Weekly Open House  
Assist in Mortgage & Legal Services

**FOR BUYERS**  
Team of Strong Mortgage Brokers  
Team of Lawyers  
Professional Home Inspectors  
Step by Step Guidance Through out Buying Process

**AMIT SHAH**  
Sales Representative  
Dir: 647-995-5640  
amitgshah@gmail.com

**KOMAL SHAH**  
Sales Representative  
Dir: 647-624-5640  
komal4gshah@gmail.com

Homekey236@gmail.com  
Web: www.amitshah.ca

FRIDAY, 18 MARCH, 2022 Vol. 19, No. 11 Pages 20 Tel: 416-996-7755, E-mail : info@swadesh.news Web : www.swadesh.news

# આખી દુનિયાના દબાણને વશ થયા વગર યુકેન પર રશિયાના હુમલા જરી યુકેનના થિયેટર પર એરસ્ટ્રાઈક, હજારો દટાયા

રશિયાની સેનાએ મારિયુપોલ શહેર પાસે એક થિયેટર પર જ કરી, કેટલાક શરણાર્થીઓ ભોગ બન્યા



## મારિયુપોલ

અમેરિકા અને યુરોપીય દેશોના તમામ આંતરરાષ્ટ્રીય દબાણ છતાં રશિયાના યુકેન પરના હુમલાઓ અટકવાનું નામ નથી લઈ રહ્યા. યુકેનનો આરોપ છે કે, રશિયાએ થિયેટરની અંદર શરણ લઈ રહેલા યુકેની નાગરિકો પર બોમ્બ વરસાવ્યા છે. રશિયાની આ એરસ્ટ્રાઈકમાં અનેક લોકો માર્યા ગયા છે અને અનેક લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. યુકેને કરેલા દાવા પ્રમાણે થિયેટરમાં ૧૦૦૦ લોકો હતા જેઓ એરસ્ટ્રાઈક બાદ કાટમાળમાં દટાયા છે.

યુકેનના અધિકારીઓએ જણાવ્યું કે, રશિયાની સેનાએ મારિયુપોલ શહેર પાસે એક થિયેટર પર અચાનક જ એરસ્ટ્રાઈક કરી હતી. યુકેની સ્થિતિ વચ્ચે આ થિયેટરની અંદર સેંકડો યુકેની નાગરિકો શરણ લઈ રહ્યા હતા. યુકેનના કહેવા પ્રમાણે આ હુમલામાં કેટલા લોકોના મોત થયા અને કેટલા લોકોને ઈજા પહોંચી તે હજુ અસ્પષ્ટ છે પરંતુ આ હુમલામાં સેંકડો લોકો માર્યા ગયા હોવાની આશંકા છે. ઉલ્લેખનીય છે કે, રશિયા અને યુકેન વચ્ચેના યુદ્ધને ૨૧ દિવસ વીતી ગયા છે. ગુરૂવારે બંને દેશ વચ્ચેના યુદ્ધનો ૨૨મો દિવસ હતો. યુદ્ધનો આ મુદ્દો ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસ સુધી પહોંચી ગયો છે અને તેણે બુધવારે રશિયાને યુકેનમાં તરત યુદ્ધ રોકવા આદેશ આપ્યો હતો. કોર્ટે રશિયાના સમર્થક દેશોને આ મુદ્દાથી અંતર જાળવવા માટે કહ્યું છે.

## ચીનના અનેક ભાગોમાં મેડિકલ સંસાધનોની અછત

# ચીનમાં છેલ્લાં 10 અઠવાડિયામાં ઓમિકોનના 14000થી વધુ કેસ

## બીજિંગ

ચીનમાં ફરીથી કોરોનાના કારણે પરિસ્થિતિ ફરીથી બગડતી જઈ રહી છે. અહીં ૨૦૨૦ બાદથી સૌથી ખરાબ સ્થિતિ હોવાનું જાણવા મળી રહ્યું છે. સતત કોરોના કેસ વધવાના કારણે ચીનના ઘણા ભાગોમાં મેડિકલ સંસાધનોની અછત અનુભવાઈ રહી છે.

૧૦ અઠવાડિયામાં ચીનમાં ૧૪૦૦૦થી વધુ કેસ સામે આવ્યા છે. માનવામાં આવી રહ્યું છે કે ઓમિકોનના કારણે કેસ ઝડપથી વધી રહ્યા છે. એવામાં ચીનને ઘણા શહેરોમાં લોકડાઉન લગાવવું પડ્યું છે. હવે ચીનની અર્થવ્યવસ્થા ઉપર પણ તેની માઠી અસર પડી શકે છે. ચીનના કેટલાંક ભાગોમાં પહેલાથી જ સંકટનો સામનો કરવો પડી રહ્યો છે. અહીં લોકોને ટેસ્ટ માટે મારામારીથી ઝડપમાં પડી રહ્યું છે. એટલું જ નહીં, ચીનની કડક 'ઝીરો કોવિડ પોલિસી' હેઠળ લોકોને ક્વોરેન્ટાઈન કરવામાં આવી રહ્યા છે. ચીનમાં કોરોનાથી સૌથી વધુ પ્રભાવિત જિલ્લો



હોસ્પિટલોમાં ક્વોરેન્ટાઈનિંગ માટે જગ્યા ઓછી પડી રહી છે. એવી સ્થિતિમાં લોકોને ક્વોરેન્ટાઈન કરવા માટે હંગામી હોસ્પિટલો બનાવવામાં આવી રહી છે. અહીં કોરોનાને રોકવા માટે માત્ર ૨-૩ દિવસનો મેડિકલ સપ્લાય ઉપલબ્ધ છે. ઓક્સફર્ડ યુનિવર્સિટીના એપિડિમિયોલોજીના પ્રોફેસર ચેન ઝેંગમિનને જણાવ્યું હતું કે, આગામી બે અઠવાડિયા સંક્રમણ રોકવા માટે મહત્વના સાબિત થશે. ચીન કોરોના વિરુદ્ધ 'ઝીરો કોવિડ પોલિસી' અપનાવે છે. તેમાં, સંક્રમિતોની ઓળખ કરવામાં આવે છે.

**ABOWATH REAL ESTATE GROUP**  
VALUING REAL ESTATE TRANSACTIONS EVERY SINGLE TIME!

**MAAZ ABOWATH**  
BROKER  
416 895 4585  
More info on PAGE 2  
વધુ માહિતી પાનું 2 પર

ABOWATH.COM

**CIBC**  
Mortgage advice that comes to you  
For expert advice contact me today  
**Dhiresh Shah**  
Mobile Mortgage Advisor  
Tel : 647-248-0246  
dhiresh.shah@cibc.com

**SUPER VISA & INSURANCE**  
Get Full REFUND if visa is declined  
Get partial refund if parents leave early\*  
\*conditions apply.... Ask NOW for a free quote...

**Sanjiv Puri**  
Insurance Broker  
Ph.: 416-890-3232  
Email: sanjivpuri@rogers.com

**StarLife**  
Insurance & Investments Inc.  
www.starlifeinsurance.ca

LIFE INSURANCE | FUNERAL INSURANCE | MORTGAGE INSURANCE | CRITICAL ILLNESS INSURANCE | DISABILITY INSURANCE  
SUPER VISA INSURANCE | INSURANCE FOR VISITORS | NEW IMMIGRANTS | RESP | ESTATE PLANNING | RRSP | RETIREMENT PLANNING

**રસોઈ કામ માટે બહેનની જરૂર છે**  
રસોઈ કામ માટે મારખમ ખાતે ગુજરાતી વેજીટેરિયન, સિલિયર કપલ માટે બહેનની જરૂર છે. અઠવાડિયામાં ઓછામાં ઓછા ૩ દિવસ/અનુકુળ સમય મુજબ. બહેન પાસે પોતાની કાર હોવી જરૂરી. ફક્ત મારખમ, રીયમોન્ડ હીલ, પીકરીંગ અને નોર્થ-ઈસ્ટ ટોરન્ટોના ઉમેદવારે અરજી કરવી. મિસિસાગા, બ્રામ્પ્ટન, ઇટોબિકોના ઉમેદવારે અરજી કરવી નહીં.  
સંપર્ક કરો- 416-846-8002  
11.00 am થી 4.00 pm વચ્ચે અનુકુળ સમય મુજબ

Need mortgage financing?  
Look no further. Let me make it happen.

**RBC Royal Bank**

**BHAVIN PATEL**  
Mobile Mortgage Specialist  
Royal Bank of Canada  
bhavin.patel@rbc.com  
mortgage.rbc.com/bhavin.patel Cell: 647-502-8069  
Serving Greater Toronto Region Fax: 416-253-9461

છેલ્લા ૪૪ વર્ષથી ટોરન્ટોની સર્વ પ્રથમ ગુજરાતી ટ્રાવેલ એજન્સી. ૪૪ વર્ષથી ગુજરાતી પ્રજા અને ગુજરાતી ભાષા અમારી સફળતા માટે યજ્ઞભાગી છે. દિલથી આપની અમે ખૂબજ આભાર માનીએ છીએ. સ્વાઈ મુસાફરી ની ટીકીટ માટે અમારા ભાવ ટોરન્ટોમાં ખૂબજ આકર્ષક છે અજમાવી જુઓ... આપને આનંદ થશે.

**Ashok Travels 416-977-9896** અશોક ટ્રાવેલ્સ ૪૧૬ ૯૭૭ ૯૮૯૬  
Thank you for your continued support since last 44 years. We are glad to be your family travel agency and we feel proud to serve three generations with most competitive prices and excellent service.  
**www.ashoktravel.com**  
Ashok Travels Serving your travel needs in Canada since 1973  
TICO # 1486999 238 Gerrard St. East, Suite 100 Toronto, ON M5A 2E8

✓ Residential  
✓ New Condos  
✓ Investments  
✓ Commercial

**Zakir Patel**  
Broker  
Cell: 416-561-7973  
Office: 416-287-2222

**RE/MAX COMMUNITY**  
Realty Inc., Brokerage  
Independently Owned and Operated  
1265, Morningside Ave. #203  
Toronto, ON M1B 3V9  
Email: patelzakir82@gmail.com

**SS & LAWYERS LLP**

- REAL ESTATE
- LITIGATION
- WILLS AND ESTATES
- AFFIDAVIT AND POWER OF ATTORNEY
- NOTARIZATION
- FAMILY LAW
- CORPORATION / COMMERCIAL TRANSACTIONS
- FRANCHISE CLOSING

1780 ALBION ROAD, UNIT # 8, TORONTO ONTARIO M9V 1C1

**Avni Shah**  
B.A., JD  
Barrister & Solicitor  
ashah@sslawyers.ca  
Tel : 416-818-4000  
Fax : 416-740-4002



# ઓન્ટેરિયોમાં કોવિડના નિયમો પાછા ખેંચવા તૈયારી

શાળા, હોસ્પિટલો અને સારવાર કેન્દ્રોને રસીકરણના કાયદામાંથી મુક્તિ આપશે: છુટછાટ ન આપવા માંગતી હોસ્પિટલને પોતાની વ્યવસ્થા કરવા છૂટ

## ટોરોન્ટો

ઓન્ટેરિયોમાં શાળા, હોસ્પિટલો અને સારવાર કેન્દ્રોને ફરજિયાત રસીકરણ અને ટેસ્ટિંગના નિયમોમાં સોમવારથી મુક્તિ આપવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.

એક અહેવાલ મુજબ હાલમાં ઓન્ટેરિયો ખાતે કોવિડ-19ના માત્ર 228 કેસ સક્રિય છે. કોવિડ-19 દરમિયાન ફરજિયાત રસીકરણની જે નીતિ રાજ્યમાં લાગુ કરવામાં આવી હતી, તે પાછી ખેંચવાની પાછળનું મુખ્ય કારણ એક ટોન્સના ડોક્ટરનો

## કોરોનાને કારણે કોઈ નવા મોત નોંધાયા નહીં

સોમવાર સુધીમાં કોરોનાને કારણે કોઈ નવા મોત થયા હોય એવા કોઈ અહેવાલ મળ્યા નથી. પ્રથમ વખત એક મૃત્યુ આ વર્ષની શરૂઆતમાં નોંધાયું હોવાનું જાણવા મળ્યું હતું. મોતના સત્તાવાર આંકડા 12256 હોવાનું જાણવામાં આવ્યું છે. રાજ્ય સરકારે હાલમાં જ કોવિડ-19 સંબંધી મૃત્યુ કઈ રીતે નક્કી કરવું તેની પદ્ધતિમાં ફેરફાર કર્યો છે. હવે પછી થનારા મોતના આંકડામાં ત્રણ વિભાગમાં વેંચવામાં આવશે. જેમાં કોવિડ-19ના કારણે થયેલા મોત, અજાણ્યા કારણસર થયેલા મોત અથવા ગુમ થયેલી વ્યક્તિને મૃતક ગણી લેવામાં આવશે. અન્ય 1016 નવા આંકડાઓ કોવિડથી મોત થયું હોવાનું સૂચન કરે છે. જે કે, આરોગ્ય ખાતાના અધિકારીઓને આ અહેવાલથી થોડી ચિંતા થઈ છે.

અહેવાલ છે. ઓન્ટેરિયો કોવિડ-19ના ફરજિયાત નિયમો પાછા ખેંચી લેવાની તૈયારીમાં છે. તેનો અર્થ તે થયો કે રાજ્યની પરિસ્થિતિમાં ધીરે-ધીરે સુધારો થઈ રહ્યો છે અને કોવિડ-19નો

વાયરસ નાબૂદ થઈ રહ્યો છે. એ જોતા એપ્રિલ 27 સુધીમાં કોવિડ-19 સંબંધી ફરજિયાત રસીકરણ જેવા નીતિગત નિયમો પાછા ખેંચી લેવામાં આવે તેવી શક્યતા છે. શાળાઓ માટે મુખ્ય

જરૂરિયાત આરોગ્યની કાળજી લેવાનું છે અને આ માટે હોસ્પિટલોને વધુ સુસજ્જ કરાઈ રહી છે. હોસ્પિટલોમાં પણ કોવિડ-19 રસીકરણની નીતિ ફરજિયાત કરવામાં આવી હતી. હોસ્પિટલમાં જે

કર્મચારીઓએ રસી ના મુકાવી હોય તેના માટે ફરજિયાત ટેસ્ટિંગની જોગવાઈ પણ સોમવારથી પડતી મુકવામાં આવશે. જો કે, કોઈ એક સંસ્થા આવી નીતિનો અમલ કરવા ઈચ્છતી હશે તો તે માટે હોસ્પિટલમાં અલગથી વ્યવસ્થા કરી શકશે. સાથે જ ત્યાં ફરજિયાત નિયમોનો ચુસ્ત અમલ કરાવી શકશે. દરમિયાન આરોગ્ય મંત્રાલયના આંકડા જણાવે છે કે, સોમવારના દિવસે આઈસીયુમાં 228 દર્દીઓ હતા. જો કે, મહત્વની વાત એ છે કે, બધી જ હોસ્પિટલના આંકડાઓ વેબસાઈટ ઉપર ઉપલબ્ધ નથી.

## કેનેડામાં આગામી એપ્રિલ માસથી કેન્દ્રીય કર્મચારીના લઘુત્તમ વેતનમાં વધારો થશે

કામદારોને પ્રતિ કલાકના 15.55 ડોલર આપવા નિર્ણય

## ટોરોન્ટો

રોજગાર અને વિકાસ કેનેડા (ઈએસડીસી)એ જાહેરાત કરી હતી કે, કેન્દ્ર સરકાર ૧લી એપ્રિલથી લઘુત્તમ વેતન વધારીને ૧૫.૫૫ ડોલર કરશે. કેન્દ્ર સંચાલિત ઉદ્યોગો જેવાં કે બેંકો, ટપાલ સેવા, આંતરરાજ્ય પરિવહન અને ફેડરલિકાઉન કોર્પોરેશનના કર્મચારીઓને કેન્દ્રીય લઘુત્તમ વેતન ધારો લાગુ પડે છે. જે કામદારો ઉદ્યોગોમાં કામ કરતાં હોય અને કેન્દ્ર

સંચાલન ન કરતું હોય એવાં કામદારોને રાજ્યોનો લઘુત્તમ વેતન ધારો લાગુ પડે છે. ઈએસડીસી એ જણાવ્યું હતું કે, સ્ટેટીટિક્સ કેનેડાના કહેવા મુજબ લઘુત્તમ વેતનમાં 55 સેન્ટના વધારાને કારણે વર્ષ ૨૦૨૧ના વાર્ષિક ઉપભોક્તા સૂચકાંકોમાં સરેરાશ ૩.૪ ટકાનો વધારો થશે. રાજ્યો અને પ્રાદેશિક લઘુત્તમ વેતનના દરો ઉચા છે. હાલમાં ન્યુનતમ વેતન ૧૬ ડોલર પ્રતિ કલાક છે. યુકોન પણ ૧લી એપ્રિલથી લઘુત્તમ વેતન

વધારીને ૧૫.૭૦ ડોલર પ્રતિ કલાક કરશે. પીઆઈ સહિત, ન્યુબ્રુન્સવીક, ન્યુ ફાઉન્ડેન્ડ એપ્રિલ ૧ લીથી લઘુત્તમ વેતનમાં વધારો અમલમાં મૂકશે અને લાબ્રાડોર, નોવાસ્કોટીયા, ઓન્ટેરિયો ૧લી જાન્યુઆરીથી પ્રતિ કલાક ૧૫ ડોલર લઘુત્તમ વેતન કરશે. જ્યારે ૧લી મેથી ક્યૂબેક લઘુત્તમ વેતન વધારીને ૧૪.૨૫ ડોલર કરશે. જો કે, એવી દલીલો પણ કરવામાં આવે છે કે આ વેતનવધારો પુરતો નથી.

## રોડ અકસ્માતમાં 5 ભારતીય વિદ્યાર્થીઓના મોત, 2 ઘાયલ

## ટોરોન્ટો

કેનેડાના ટોરંટો ખાતે એક ગમખ્વાર રોડ અકસ્માતની ઘટના સામે આવી છે. આ અકસ્માતમાં 5 ભારતીય વિદ્યાર્થીઓના મોત થયા છે જ્યારે અન્ય 2ને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. સ્થાનિક મીડિયાના કહેવા પ્રમાણે વાન અને ટ્રેક્ટર ટ્રેલરની ટક્કર બાદ આ અકસ્માત થયો હતો. કેનેડામાં હાઈ કમિશનર અજય બિસારિયાએ જણાવ્યું કે, આ ઘટના 13 માર્ચના રોજ બની હતી. ટોરંટો પાસે થયેલા આ અકસ્માતમાં 5 ભારતીય વિદ્યાર્થીઓના મોત થયા હતા. તે સિવાય અન્ય બે ઘાયલ થયા છે. ટોરંટો ખાતે ભારતીય

કોન્સ્યુલેટ જનરલ ટીમ મદદ માટે મૃતક વિદ્યાર્થીઓના મિત્રોના સંપર્કમાં છે. આ અકસ્માતમાં હરપ્રીત સિંહ, જસપિન્દર સિંહ, કરણપાલ સિંહ, મોહિત ચૌહાણ અને પવન કુમાર નામના ભારતીય વિદ્યાર્થીઓના મોત થયા હતા. મૃતકોની ઉંમર 21થી 24 વર્ષની વચ્ચે જણાવવામાં આવી રહી છે. તમામ મૃતક વિદ્યાર્થીઓ ગ્રેટર ટોરંટો અને મોન્ટ્રીયલ વિસ્તારના હોવાનું સામે આવ્યું છે. સ્થાનિક મીડિયાના જણાવ્યા અનુસાર, અકસ્માત શનિવારે સવારે ૩.45 વાગ્યે હાઈવે-401 પર થયો હતો. પોલીસે જણાવ્યું કે અન્ય 2 વિદ્યાર્થીઓને ગંભીર હાલતમાં હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

## ફ્લાઈટમાં સવારી કરનારા ફીડમ કોન્વોયના સમર્થકોના વેક્સિનેશન અંગે તપાસ શરૂ થઈ

## ટોરોન્ટો

કહેવાતા ફીડમ કોન્વોયના સમર્થકોને ગત મહિને એક ચાર્ટર્ડ ફ્લાઈટમાં પશ્ચિમ કેનેડાથી ઓટાવા લાવવામાં આવ્યાં, ત્યારે તેમણે પ્રવાસીઓની સલામતી માટે કોવિડ-૧૯ની રસી મૂકાવી હતી કે કેમ ? તેની તપાસ ટ્રાન્સપોર્ટ કેનેડા કરી રહ્યું છે.

ફ્લાઈટમાં પ્રવાસીઓમાંથી કેટલાકે જણાવ્યું હતું કે, કેટલાક લોકોએ પ્રવાસ શરૂ કરતાં પહેલાં વેક્સિનેશનના જરૂરી પુરાવા રજૂ ન કરી કેન્દ્ર સરકારના ફરજિયાત રસીકરણના કાયદાઓનો ભંગ કર્યો છે. જે બાદ આ ઘટના અંગે ટ્રાન્સપોર્ટ કેનેડાને જાણ કરવામાં આવી હતી. ટ્રાન્સપોર્ટ કેનેડા એર ટ્રાન્સપોર્ટ ઓપરેટરો સાથે તપાસ કરી

રહ્યું છે એમ ટ્રાન્સપોર્ટ કેનેડાના પ્રવક્તા સાઉ સાઉ લી એ એક ઈ મેઈલ મેસેજ દ્વારા જણાવ્યું હતું. સાસ્કેચવાનના ચેડ ઈરોલે જણાવ્યું હતું કે, આ સુપર પાવર પ્રાઈવેટ પ્લેન ન હતું. ઈરોલે ફિડમ ૨૦૨૨ હુમન રાઈટ્સ એન્ડ ફીડબેકના કાર્યવાહક સહાયક તરીકે પોતાની ઓળખ આપી હતી. ટ્રાન્સપોર્ટ કેનેડાએ જણાવ્યું હતું કે, ચાર્ટર્ડ ફ્લાઈટના કેનેડીયન હવાઈ મથક ઉપર તમામ પ્રવાસીઓએ ફ્લાઈટમાં પ્રવેશતા પહેલાં કોવિડ-૧૯ની રસી મુકાવી હોવાના પુરાવા ફરજિયાત રજૂ કરવા જરૂરી છે અને આ કાયદો વ્યાપારી પ્રવાસીઓને લઈ જતી વિમાની સેવા માટે હોવાથી દરેકે કોવિડ- ૧૯ના કાયદાનું ફરજિયાત પાલન કરવું અનિવાર્ય છે.

## THINKING OF BUYING, SELLING OR INVESTING?

### આપના વિશ્વાસુ અને ભરોસાપાત્ર

અમારી રીયલ એસ્ટેટ અને ઇન્વેસ્ટમેન્ટની મફત સલાહ નો લાભ ઉઠાવવા માટે આજે જ સંપર્ક કરો.  
મોટી ગેજ જોઈએ છે? અમે મદદ કરી શકીએ છીએ!

## CALL 416 893 4585 TODAY!!!

**SUBHRO CHAKRABORTY**  
SALES REPRESENTATIVE

**SUDHIR PARMAR**  
SALES REPRESENTATIVE

Call us **TODAY** for all of your Real Estate needs and get honest, reliable and professional Service you can count on.

**MOHAMMAD ABOWATH**  
SALES REPRESENTATIVE

**MAAZ ABOWATH**  
BROKER - TEAM LEADER

**IBRAHIM ABOWATH**  
SALES REPRESENTATIVE

## 416 893 4585

# ABOWATH

## REAL ESTATE GROUP

VALUING RELATIONSHIPS OVER TRANSACTIONS EVERY SINGLE TIME!

**ABOWATH.COM**

**RE/MAX**  
#1 with ABOWATH your Local REALTOR

## કથા, હવન, ગાયત્રી યજ્ઞ, વાસ્તુ પૂજન, શ્રાદ્ધશાંતિ,

જીટીએમાં દરેક જગ્યાએ અમો સેવા આપીએ છીએ.

શશીકાંત ભટ્ટ

૯૦૫ ૪૫૬ ૭૬૨૨

કાલસપે યોગ શાંતિ, નક્ષત્ર શાંતિ, વગેરે ધાર્મિક કાર્યો અને લગ્ન, બેબી શાવર, જેવા કાર્યો માટે સંપર્ક કરો.

Shashikant Bhatt

Home: 905-456-7622

Cell: 416-258-2750

# ટોરોન્ટોના સૌથી જૂના મંદિરનો દોઢ મિલિયન ડોલરના ખર્ચે થશે જીર્ણોદ્ધાર

મંદિરના બહારના ભાગને ઉંચા શિખરમાં રૂપાંતરીત કરી વધુ સુવિધા ઉભી કરાશે

## ટોરોન્ટો

૨૦૦૪માં જ્યારે ગૌરી શર્મા પહેલી વાર ભારતથી ટોરોન્ટો આવી ત્યારે પોતાના સમાજના લોકો સાથે જોડાવા માટે આતુરતાથી હિંદુ મંદિરની શોધ કરી રહી હતી. આ સમયે તેની નજર ખુલ્લા મંદિરો પૈકી એક હિંદુ પ્રાર્થના સમાજ પર પડી. પરંતુ એની જેમ જ અન્ય લોકોને એવું લાગવા માંડ્યું કે આ તો મંદિરને બદલે ચર્ચ જેવું જ લાગે છે. એટલે એ પણ ત્યાં આવીને પાછી ફરી ગઈ હતી.

ઓન્ટેરિયોના આર્કિટેકચરલ કન્ઝર્વેન્સી મુજબ હિંદુ પ્રાર્થના સમાજ મંદિર શહેરમાં સૌથી જૂનું અને ઉત્તર અમેરીકામાં સૌથી જૂનું મંદિર છે. તેણે લગભગ અડધી સદીથી ભારતીય ડાયસ્પોરાની સેવા કરી છે. તેની સ્થાપનાના દાયકાઓ બાદ ભક્તો કહે

છે કે તેઓ એ સાંભળીને ખુશ થયા છે કે આખરે એ મંદિર ટૂંક સમયમાં જ ભારતીય મંદિર જેવું બનશે.

મંદિરના ફેસબુક પેજ અનુસાર આ પ્રોજેક્ટ પાછળ ૧.૫ મિલિયન યુએસ ડોલરનો ખર્ચ થશે. બહારના ભાગને ઉંચા શિખરમાં રૂપાંતરીત કરાશે અને વધુ સુવિધાઓ ઉભી કરાશે. નવા પ્રાર્થના ખંડ અને ડાઈનીંગ એરીયાને ઉંચો બનાવી સુવિધાજનક કરવામાં આવશે.

શર્માના જણાવ્યા મુજબ કેનેડામાં ભારતીયોની એકતા અને માતૃભૂમિની સંસ્કૃતિને જોડવા માટે મંદિર જરૂરી છે. એટલે જ એ પોતાના ચાર વર્ષના પુત્ર ધ્રુવને લઈને આવી છે.

જેથી એ પણ પોતાની જેમ કરી શકે. ધ્રુવે કહ્યું કે અમે ભારતથી ઘણાં દૂર હોવા છતાં ખરેખર ભારતીય સંસ્કૃતિ

સાથે જોડાવા માટે ધર્મ સાથે જોડાવું પણ જરૂરી છે. હું કેનેડાને માંડું બીજું ઘર માનું છું. એટલે ગમે ત્યારે હું ત્યાં જઈ શકું અને પ્રાર્થના કે ધ્યાન કરી શકું અથવા અન્ય કોઈ પ્રવૃત્તિ કરી શકું. તે માને છે કે, મંદિરના નવીનીકરણ પછી નવા ભક્તો મંદિરની મુલાકાત લેવા પ્રેરાશે. આ એક સામુદાયિક સ્થળ છે. તમારો ધર્મ કોઈપણ હોય તમે અમારી સાથે હંમેશા જોડાઈ શકો છો. ૧૯૮૬થી મંદિરના સમર્પિત ભક્ત નરેશ ઠાકુરે સૌ પ્રથમ રસોડામાં સ્વયંસેવક તરીકે કામ કર્યું હતું. હવે તે સેક્ટરી જનરલ બન્યા બાદ કહે છે કે, મંદિરની સ્થાપના પછીના દાયકાઓમાં ચાર વર્ષના આયોજન બાદ હવે જિર્ણોદ્ધારનું કામ હાથ ધરાવ્યું છે. એનાથી સમુદાય ઉત્સાહમાં છે. હવે અમારું સ્વપ્ન સાકાર થવા જઈ રહ્યું છે.

# કેનેડાની સંસદને સંબોધન કરતા યુકેનના રાષ્ટ્રપતિ યુકેન પર થતા હુમલા રોકવા કેનેડા તેનું એર સ્પેસ બંધ કરે : ઝેલેન્સ્કી

## ટોરોન્ટો

યુકેનના રાષ્ટ્રપતિ વોલ્ડીમીર ઝેલેન્સ્કીએ મંગળવારે કેનેડાની સંસદને સંબોધન કરતી વખતે વિનંતી કરી હતી કે, રશિયા સાથેના યુદ્ધમાં તેમના પર થઈ રહેલા હુમલાઓને રોકવા કેનેડાએ પોતાની એર સ્પેસ બંધ રાખવી જોઈએ.

વરચ્યુઅલ સંબોધનમાં તેમણે યુકેનના ધ્વજ અને આર્મી સ્વેટરમાં સજજ થઈ કેનેડાના હાઉસ ઓફ કોમન્સને અને સેનેટને કહ્યું હતું કે, આપણે મિત્રો છીએ જસ્ટીન. પણ હું માનું છું કે, તમે અમારી સ્થિતિને સારી રીતે સમજી શકો છો અને અમે જે દરરોજ અનુભવીએ છીએ એ તમે પણ અનુભવતા હશો. અમે જીવવા માંગીએ છીએ અને જીતવા પણ માંગીએ છીએ. એવા સમયે મિત્ર રાષ્ટ્ર સાથે વાત કરવાની આવે તો અમે તો વિનંતી જ કરી શકીએ છીએ કે મહેરબાની કરીને તમારી સ્કાય સ્પેસ બંધ કરી દો તો કદાચ અમારા

પર થઈ રહેલા મિસાઈલ હુમલા અટકી શકે. ક્યાં સુધી યુકેનના શહેરો પર બોમ્બ વર્ષા થતી રહેશે. નાટોને પણ અમે વિનંતી કરીએ છીએ કે, યુકેનની એર સ્પેસને નો ફલાય ઝોન જાહેર કરે. પરંતુ કેનેડાએ પણ અન્ય સહયોગી દેશોની જેમ આ વિનંતીનો વિરોધ કર્યો છે. કારણ કે, તેમને ડર છે કે આમ કરવાથી કદાચ તેમને રશિયા સાથે સીધી લડાઈની સ્થિતિમાં ઉતરવું પડી શકે છે. વીસ મિનીટના સંબોધનમાં ઝેલેન્સ્કીએ કેનેડાને તેના સૈન્ય અને માનવતાવાદી પ્રતિભાવવાળા પ્રયાસો ચાલુ રાખવા આહવાન કર્યું હતું. આમ કહી તેમણે રશિયાના યુદ્ધની વાસ્તવિકતાનો ચિતાર આપ્યો હતો અને યુકેનને મદદ કરવાની અપીલ પણ કરી હતી. તેમણે પુછ્યું હતું કે શું કેનેડીયનો તેમના શહેરમાં બોમ્બ વિસ્ફોટોની કે એનાથી સર્જાતી સ્થિતિની કલ્પના કરી શકે છે. જ્યાં નાના બાળકો અને વૃદ્ધોની સ્થિતિ વિશે વિચારી શકે છે.

# ધર્મપ્રચાર ક્ષેત્રે વિશેષ યોગદાન બદલ જીતુ સોમપુરાને એવોર્ડ

નાસિક ખાતે યોજાયેલા સમારોહમાં પત્રકાર સોમપુરાનું સન્માન કરાયું મુંબઈ



મુંબઈના પત્રકાર જિતુ સોમપુરાને ધર્મપ્રચાર ક્ષેત્રે વિશેષ યોગદાન માટે 'રાષ્ટ્રીય પત્રકાર ભૂષણ એવોર્ડ'થી સન્માનિત કરાયા હતા. નાસિકના 'દર્પણકાર બાલશાસ્ત્રી જાંબેકર પત્રકાર સંઘ' આયોજિત 'રાષ્ટ્રીય સેવા ગૌરવ એવોર્ડ' વિતરણ સમારોહમાં તેમને આ એવોર્ડ પ્રદાન કરવામાં આવ્યો હતો.

તાજેતરમાં નાસિક ખાતે આયોજિત સંઘના અધ્યક્ષ મહેન્દ્ર દેશપાંડેના નેતૃત્વમાં યોજાયેલા સમારોહમાં સંઘના અધ્યક્ષ મહેન્દ્ર દેશપાંડે, પૂનમ બિરારી, મરાઠી અભિનેત્રી સુરેષા લહામગે શર્મા હાજર હતાં. આ તકે વિવિધ ક્ષેત્રના પ્રતિભાવંતોને એવોર્ડ અર્પણ કરી તેઓનું બહુમાન કરાયું હતું. જેમાં જિતુ સોમપુરાએ પ્રિન્ટ મિડિયામાં 'જન્મભૂમિ' દૈનિક અને 'સુખ શાંતિ સમૃદ્ધિ' હિંદી

ઈ-પત્રિકા તથા ઈલેક્ટ્રોનિક મિડિયાની વિવિધ ધાર્મિક ચેનલોમાં કરેલી કામગીરીની નોંધ લઈ એવોર્ડ માટે તેમની પસંદગી કરાઈ હતી. ધાર્મિક ચેનલોના આરંભમાં મહત્વનું યોગદાન આપનારાઓમાં એમનો સમાવેશ થતો હતો. તેઓ પત્રકારત્વમાં છેલ્લાં 46 વર્ષથી કાર્યરત છે. વર્તમાનમાં તેઓ 'સુખ શાંતિ સમૃદ્ધિ' હિંદી ઈ-પત્રિકાના સંપાદક છે. તેઓ ગુજરાતના ભજનોના ઈતિહાસ અંગેના 50 કલાકના વિડિયો મેંગેઝિનના કાર્યકારી નિર્માતા અને દિગ્દર્શક છે. 'પીસ ઓફ માઈન્ડ ચેનલ' માટે 450થી વધુ પ્રેરક એપિસોડ બનાવ્યા છે, જેમાં બ્રહ્માકુમારી બહેનોની મુલાકાત ઉપરાંત 200થી વધુ સાધુ-સંતોની મુલાકાતના અંશો પણ છે. એમણે ચાર ધાર્મિક પુસ્તક લખ્યાં છે.

# કેનેડા કન્ઝર્વેટીવ પાર્ટીના નેતા પદની ચૂંટણીમાં પેટ્રિક બ્રાઉને પણ અંપલાવ્યું

બ્રામ્પટન અને ઓન્ટેરિયોથી ચૂંટણીપ્રચારની શરૂઆત કરાઈ

ઓન્ટેરિયો પેટ્રિક બ્રાઉને સત્તાવાર રીતે કન્ઝર્વેટીવ પાર્ટીના આગામી નેતા તરીકેની ચૂંટણીમાં અંપલાવ્યું છે. તેમણે બ્રામ્પટન અને ઓન્ટેરિયોમાં રવિવારે સવારથી તેના પ્રચારની શરૂઆત કરી હતી. પીટર બ્રાઉને તેની એક જાહેરાતમાં જણાવ્યું હતું કે, આગળ રહેવા માટે ભૂતકાળમાં મેં ઘણો સંઘર્ષ કર્યો છે. બ્રાઉને પોતાની જાતને એક એવા ઉમેદવાર તરીકે જાહેર કર્યા હતા કે જેમનો ઉછેર કન્ઝર્વેટિવની વચ્ચે થયો છે અને સામાન્ય ચૂંટણીઓમાં તેણે વિજય મેળવ્યો છે. તેમણે પોતાની ક્ષમતાનો પણ પરિચય પણ આપ્યો હતો. તેમણે પોતાના ટેકેદારોને જણાવ્યું હતું કે, પક્ષની એકતા અને પ્રગતિ માટે તમારા ટેકાની જરૂરિયાત છે.



સાંસદ તરીકેની કન્ઝર્વેટિવ પાર્ટીની ટિકિટ પર 2008 થી 2015ના સમયગાળા દરમિયાન ચૂંટાઈ આવ્યા હતા. રાજ્યનું રાજકારણ છોડતા પહેલા અને પ્રોગ્રેસિવ કન્ઝર્વેટિવના નેતા બનવા માટે તેમણે રાજ્યના રાજકારણને છોડી દીધું હતું. ત્યારબાદ તેઓ 2018માં બ્રામ્પટનના મેયર તરીકે ચૂંટાઈ આવ્યા હતા.

ઓન્ટેરિયો પ્રોગ્રેસિવ કન્ઝર્વેટિવમાં બ્રાઉને પોતાની ભૂમિકા ફરીથી મેળવી લીધી હતી. આ પહેલા તેમના પર જાતીય સતામણી તથા ગેરવર્તણુકના આરોપ

મુકવામાં આવ્યા હતા અને તે સ્ટોરી મીડિયામાં 2018માં સતત ચાલી હતી. તેમણે પોતાના ઉપર કરવામાં આવેલા તમામ આક્ષેપો ફગાવી દીધા હતા. સાથે જ આક્ષેપ કરનારા ઉપર માનહાનિનો દાવો કર્યો હતો. બ્રોડકાસ્ટર તરફથી એક નિવેદન બ્રોડકાસ્ટ કરવામાં આવ્યું હતું અને જેમાં મીડિયાએ ખેદ વ્યક્ત કરતા જણાવ્યું હતું કે, બ્રાઉને વિશેના કેટલાક આક્ષેપો સત્યથી વેગળા હતા અને તેમના માટેના કોઈ પુરાવા મેળવી શકાય નહોતા. હવે બ્રાઉને ફરી રાજકારણમાં સક્રિય થયા છે. પાર્ટીના નેતા પદની રેસમાં તેઓ એવા સમયે જોડાયા છે કે જેમાં હાઈ પ્રોફાઈલ નેતાઓ પણ કન્ઝર્વેટિવ પાર્ટીનું નેતૃત્વ મેળવવાની સ્પર્ધામાં ઉતર્યા છે. આ નેતાઓમાં ક્યૂબેકના પ્રીમિયર જિન કાર્સ્ટ અને કન્ઝર્વેટિવ સંસદ લેસલીન લુઈસ, પિયરે પોલીવર પણ સામેલ છે.

# મકાનોની સરેરાશ કિંમત 8,16,720 ડોલર

સમગ્ર કેનેડામાં 2021 કરતા મકાનની કિંમતમાં 20%નો વધારો

## ટોરોન્ટો

કેનેડામાં ફેબ્રુઆરી મહિના દરમિયાન મકાનોની સરેરાશ કિંમત વધીને 8,16,720 ડોલર ઉપર પહોંચી હતી. જે વિક્રમજનક સપાટી ઉપર પહોંચી છે, એમ કેનેડિયન રિયલ એસ્ટેટ એસોસિયેશન તરફથી જણાવવામાં આવ્યું હતું. 1 લાખથી વધુ રીલેટર્સનું પ્રતિનિધિત્વ કરતી આ સંસ્થાએ મંગળવારે જણાવ્યું હતું કે, આ બીજો ફેબ્રુઆરી મહિનો એવો રહ્યો કે, જેમાં મકાનની કિંમતમાં સતત ભાવ વધારો જોવા મળ્યો. ઉપરાંત મકાનના વેંચાણ પણ ગયા વર્ષ કરતા સૌથી વધુ થયા અને વધુ કિંમતે વેંચાણ થયું. આ વખતે 98309 મકાનોની ફેર-બદલ થઈ હતી અને એ મહિનામાં એફોર્ડેબલ હાઉસિંગની યાદીમાં વધુ ઉમેરો થયો હતો. આ વધારો સૂચવે છે કે માર્ચમાં પણ મકાન બજારમાં હજુ વધી તેજ જોવા મળશે. હાલમાં મકાનની સરેરાશ કિંમત 816720 ડોલર છે જે ગયા વર્ષની સપાટી કરતા 20% વધુ છે. બીજી તરફ સીઆરઈ એ જણાવ્યું હતું કે, મકાનની વેંચાણ કિંમતમાં જે વધારો થયો છે તે ગેરમાર્ગે દોરનારું છે અને વેંચાણમાં કંઈક ગરબડ કરવામાં આવી છે. બજારમાં આટલી તેજ આવે તેવી શક્યતા હાલના તબક્કે જણાતી નથી. આમ



છતાં ટોરોન્ટો અને વાનકુવરમાં મકાનોની સરેરાશ કિંમતમાં વધારો જોવા મળ્યો હતો. સરેરાશ છૂટક કિંમતની ખાસ નોંધ રાખવામાં આવતી નથી અને તેથી મકાન જ્યારે એક હાથમાંથી બીજા હાથમાં જાય ત્યારે મકાનની કિંમતમાં કોઈક ખેલ કરવામાં આવે છે. પરંતુ તે ગણિત પણ તેની વધુ ઝડપે આગળ વધી રહ્યું છે અને ગયા વર્ષ કરતા 29% ઉંચા ભાવે મકાન વેંચાયા હતા. ત્યારે 3.5%નો સરેરાશ વધારો થયો હતો. ખાસ કરીને આ વધારો પણ ફેબ્રુઆરી મહિનામાં જ જોવા મળ્યો હતો જે આ મોટો માસિક અને વિક્રમજનક કૂદકો હતો.

# ફોર્ટ મેકમરેની પેટાચૂંટણીમાં કન્ઝર્વેટીવ પાર્ટીના ઉમેદવાર બ્રિયાન જેનનો વિજય

- પરિણામની સત્તાવાર જાહેરાત રપમી માર્ચે કરવામાં આવશે ફોર્ટ મેકમરે

લેક લા બિચેની પેટા ચૂંટણીમાં યુનાઈટેડ કન્ઝર્વેટિવ પાર્ટી (યુપીસી)ના ઉમેદવાર બ્રિયાન જેનની સરળ જીત થઈ હતી. મંગળવારે રાત્રે જ્યારે પરિણામ જાહેર થયું ત્યારે સ્પષ્ટ થઈ ગયું કે, અલ્બર્ટાના પ્રીમિયર જેસન કેસ્ટ્રીને પક્ષના નેતા પદેથી હટાવવાના તેમનું લક્ષ્ય તેમણે હાંસલ કરી લીધું છે. જેન વિલ્ડ્રોસ પાર્ટીના ભૂતપૂર્વ નેતા છે. તેમણે ૬૩.૬ ટકા મત મેળવીને ઝળહળતો વિજય મેળવી લીધો હતો. તેમણે ૩,૭૧૪ મત મેળવ્યા હતા અને યુસીપીના ઉમેદવારને જીતાડ્યા હતા. એનડીપીના ઉમેદવાર

એરીયાના મેનસીનીને તેમણે ૧૦૮૧ મતથી પાછળ રાખી દીધા હતા. કેમ કે જેને ૧૮.૪ ટકા વધુ મત મેળવી લીધા હતા. જ્યારે વિલ્ડ્રોસ ઈન્ડીપેન્ડન્સ પાર્ટી ઓફ અલ્બર્ટાના ઉમેદવાર પોલ હિનમેને ત્રીજા ક્રમે રહીને ૧૧ ટકા મત મેળવી લીધા હતા.

આ પેટાચૂંટણીમાં કુલ ૫૮૦૦ લોકોએ મતદાન કર્યું હતું. જો કે, ચૂંટણીના પરિણામની સત્તાવાર જાહેરાત રપમી માર્ચે કરવામાં આવશે. જીત બાદ જેણે જે પ્રતિક્રિયા આપી એ સ્પષ્ટ કરતી હતી કે, એનો આશય કેસ્ટ્રીને પક્ષપ્રમુખપદેથી હટાવવાનો જ હતો. નવમી એપ્રિલ પાર્ટીની બેઠકમાં નવા નેતાની વરણી થશે. જોકે વિજેતા જેનની ધારાસભ્ય તરીકેની શપથવિધિ પણ પાંચમી એપ્રિલ સુધીમાં જ થશે.



તંત્રી સ્થાનેથી

# પાંચ રાજ્યોમાં રક્ષા સાથે કોંગ્રેસ હવે મરણ પથારીએ

ઉત્તર પ્રદેશ અને પંજાબ સહિત પાંચ રાજ્યોમાં યોજાયેલી ચૂંટણીમાં કોંગ્રેસને મળેલી ધોબીપછડાટ પછી ફરીવાર મનોમંથનને



તંત્રી - પ્રકાશક સ્વદેશ

નામે નાટક ભજવાયું, ચૂંટણીમાં કારમી હારની સમીક્ષા સાથે ચર્ચા વિચારણા કરવા કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક પણ યોજાઈ. પરંતુ બે બેઠકમાં રાબેતા મુજબ ધીના ઠામમાં ધી પડી ગયું. આ બેઠકમાં નહેરૂ-ગાંધી ખાનદાનના

સોનિયા, રાહુલ અને પ્રિયંકાની ત્રિપુટી પર ભારે પસ્તાળ પડશે એવી વાતો ચાલતી હતી. કિન્તુ તેવું કાંઈ જ ન થયું. ઉલટાનું કોંગ્રેસના નેતાઓએ ફરી નહેરૂ-ગાંધી ખાનદાનને જ પાર્ટીની બાગદોર સોંપવા ચાપલૂસી કરી. સોનિયા ગાંધીએ કોંગ્રેસના હિતમાં સોનિયા, રાહુલ અને પ્રિયંકા ત્રણેય રાજ્યોમાં ધરી દેવાની તૈયારી બતાવી હતી. પરંતુ સામે સોનિયાના વફાદારોએ સોનિયાને રાજ્યોમાં નહીં આપવા આજીજી કરી. ભારે રિસામણાં-મનામણાં પછી છેવટે સોનિયા ગાંધીને જ પ્રમુખ પદે ચાલુ રખાયા. આશ્ચર્યજનક રીતે સીડબલ્યુસીની બેઠક પછી કોંગ્રેસે સત્તાવાર રીતે આપેલા નિવેદનમાં સ્પષ્ટ કર્યું કે, ચૂંટણીમાં મળેલી શિક્ષા માટે સોનિયા, રાહુલ અને પ્રિયંકા એમાંથી કોઈની જવાબદારી નથી. સાથે જ ચૂંટણીમાં મળેલી પછડાટ બદલ આખી જવાબદારી સીડબલ્યુસીએ સ્વીકારી છે. સીડબલ્યુસીએ કોંગ્રેસમાં સંગઠનની ચૂંટણી ના થાય ત્યાં સુધી સોનિયાને પ્રમુખપદે ચાલુ રહેવા પણ વિનંતી કરી છે. પાંચ રાજ્યોમાં કારમી હાર પછી પણ કોંગ્રેસના નેતાઓને કોઈ ફરક નથી પડ્યો એવું કાર્યકરોને ના લાગે એટલે મનોમંથન કરવા માટે ચિંતન શિબિર બોલાવવાની જાહેરાત કરાઈ. પણ એ સિવાય બીજું કશું નવું આ બેઠકમાં ના થયું.

કોંગ્રેસનું આ વલણ આઘાતજનક છે. આ વાતનો પુરાવો એ છે કે કોંગ્રેસ ભૂતકાળમાંથી કશું શીખી જ નથી. લોકસભાની ૨૦૧૪ની ચૂંટણીમાં નરેન્દ્ર મોદી સામે મળેલી કારમી હાર પછી કોંગ્રેસના હાથમાંથી એક પછી એક રાજ્ય સરકારી રહ્યાં છે. દરેક રાજ્યમાં હાર પછી કોંગ્રેસ મનોમંથન માટે બેઠકો તો બોલાવે છે. પરંતુ તે પછી કામગીરી થતી નથી એટલે પરિણામ શૂન્ય રહે છે.

૨૦૨૨માં યોજાયેલી પાંચ રાજ્યોની ચૂંટણી પહેલાં રાહુલ અને પ્રિયંકાએ ખૂબ જ ખોખારા ખાઈને પ્રજા ભાજપ શાસનથી ત્રાસી ગયાના આરોપો મુક્યા. જોરશોરથી પ્રચાર પણ કર્યો. પરંતુ આમ છતાં મતો મળ્યા નહીં. પાંચ રાજ્યોમાંથી બે રાજ્યો ઉત્તરાખંડ અને પંજાબમાં તો કોંગ્રેસને સત્તા ગુમાવવી પડી છે. પંજાબમાં આમ આદમી પાર્ટીના બુલરોજર હેઠળ કોંગ્રેસનો સફાયો થયો છે. જે રાજ્યોમાં કોંગ્રેસે એકચક્રી શાસન કરેલાં એ રાજ્યોમાં પણ કોંગ્રેસ સાવ ભૂંસાઈ ગઈ છે. ઉત્તર પ્રદેશમાં કોંગ્રેસને વિધાનભામાં માત્ર બે બેઠકો મળી. યુપી સંયુક્ત હનું ત્યારે કોંગ્રેસે લોકસભાની તમામ ૮૫ બેઠકો આ જ પ્રદેશમાં જીતી હતી, ઉપરાંત યુપી વિધાનસભામાં ૪૨૫ બેઠકોમાંથી ૩૦૮ બેઠકો જીતીને પણ કોંગ્રેસે રેકોર્ડ કર્યો હતો. આ જ રાજ્યમાં કોંગ્રેસનો કંગાળ દેખાવ નેતાઓ માટે ઠાંકણીમાં પાણી લઈને ડૂબી મરવા જેવું છે. આ પહેલાં પશ્ચિમ બંગાળ વિધાનસભાની ચૂંટણીમાં તો કોંગ્રેસ ખાતું પણ નહોતી બોલાવી શકી.

કોંગ્રેસની આ હાલત થવાનું કારણ એ છે કે, આખી પાર્ટી રામભરોસે ચાલે છે. કોંગ્રેસ છેલ્લા અઢી વર્ષથી તો સાવ નોંધારી છે. લોકસભાની ચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર પછી રાહુલે

રાજ્યોમાં આપ્યું હતું. ત્યારબાદ કોંગ્રેસ પાસે ફુલટાઈમ પ્રમુખ જ નથી. કાર્યકરોને ફોસલાવવા પ્રમુખપદને મામલે સંગીત ખુરશી રખાયા કરે છે. સોનિયા જાય એટલે રાહુલ આવે અને રાહુલ જાય એટલે પાછાં સોનિયા આવી જાય. દેશની સૌથી જૂની પાર્ટીને આજે સાત વર્ષથી પ્રમુખ પણ મળતા નથી.

અત્યારે સોનિયા પ્રમુખ છે પણ સોનિયા તેના ચમચા અને પોતે જ જીતી ના શકે એવા નેતાઓની સલાહથી ચાલે છે. દિગ્વિજયસિંહ, મલિકાર્જુન ખડગે, અંબિકા સોની વગેરે લોકસભાની ચૂંટણી જીતી શક્યા નથી. આ જ કિમીયાગરો સોનિયાના સલાહકાર છે. બીજી તરફ કપિલ સિબ્બલ તથા મનીષ તિવારી સહિતના અનેક નેતાઓએ અલગ ચોકો તો રચ્યો છે પરંતુ હજુ સુધી તેઓએ કોંગ્રેસથી અલગ થવાની જાહેરાત કરી નથી.

અધીર રંજન ચૌધરી જેવા પોતાના મતવિસ્તારમાં જ કોંગ્રેસને ના જીતાડી શકતા સાંસદ લોકસભામાં કોંગ્રેસ પક્ષના નેતા છે. સોનિયાના બીજા સલાહકારો પણ આવા જ છે. આ જ હાલત રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીના સલાહકારોની છે. વાસ્તવમાં સોનિયા, રાહુલ કે પ્રિયંકા પોતે પણ નેતૃત્વ આપવા સક્ષમ નથી. કોંગ્રેસ ૨૦૧૪ની લોકસભા ચૂંટણી સોનિયા ગાંધીના નેતૃત્વમાં લડી ત્યારે કોંગ્રેસને માત્ર ૪૪ બેઠકો મળી હતી. કોંગ્રેસના ઈતિહાસમાં આટલી ઓછી બેઠકો ક્યારે નથી મળી. પ્રાદેશિક પક્ષો તેના કરતાં વધારે બેઠકો જીતે છે. સોનિયા માટે બીજી રીતે પણ સંજોગો પ્રતિકૂળ છે. રાહુલ ના માનતાં સોનિયા ગાંધીને વચગાળાના પ્રમુખ બનાવાયાં અને પછી ફુલટાઈમ પ્રેસિડેન્ટ બનાવી દેવાયાં પણ સોનિયા હવે પાર્ટીના પ્રમુખ તરીકે સારી રીતે કામ કરી શકે તેમ નથી.

કારણ કે, તેઓ પોતે ૭૪ વર્ષના છે અને તેમની તબિયત ઘણાં સમયથી સારી પણ રહેતી નથી. સોનિયાને ગંભીર બિમારી હોવાથી હોસ્પિટલની આવનજાવન ચાલુ રહે છે. તેના કારણે એ ફુલ ટાઈમ પ્રેસિડેન્ટ બને તો પણ જવાબદારીને યોગ્ય ન્યાય આપી શકે નહીં તે બાબત કમસેકમ કોંગ્રેસના નેતા અને ખુદ ગાંધી પરિવારે સમજવા જેવી છે. ૨૦૧૯માં રાહુલ પ્રમુખ હતા ત્યારે રાજ્યોની ચૂંટણીઓમાં પણ કોંગ્રેસની કારમી હાર થઈ હતી. આ વખતે પણ પંજાબમાં કોંગ્રેસના પ્રચારની કમાન રાહુલ ગાંધીએ સંભાળી હતી. નવજોત સિંધુને પ્રદેશ પ્રમુખ બનાવવાથી માંડીને કેપ્ટન અમરિન્દરસિંહને હટાવીને ચરણજીતસિંહ ચરનીને મુખ્યમંત્રી બનાવવા સુધીના નિર્ણય રાહુલે લીધા હતા. કોંગ્રેસના ઉમેદવાર નક્કી કરવામાં પણ રાહુલની ભૂમિકા મહત્વની રહી હતી. આ સમીકરણો જોતા હવે પંજાબમાં કોંગ્રેસની હારની જવાબદારી રાહુલ ગાંધીએ સ્વીકારવી જોઈએ.

યુપીમાં પ્રિયંકા ગાંધીએ જ કોંગ્રેસના ચૂંટણી પ્રચારથી માંડીને ઉમેદવાર પસંદ કરવા સુધીના નિર્ણય લીધા હતા. છતાં કોંગ્રેસને માત્ર બે બેઠકો મળી. આ વખતે યુપીમાં કોંગ્રેસનો વોટ શેર પણ શરમજનક છે. ફુલ મતદાનના પૂરા ત્રણ ટકા મત પણ કોંગ્રેસને મળ્યા નથી. જ્યંત ચૌધરીની પાર્ટી રાષ્ટ્રીય લોકદળ યુપી વિધાનસભાની ૪૦૩ બેઠકોમાંથી માત્ર ૩૩ બેઠકો પર લડી અને તેનો વોટ શેર ૨.૮૫ ટકા છે જ્યારે કોંગ્રેસને ૪૦૩ બેઠકો પર લડ્યા છતાં માત્ર ૨.૩૩ ટકા મત મળ્યા છે. માત્ર ૧૭ બેઠકો પર લડનારી કેન્દ્રીય પ્રધાન અનુપ્રિયા પટેલની અપના દલ અનુસંધાન પેજ નં. ૧૯ પર

Manoj Gandhi

manoj1968@yahoo.ca

# RE/MAX

## REALTY SERVICES

INC., BROKERAGE

INDEPENDENTLY OWNED AND OPERATED



### JAY PATEL

BROKER

647.241.3818  
jaypatel1323@gmail.com



## "Let Me Make Your Dream Home Into A Reality"

### Residential, Commercial & Investment in Real Estate

Off : 905.456.1000 | Fax : 905.456.1924

295 Queen Street East, Brampton, On., L6W 3R1



## ARISTO PEST CONTROL

Set your mind at rest, we will get rid of the pest

647-339-3926 | aristopest@gmail.com | www.aristopestcontrol.com



✓ Mice

✓ Rat

SAME DAY SERVICE - RESIDENTIAL, COMMERCIAL, INDUSTRIAL



✓ Cockroach

✓ Bedbug

✓ Animal Control

✓ Bird Control

✓ WASPS and

✓ Hive Removal

WE SPEAK ENGLISH, GUJARATI & HINDI



## 24 HRS / 7 DAYS EMERGENCY SERVICES AND ANIMAL REMOVAL

We also provide No Obligation Inspection for Commercial and Residential Clients.

Written Guarantee And Discounted Rates



CALL SANKET TRIVEDI - 647.339.3926  
Government Licensed Structural Exterminator

# સુમુલની બાજીપુરાની દાણ ફેક્ટરીમાં 5 વર્ષમાં રૂ.50 કરોડની જંગી ખોટ

2019-20માં સૌથી વધુ ખોટ : રિપોર્ટમાં દાણ યુનિટ નફો કરતો થાય તે માટે સૂચન કરાયું

**સુરત**

સુમુલ દ્વારા બાજીપુરામાં શરૂ થયેલી દાણ ફેક્ટરીમાં છેલ્લા પાંચ વર્ષમાં અધઘન રૂ.૫૦ કરોડથી વધુ ખોટ થઈ હોવાના સ્પેશિયલ ઓડીટર મિલ્કના રિપોર્ટમાં ઘટસ્ફોટ થતા સહકાર ક્ષેત્રે ખળભળાટ મચી જવા પામ્યો છે. ઓડીટ રિપોર્ટમાં વહીવટી ખામીઓ કાઢી બાજીપુરા યુનિટ નફો કરતું થાય તેવા પગલા લેવા નિર્દેશ કરાયા છે.

સુરત જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ (સુમુલ) દ્વારા તાપી જિલ્લાના

બાજીપુરા ખાતે દાણ ફેક્ટરી આવી છે. અંહિયાથી સુરત અને તાપી જિલ્લાના 2.50 લાખ પશુપાલકોને ખોરાક પહોંચાડાય છે. ફેક્ટરીનું 2015 માં કામ શરૂ કરાયા બાદ આજ સુધી ખોટ કરી રહી હોવાનો રિપોર્ટ આવ્યો છે. આ અંગે સ્પેશિયલ ઓડીટર મિલ્ક પાસે સુમુલના છેલ્લા પાંચ વર્ષના ઓડીટ રિપોર્ટ મંગાયા હતા. રિપોર્ટ મુજબ દાણ ફેક્ટરીમાંથી સને 2016-17 થી લઈને 2020-21 સુધીના પાંચ વર્ષમાં અધઘન રૂ. 50 કરોડથી વધુની ખોટ થઈ છે.

2016-17 વર્ષમાં રૂ.4.04 કરોડની ચોખ્ખી ખોટ ગઈ ત્યારે સુમુલ દાણ ફેક્ટરીમાં રો- મટીરીયલ્સના ભાવોમાં લક્ષમાં લઈ તૈયાર માલના ભાવની સમીક્ષા કરી આગામી વર્ષમાં સદર યુનિટ નફામાં કાર્યવંત થાય તેવું આયોજન કરવા સૂચન આપ્યું હતું. જો કે 2019-20 ના વર્ષમાં સૌથી વધુ 29.11 કરોડની દાણ ફેક્ટરીમાં ખોટ ગઈ હતી. ઓડીટ રિપોર્ટમાં હિસાબમાં ખામીઓ નથી પરંતુ વહીવટી ખામીઓ અને સૂચનો કરાયા છે.

# 360 કરોડના પાવર બેંક કૌભાંડમાં સુરતની ટેક સોફ્ટવેર કંપની સામેલ

**સુરત**

IT કંપનીઓ દ્વારા આચરવામાં આવેલ રૂ. 360 કરોડના પાવર બેંક એપ કૌભાંડમાં સંડોવાયેલી સુરતની 360 ટેક સોફ્ટવેર કંપનીના ડિરેક્ટરો વિરુદ્ધ મંગળવારે રાત્રે ફરિયાદ દાખલ થઈ છે. ડીજીસીઓની સૂચનાથી અમદાવાદની નારણપુરા સ્થિત આરઓસી કચેરીના રજીસ્ટ્રારે નારણપુરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી છે. કંપનીના બન્ને ડિરેક્ટરો સુરત ખાતેની ઓફિસ છોડી ફરાર થઈ ગયા છે.

સરકાર અને ગ્રાહકોને કરોડોનો ચૂનો લગાવનાર અન્ય આઈટી કંપની સાથે સાથે મળેલી 360 ટેક સોફ્ટવેર

કંપનીની પેડ અપ કેપિટલ માત્ર રૂ.10 હજાર અને એક હજાર ઈકવિટી રૂ.10નો એક શેર એવા એક હજાર શેર છે. નારણપુરા અંકુર ચાર રસ્તા પાસે આવેલી આરઓસી કચેરીના રજીસ્ટ્રાર અનુ વિવેકએ 360 ટેક સોફ્ટવેરના ડિરેક્ટર મમતા વણજારા અને વિજય છગન વણજારા (રહે,મગદલા,સુરત) વિરુદ્ધ ગુનો નોંધાવ્યો છે. આરઓસીની તપાસમાં ખૂલેલી વિગતો મુજબ અન્ય કંપનીઓ દ્વારા આચરવામાં આવેલ કૌભાંડમાં સુરતના વેસુ રોડ પર સેન્ટ્રલ બજારમાં આવેલી આઈટી કંપની ટેક સોફ્ટવેર પ્રાઈવેટ લિમિટેડ પણ ગુનામાં સામેલ છે.

## ગુજરાતમાંથી પ્રથમ મહિલા રાજ્યપાલ બનેલા કુમુદબેનનું અવસાન

**નવસારી**

નવસારી : નવસારીના પીઠ કોંગ્રેસી અને આંધ્રપ્રદેશના માજી ગવર્નર એવા ગાંધીવાદી કુમુદબેન જોષીનું આજે લાંબી માંદગી બાદ 88 વર્ષની જૈફ વયે તેમના નિવાસ સ્થાન ગણદેવીના ધનોરી ચાંગા ગામે અવસાન થયું હતું. ગણદેવીના ધનોરી (ચાંગા) ગામના મૂળ વતની કુમુદબેન જોષીનો જન્મ 1934માં થયો હતો. નવસારી જિલ્લામાંથી સૌપ્રથમ વખત આંધ્રપ્રદેશના રાજ્યપાલ તરીકે પીઠ ગાંધીવાદી કુમુદબેન જોષીની વરણી થઈ હતી. તેમણે ઓલ ઈન્ડિયા મહિલા કોંગ્રેસ કમિટીના પ્રમુખ તરીકે તથા ભારત સરકારના ખાદી ગ્રામોદ્યોગના ચેરમેન તરીકે પણ કાર્યભાગ સંભાળ્યો હતો. 30 વર્ષની ઉંમરે સક્રિય રાજકારણમાં એન્ટ્રી લીધી હતી.

## કાપોદ્રામાં લીવધનમાં રહેતી નેપાળીની હત્યા કરનારો તેનો પતિ જ નીકળ્યો

**સુરત**

સુરતના કાપોદ્રામાં મૂળ મહેસાણા બેચરાજના મોટપના યુવાન પ્રકાશ રણછોડભાઈ પટેલ સાથે લીવ ઈનમાં રહેતી મૂળ નેપાળી સ્નેહલતા બનવારીની ઘરમાં ઘુસી ગળું કાપી ઘાતકી હત્યા કરેલી લાશ મળી આવી હતી. લાલ દરવાજા ખાતે ઝેરોક્ષની દુકાન ધરાવતો પ્રકાશે કરેલો ફોન સ્નેહલતાએ નહીં ઉચકતા પાડોશીને તપાસ કરવા મોકલ્યો ત્યારે તેની લાશ મળી હતી. પોલીસ તપાસ દરમિયાન દરમિયાન ભાંગી પડેલા પ્રકાશે ગુનો કબુલતા જણાવ્યું હતું કે એક વર્ષ અગાઉ પુત્રી ખુશીના જન્મ પછી સ્નેહલતાને પોતાના અને પુત્રીના ભવિષ્યની

ચિંતા થવા લાગી હતી. પ્રકાશે ગામની જમીન વેચતા 45 લાખ આવ્યા. તેમાંથી રૂ.11 લાખનો ફ્લેટ મુંબઈમાં સ્નેહલતાએ પોતાના નામે લેવડાવ્યો હતો. ઉપરાંત, સુરતમાં હાલ જે ફ્લેટમાં રહેતા હતા તે ફ્લેટ પણ રૂ.25 લાખમાં સ્નેહલતાએ પોતાના નામે લેવડાવ્યો હતો. તેમ છતાં પ્રિન્ટર અને કાર્ટિજનો વેપાર કરતી સ્નેહલતા વેપારમાં કમાયેલા રૂ.4 થી 5 લાખ પોતાના બેંક એકાઉન્ટમાં હોવા છતાં દુકાન લેવાની જાહે કરતી હતી. તેથી તેમની વચ્ચે ઝઘડા થતા હતા. સ્નેહલતાની સતત માંગણીને પગલે કંટાળેલા પ્રકાશે સ્નેહલતા પૂજા કરતી હતી ત્યારે ગળાના આગળના ભાગે ચપ્પુ ફેરવી તેની હત્યા કરી હતી.

## લોન નહીં ચૂકવાતા બિલ્ડર રાજહંસની મિલકત કબ્જે લેવા હુકમ

**સુરત**

BOBમાંથી બિઝનેસ ડેવલોપમેન્ટ માટે 84.95 કરોડની લોન લીધા બાદ ભરપાઈ નહિ કરતા રાજહંસ ઈન્ફ્રાબિલ્ડની અડાજણમાં આવેલી મિલકતનો કબ્જો લઈ બેંકને સોંપવા જિલ્લા કલેક્ટર હુકમ કર્યો છે. સુરતના બિલ્ડર શ્રુપ રાજહંસ ઈન્ફ્રાબિલ્ડના સંજય પરસોતમ મોવલિયા મનોજ પરસોતમ મોવલિયા, મિતેષ પરસોતમ મોવલિયા અને રાજહંસ પ્રો. કોન પ્રા.લીના ઋતુ સંજય મોવલિયાએ 2017માં બેંક ઓફ બરોડામાંથી કોર્પોરેટ બિઝનેસ ડેવલોપમેન્ટ માટે 84.95 કરોડની લોન લીધી હતી. આ લોન પેટે પાચેક કરોડ ભર્યા બાદ બાકીની 79.42 કરોડની લોનની ભરપાઈ નહિ કરતા 2020માં બેંક એકાઉન્ટ NPA થતાં બેંક દ્વારા નોટિસ ફટકારી કાર્યવાહી શરૂ કરાઈ હતી.

# ગોવર્ધનથાળ

## સ્વાદિષ્ટ શુદ્ધ શાકાહારી ગુજરાતી ભોજન

<p><b>Weekend Special</b></p> <p>રગડા પેટિસ, પાંઉભાજી, છોલેપુરી, કટલેસ, ખાસ્તા કચોરી, સેવ ઉસળ, સમોસા ચાટ</p>	<p><b>Takeout &amp; Catering</b></p> <table style="width: 100%;"> <tr> <td style="width: 50%; text-align: center;"> <p>Limited થાળી (with sweet &amp; Farsan)</p> <p><b>\$9.00 +Tax</b></p> </td> <td style="width: 50%; text-align: center;"> <p>Limited થાળી (without sweet &amp; Farsan)</p> <p><b>\$7.50 +Tax</b></p> </td> </tr> </table>	<p>Limited થાળી (with sweet &amp; Farsan)</p> <p><b>\$9.00 +Tax</b></p>	<p>Limited થાળી (without sweet &amp; Farsan)</p> <p><b>\$7.50 +Tax</b></p>	<p><b>CATERING SPECIAL</b></p> <p><b>\$ 14.99</b> 10 items +Tax</p> <p>Sweet, Farsan, Subji, Kathor, Puri, Dal, Rice Papad, Pickle, Kachumber</p>
<p>Limited થાળી (with sweet &amp; Farsan)</p> <p><b>\$9.00 +Tax</b></p>	<p>Limited થાળી (without sweet &amp; Farsan)</p> <p><b>\$7.50 +Tax</b></p>			

**Call us for details**

ફોન નં: **૪૧૬-૪૩૮-૦૫૪૪**  
**૪૧૬-૫૨૦-૨૯૨૨, ૪૧૬-૪૩૪-૮૧૨૧**

**Franchise Opportunity in GTA**

**રસોઈકામ કરી શકે તેવા બહેનોની જરૂર છે.**

**૯૪૦, મારખમ રોડ, સ્કારબોરો, ઓન્ટેરીયો, કેનેડા, M1H2Y2**



# દિકરો સુમુલમાં જ નોકરી કરતો હોવાથી ડિરેક્ટર ભરત પટેલને હોદ્દાથી દૂર કરાયા

કમિશનરે નોટિસ ફટકારી હતી, સુનાવણી બાદ હુકમ કરતા સહકાર ક્ષેત્રમાં ખળભળાટ

સુરત

દીકરો સુમુલમાં જ નોકરી કરતો હોવાની ફરિયાદ ઉઠયા બાદ ગાંધીનગર સહકાર કમિશ્નર દ્વારા નોટીસ ફટકારી સુનાવણી રાખ્યા બાદ આખરે આજે ભરત સુદામભાઈ પટેલને સુમુલના નિયામક મંડળના સભ્ય તરીકેના હોદ્દા પરથી દૂર કરવાનો હુકમ કરાયો છે. તો આ હુકમથી ગુજરાતમાં સહકાર ક્ષેત્રે ૨,૦૦૦ થી વધુ ડિરેક્ટરો પર લટકતી તલવાર હોવાથી ખળભળાટ મચી જવા

પામ્યો છે.

સુરત જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ (સુમુલ) દ્વારા નાસિકના પ્લાન્ટમાં ભરતી માટે જાહેરાત અપાઈ હતી. આ ભરતીને લઈને ફરિયાદ થઈ હતી કે સુમુલના જ ડિરેક્ટર ભરત સુદામભાઈ પટેલના દિકરાને નોકરીએ રાખ્યો છે. અને તે પણ નાસિક પ્લાન્ટની ભરતીના નામે સુરતમાં ભરતી કરાઈ હોવાના આક્ષેપ સાથે ફરિયાદ થતા ગાંધીનગર રજિસ્ટ્રાર સહકારી મંડળીઓના સહકાર કમિશ્નર દ્વારા ભરત પટેલને

નોટીસ ફટકારી સુનાવણી રાખી હતી.

ત્યારબાદ રજિસ્ટ્રારની બદલી થતા નવા રજિસ્ટ્રાર તરીકે દિનેશ પટેલ આવતા ફરી નોટીસ ફટકારી સુનાવણી રાખી હતી. સુનાવણી પૂર્ણ થયા બાદ સહકાર કમિશ્નરે ગુજરાત સહકારી મંડળીઓ અધિનિયમ-૧૯૬૧ ની કલમ- ૭૬ (બી) (૧) અને ૧૯૬૫ ના નિયમોના નિયમ નં.૩૨ની મળેલી સત્તાની રૂએ ભરત પટેલને સુમુલના નિયામક મંડળના સભ્ય તરીકેના હોદ્દા પરથી દૂર કરવાનો હુકમ કર્યો હતો.

# ગુજરાતમાં સહકાર ક્ષેત્રથી સમૃદ્ધિ આવી, હું સુવર્ણ કામ માટે આવ્યો છું : અમિત શાહ



તાપી

કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહની હાજરીમાં તાપી જિલ્લાના બાજીપુરા ખાતે 'સહકારથી સમૃદ્ધિ' સંમેલન યોજાયું હતું. સંમેલન સ્થળે કેન્દ્રીય મંત્રી અમિતભાઈ શાહના હસ્તે સુમુલ ડેરી દ્વારા નવનિર્મિત સત્વ ફોર્ટિફાઈડ તેમજ ચક્રી આટા પ્લાન્ટનું વર્ચ્યુઅલ ઉદ્ઘાટન કરાયું હતું. સાથે નવી પારડી સ્થિત બનનારા આધુનિક બટર કોલ્ડ સ્ટોરેજ તથા પાવર વેર હાઉસનો શિલાન્યાસ કરવામાં આવ્યો હતો. અમિત શાહે જણાવ્યું હતું કે, આઝાદીનું ૭૫મું વર્ષ દરેક માટે મહત્વનું છે. ગુજરાતમાં સહકાર ક્ષેત્રથી સમૃદ્ધિ આવી છે.

આજે તાપીમાં દેશનો પ્રથમ સહકારથી સમૃદ્ધિ કાર્યક્રમ યોજાયો હતો. જેમાં ગૃહમંત્રી અમિત શાહે પશુપાલકોને સંબોધન કર્યું હતું. પશુપાલકોનો વિકાસ થાય તે હેતુથી સમૃદ્ધિ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. આ ક્ષેત્રને વધુ વેગવંતુ બનાવવા સહકારીતા મંત્રાલય

વિભાગની રચના કરવામાં આવશે. સુમુલ ડેરીના સહકારથી કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં ૧ લાખથી વધુ પશુપાલકો જોડાયા હતા.

તેમણે સંબોધનની શરૂઆતમાં કહ્યું કે, દૂધ ઉત્પાદકોને મારા રામ રામ અને પ્રણામ. આ કાર્યક્રમથી સહકારી માળખું કેટલું મજબૂત થયું છે તેની સાક્ષી મળે છે. અનેક શહીદો, સ્વાતંત્ર્યવીરોને યાદ કરવાનો મહોત્સવ કર્યો અને તેમના ત્યાગથી દેશની યુવા પેઢી પ્રેરણા લે અને દેશભક્તિના સંસ્કારથી ભરાય તેવું પણ આયોજન કર્યું. તેમણે દેશને સંકલ્પ વર્ષ તરીકે ઉજવવાનું કાર્ય કર્યું. દેશ ૨૫ વર્ષ પછી ક્યા હશે તે સંકલ્પ કરવાનું નક્કી કર્યું. દેશના દરેક નાગરિકને સમૃદ્ધ બનાવવાની, સ્ટાર્ટઅપના માધ્યમથી યુવકોને આગળ આવવાની તક આપી. તેમ સહકારી કાર્યકર્તાઓ માટે સહકારી સંગઠનને મજબૂત કરવાનું આપણે નક્કી કર્યું છે. હું ગર્વથી કહું છું કે હું સુવર્ણ કામ માટે આવ્યો છે.

# શાળામાં જય શ્રી રામ બોલનારા વિદ્યાર્થીઓને કાઠી મુકવા ધમકી

વાપી

ચણોદ ગામે સેન્ટ મેરી નામક અંગ્રેજી માધ્યમની શાળા આવેલી છે. તાજેતરમાં જ શાળામાં ધો.૮માં અભ્યાસ કરતા બે વિદ્યાર્થીએ એક બીજાને જય શ્રી રામ કહ્યું હતું. વિદ્યાર્થીઓએ જય શ્રી રામ શબ્દનો પ્રયોગ કરતા શાળાના આચાર્યએ બંને વિદ્યાર્થીને બોલાવી શાળાના નિયમોનું ઉલ્લંઘન કર્યું હોવાનું કહી ધમકાવ્યા હતા. બાદમાં બંનેના વાલીઓને બોલાવી વાતચીત કરી જો આ બાબતે માફીનામું નહીં લખી આપો તો વિદ્યાર્થીઓને શાળામાંથી કાઢી મુકવાની ધમકી આપી

હતી. જથી ગભરાયેલા વાલીઓએ સંતાનનું ભવિષ્ય નહીં બગડે તે માટે કમને માફી નામું લખી આપ્યું હતું. શાળા સંચાલકો દ્વારા કરાયેલી ગંભીર ચેષ્ટા બહાર આવતા લોકોમાં ભારે વિરોધ સાથે આકોશ ઉઠ્યો હતો. આ મામલે શનિવારે વલસાડ જીલ્લા વિશ્વ હિન્દુ પરિષદના ઉપાધ્યક્ષ નરેન્દ્ર પાયક, બજરંગદળના સંયોજક રાજુ મિશ્રા સહિતના કાર્યકરો શાળાએ પહોંચી ગયા હતા. અને જય શ્રી રામ બોલનાર વિદ્યાર્થીઓને શાળામાંથી કાઢી મુકવાની ધમકી આપી માફીનામું લખાવવા અંગે ભારે વિરોધ કરી આકોશ ઠાલવ્યો હતો.

# ગોથાણ-હજીરા રેલવે ટ્રેકના વિરોધમાં ૫૦૦ ખેડૂતોની બાઈક રેલી

સુરત

ગોથાણથી હજીરા વચ્ચેના ૩૪ કિમી રેલવે ટ્રેક માટે જમીન સંપાદન કરવાના વિરોધમાં સુરત જિલ્લાના ૧૪ ગામોના ૫૦૦ ખેડૂતોએ સુરત જિલ્લા કલેક્ટર કચેરી સુધી વિશાળ બાઈક રેલીનું આયોજન કર્યું હતું.કુલ ૧૪ ગામોના ૨૦૦થી વધુ ખેડૂતોની ખેતીલાયક જમીન સંદન કરવામાં આવે તેવી સ્થિતિના પગલે ખેડૂતોએ પોતાની જમીન આપવાનો સાફ ઈન્કાર કર્યો છે.ખેડૂતોએ બાઈક રેલી કાઢીને ૧૪ જેટલા વાંધા સાથેની અરજીઓ સાથે સુરત જિલ્લા કલેક્ટરને રજૂઆત કરી હતી.

# THANK YOU FRONTLINE WORKERS



**MORTGAGE DILIGENT**  
A STEP AHEAD

FSRA # 10252

⇒ Purchase ⇒ Refinance ⇒ Renewal/Switch

**5 Yrs Fixed @ 1.84%\* High Ratio Only**  
**5 Yrs Variable @ 1.15%\* High Ratio Only**  
**3 Yrs Variable @ 0.99%\* (Special Promotion)**



**Rakesh Patel\*\***  
Vice President- Commercial.



**Pranay Jani \***



**Nilesh Tailor \***



**Bala Shah\***



**Vijay Rana\***



**Rajesh Khurana, MBA**  
Principal Broker

**Cell : 416-616-1300**

Tel.: 289 521 6900

1305 Matheson Blvd E, Mississauga ON L4W 1R1

• info@mortgagediligent.com • www.mortgagediligent.com

Rates are subject to change without notice.\* FSCO#10252,OAC,E&O.E \* - Mortgage Agent, \*\* - Vice President

\* Some conditions apply

# બોટાદ પાલિકામાં ભાજપના 30 સભ્યોએ સમિતિમાંથી રાજીનામા આપતા ખળભળાટ

પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન વગેરે મનમાની કરતા હોવાનો ગંભીર આરોપ મુકાયો

બોટાદ

ભાજપના બે જુથ વચ્ચે બોટાદ નગરપાલિકામાં લાંબા સમયથી વિવાદ ચાલતો હતો, જેના પગલે બોટાદ નગરપાલિકામાં આજે બુધવારે ભાજપના 30 સભ્યોએ જુદી જુદી સમિતિઓમાંથી રાજીનામા આપતા ખળભળાટ મચી જવા પામેલ છે. પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી ચેરમેન વગેરે મનમાની કરતા હોવાનો સભ્યોએ આક્ષેપ કર્યો છે. આઠ માસથી વિવાદ ચાલતો હતો અને સભ્યોના કામ ના થતા હોવાની ફરિયાદ ઉઠી હતી. પ્રમુખનો ચાર્જ એક દિવસ ઉપપ્રમુખે સંભાળી બીલો પાસ કર્યાનો આક્ષેપ સભ્યોએ કર્યો છે.



બોટાદ નગરપાલિકાના પ્રમુખ રાજેશ્રીબેન રાજુભાઈ વોરા, ઉપપ્રમુખ કિશોરભાઈ પાટીવાળા, કારોબારી સભ્ય બળદેવ પ્રજાપતી વગેરે પોતાની મનમાની ચલાવતા હોવાનો આક્ષેપ કરી આજે બુધવારે બોટાદ નગરપાલિકામાં ભાજપના 30 સભ્યોએ જુદી જુદી સમિતિમાંથી રાજીનામા આપતા રાજકીય માહોલ ગરમાયો છે. રાજીનામા આપ્યા તેમાં શાસક પક્ષના નેતા, દંડક, સમાજ કલ્યાણ ચેરમેન, ગટર સમિતિ ચેરમેન, કારોબારી, ગટર શાખા, સમાજ કલ્યાણ, આરોગ્ય, સમાજ કલ્યાણ, પાણી પુરવઠા સહિતની જુદી જુદી સમિતિના સભ્યોએ રાજીનામા બોટાદ નગરપાલિકાના ચીફ ઓફિસરને આપ્યા છે, જેના પગલે ભાજપ પક્ષમાં દોડધામ મચી જવા પામી છે. પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેન વગેરે પાલિકાના અલગ અલગ વિભાગના ચેરમેન, કમિટીના સભ્યો સાથે સંકલન કરવાને બદલે વિપક્ષ સાથે

મીલીભગત કરી મનઘડત વહીવટ કરી રહ્યા છે. બોટાદની જનતા અને બોટાદ ભાજપના કાર્યકરો દુઃખી થઈ રહ્યા છે.

બોટાદ નગરપાલિકાની અલગ અલગ સમિતિના ચેરમેન અને સમિતિના સભ્યોની છેલ્લા આઠ મહિનાથી રજૂઆત હતી, જેને ધ્યાને રાખી પ્રદેશ સંગઠન જિલ્લા અને શહેર સંગઠન દ્વારા પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનને કડક સૂચના આપવામાં આવી હતી છતાં સૂચનાને ગણકારવામાં આવી ના હતી. એક દિવસ માટે પ્રમુખ રજા ઉપર રહી ઉપપ્રમુખને ચાર્જ સોંપી અને બિલો, ચેકો મંજૂર કર્યા હતાં. ભારતીય જનતા પાર્ટીના સંગઠનના હોદ્દાદારોની સૂચનાની અવગણના કરી મનઘડત નિર્ણયો કરી પાર્ટીની છબી ખરાબ કરી રહ્યા છે. બોટાદ નગરપાલિકા પ્રમુખ, ઉપપ્રમુખ અને કારોબારી ચેરમેનના રાજીનામાની માંગ સાથે વિવિધ સમિતિઓના ચેરમેન અને સમિતિના સભ્યોએ રાજીનામા આપ્યા છે ત્યારે આ મામલે શું નિર્ણય આવે છે ? તેની રાહ જોવી જ રહી.

# બિલ્ડર ડાયાભાઈ કોટેચા હત્યા કેસમાં આરોપીની સજા ચથાવત

આણંદપર ખાતેની સર્વે નં-441ની કિંમતી જમીન મામલે શૈલેન્દ્ર જાડેજા-ડાયાભાઈ કોટેચા વચ્ચે તકરાર થઈ હતી

રાજકોટ

રાજકોટના ટોચના બિલ્ડર અને જમીનોના શાહ સોદાગર એવા ડાયાભાઈ કોટેચાની વર્ષ 2009માં તેમની જ ઓફિસમાં છરીના અસંખ્ય ઘા ઝીંકીને હત્યા કરવામાં આવી હતી. આ કેસના આરોપી એવા આણંદપરના શૈલેન્દ્ર બચુ જાડેજાને રાજકોટ સેશન્સ અદાલત દ્વારા આજીવન કેદની સજા ફટકારવામાં આવી હતી. આરોપીએ આજીવન કેદની સજા સામે સુપ્રીમ કોર્ટમાં અપીલ કરી હતી. સુપ્રીમ કોર્ટ દ્વારા અપીલ નામંજૂર કરીને આજીવન કેદની સજાનો હુકમ કાયમ રાખવામાં આવતાં બેફામ થયેલા ભૂમાફિયાઓમાં ખોફની લાગણી પ્રસરી છે.

સમગ્ર સૌરાષ્ટ્ર પંથકમાં ચક્ર્યાર મચાવનારા આ કેસની વિગતો એવી છે કે, રાજકોટમાં જમીન-મકાનના વ્યવસાયમાં ટોચનું સ્થાન ધરાવતા અને સમાજસેવક ડાયાભાઈ કોટેચાની જમીન વિવાદ મામલે હત્યા કરવામાં

આવી હતી. આણંદપર ખાતેની સર્વે નં-441ની કિંમતી જમીન મામલે શૈલેન્દ્ર જાડેજા અને ડાયાભાઈ કોટેચા વચ્ચે તકરાર ચાલુ હતી અને કાલાવડ ખાતે સિવિલ અદાલતમાં કેસ ચાલતો હતો. આ દરમિયાન શૈલેન્દ્ર જાડેજા અને તેના પરિવારજનો દ્વારા ડાયાભાઈને પરેશાન કરવામાં આવતા ડાયાભાઈએ વિવિધ સ્થળોએ ફરિયાદ કરેલી હતી. આ અંગે ખાર રાખીને આરોપી શૈલેન્દ્ર જાડેજાએ તા. 25 માર્ચ 2009ના રોજ સાંજના સમયે વિવાદ સુલટાવવાના બહાને ડાયાભાઈ કોટેચાની ઓફિસે જઈને છરીના અસંખ્ય ઘા મારીને તેમની હત્યા કરી હતી. સેશન્સ અદાલતે આરોપીને આજીવન કેદની સજા ફટકારી તે સમયે કેસમાં સોગંદ ઉપર ખોટી જુબાની આપવાના આરોપસર ડ્રાઈવર દીપક ચુનીલાલ ભાયાણી તથા આરોપીના સગા એવા 3 સાક્ષીઓ વિરૂદ્ધ કોર્ટ સમક્ષ સોગંદ ઉપર ખોટી જુબાની આપવા કાર્યવાહી કરવા હુકમ કરેલો હતો.

# કચ્છમાં ખેતીના અનોખા અભિયાનની શરૂઆત: 'હવે રણ નહીં, જંગલો હશે'

ભુજ

વિશ્વની ઓર્ગેનિક ફૂડની માંગને પૂરી કરવા ભારત- કચ્છના ખેડુતો સક્ષમ હોવાનું કેન્દ્રીય મંત્રી રૂપાલાએ જણાવ્યું હતું. જળસંચય અને પ્રાકૃતિક ખેતી માટે કચ્છના ૩૦૦ ગામડાંઓમાં આત્મનિર્ભર ખેડુત અભિયાનને લીલી ઝંડી અપાઈ હતી. વરસાદના પાણીની આવક, જળસંચયની શક્યતા અને ગામના વાર્ષિક પાણી વપરાશને ધ્યાને રાખી કચ્છના દરેક ગામમાં હંમેશ માટે પાણીની અછત દૂર કરવાના પ્રયત્નો માટે આરંભ "ગ્લોબલ કચ્છ"ના "જળ જીંદાબાદ અભિયાન" દ્વારા આત્મનિર્ભર ભારત અંતર્ગત આજરોજ કેન્દ્રીય મત્સ્ય પશુપાલન અને ડેરી ઉદ્યોગ મંત્રી પુરશોતમ રૂપાલાના વરદ હસ્તે બ્રહ્માકુમારી દ્વારા કચ્છના ૩૦૦ ગામોમાં આત્મનિર્ભર ખેડુત

અભિયાનનો પ્રારંભ કરાવાયો હતો. કેન્દ્રીય મંત્રીએ આ તકે વન્ય પેદાશોના વાવેતર અને વેચાણ માટે 'રણ થી વન' હેઠળ કચ્છ એગ્રો ફોરેસ્ટરી ફાર્મસ પ્રોડ્યુસર કંપની લિ. નો પણ પ્રારંભ કરાવ્યો હતો. દેશમાં વિકાસની અનુકૂળતા ઊભી થઈ છે. પ્રાકૃતિક ખેતી- ઓર્ગેનિક ફૂડની વિશ્વની જરૂરિયાત અને માંગને પૂરી કરવાની તાકાત ભારતના ખેડુતોમાં અને કચ્છીઓમાં છે. સમગ્ર દેશ અને રાજ્યમાં હાઈએસ્ટ ઈરિગેશન કચ્છ કરે છે. કચ્છીઓનો પોતાનો મિજાજ, જિંદાદિલી, ધીરજ, લક્ષ્યથી કામ કરવાની ધગશ છે. જેને અનુકૂળ અત્યારનું વાતાવરણ છે. પ્રધાનમંત્રી હવે તમામ યોજના સો ટકા લાગુ કરવાના આશયથી પ્રારંભ કરાવી રહ્યાં છે જેમાં સરકાર સાથે જનતા જોડાઈ રહી છે.

# સૌરાષ્ટ્રના જળાશયોમાં હવે 48% જ પાણી, સિંચાઈમાં મુશ્કેલી પડશે

ઉનાળો શરૂ થાય તે પહેલા સૌરાષ્ટ્રમાં અનેક ડેમોનાં તળીયા દેખાવા લાગ્યા

રાજકોટ

માર્ચ મહિનો હજુ પુરો થયો નથી ત્યાં સૌરાષ્ટ્રમાં મહત્તમ તાપમાનનો પારો 38 ડિગ્રી સુધી પહોંચી ગયો છે. એપ્રિલ - મે માં આકરો ઉનાળો શરૂ થાય તે પૂર્વે સૌરાષ્ટ્રનાં અનેક જળાશયોમાં પાણીનો જથ્થો ઝડપથી ખાલી થઈ રહ્યો છે હાલ સૌરાષ્ટ્રનાં 141 જળાશયોમાં 52 ટકા જેટલો જ પાણીનો જીવંત જથ્થો બચ્યો છે. ભાદર સહિતનાં મોટાભાગનાં ડેમોમાંથી શિયાળુ પાક માટે અપાતુ સિંચાઈનું પાણી બંધ કરી દેવામાં આવ્યું છે.

ચિત્ર એક સંતોષજનક નથી. સૌરાષ્ટ્રમાં દેવભૂમિ દારકા, બોટાદ, પોરબંદર અને મોરબી જિલ્લામાં આકરો ઉનાળો શરૂ થાય તે પહેલા જ પાણીની વિકટ સ્થિતિ ઊભી થઈ રહી છે. દેવભૂમી દારકા જિલ્લાનાં ડેમોનાં તળીયા દેખાવા લાગ્યા છે માત્ર 29 ટકા જ પાણીનો જથ્થો રહ્યો છે. પોરબંદર જિલ્લાનાં ડેમોમાં માત્ર 33 ટકા અને બોટાદમાં માત્ર 25 ટકા જ પાણીનો જીવંત જથ્થો હાલ છે. રાજકોટ અને જૂનાગઢ જિલ્લામાં પણ સંતોષજનક સ્થિતિ નથી માત્ર 55 ટકા જ પાણી બચ્યું છે. સૌરાષ્ટ્રમાં એક માત્ર ગીર સોમનાથ જિલ્લાનાં ડેમોમાં સૌથી વધુ 83 ટકા પાણી છે.

## Imperial PEST CONTROL

Residential • Commercial • Industrial

**24 Hour Service • 7 Days a Week**






**Preventing the Spread of COVID-19 : Our disinfectant services that we offer are:**

**1 Spray Services**

**2 Fogging Services**

**3 Sanitation Services**

**All Pest Control:**

Mouse & Rats, Cockroaches, Bedbugs, Silver Fish, Spiders & Fleas, Carpenter Ants. Total Interior & Exterior Pest Control

**Removal:**

Bees & Wasps, Pigeon, Squirrels, Raccoon, Skunk, Nest & Hive, Hornests, Yellow Jackets

First Time Customer gets

**10% Off**

on your first home service

\*Mention this offer while booking

Free Estimates & Written Guarantee

Special Service For Bedbug Control

www.imperialpestcontrol.ca  
info@imperialpestcontrol.ca  
(We speak English, हिन्दी, ગુજરાતી)

Call: Ramesh Kanani 416-837-1820



## સ્વદેશ CANADA

Registration # 869127209  
Publication Mail Agreement /  
Email : info@swadesh.news

WWW.SWADESH.NEWS

Return Undeliverable Canadian Address To :

Shree Balaji Inc.

MAILING ADDRESS

23 Lyric Road,  
Brampton ON L6S 0B4.  
416-996-7755

Registered Address

713, Markham Road, Scarborough M1H 2A8.

Editor & Publisher : Manoj Gandhi

Director : Nilesh Tailor

Sub Editor : Chhaya Gandhi

Montreal Bureau : Vijay Patel (514-826-7442)

GUJARAT OFFICE MAC AGENCIES : F-9, Jolly Square, Ram Chowk, Ghod-Dod Road, Surat – 395 001. GUJARAT ( INDIA)

Designed By

Sabir Daroga

Mevada Piyush

Firoz Shaikh



# ખેડા પાસે કન્ટેનર પાછળ બાઈક ઘૂસી જતાં અમદાવાદના ચાર યુવકોનાં મોત

પોલીસે ડિટેઈન કરેલું બાઈક છોડાવવાના બહાને ત્રણ દિવસથી ઘરેથી નિકળી ગયા

નડિયાદ

ખેડા બાયપાસ હાઈવે પર મંગળવારે મોડી રાત્રે ગમખવાર અકસ્માત સર્જાયો હતો. હાઈવે પરની એક હોટલના પાર્કિંગમાં ઉભેલ કન્ટેઈનરના પાછળના ભાગે એક પૂરઝડપે આવતું બાઈક ઘૂસી જતા બાઈક પર સવાર ચારેય યુવકોના મોત નિપજ્યા હતા. આ યુવકો અમદાવાદના હોવાનું અને પોલીસે કબજે કરેલ મિત્રનું બાઈક છોડાવવાના બહાને છેલ્લાં ત્રણ દિવસથી ઘરેથી નીકળ્યા હતા. અમદાવાદના અમરાઈવાડી



વિસ્તારમાં રહેતા જીતેશભાઈ નૌગીયા (ઉ.23), હરીશભાઈ રાણા (ઉ.19, રહે. સીટીએમ), નરેશ વણઝારા (ઉ.22, રહે. અમરાઈવાડી) અને છોટું

યાદવ (ઉ.17, રહે. અમરાઈવાડી) ત્રણ દિવસ અગાઉ એક મિત્રનું બાઈક નડિયાદ પોલીસે કબજે કરેલું છે અને છોડાવવાના બહાના હેઠળ ચારેય મિત્રો એક જ બાઈક પર ઘરેથી નીકળ્યા હતા. ગત રોજ રાત્રીના તેઓ નેશનલ હાઈવે નં. 8 પર સોખડા પાટીયા પાસે હાઈવે પર આવેલી વેસ્ટન હોટલમાં જવા માટે વળ્યા હતા. તે સમયે યુવાનીના જોશમાં પૂરઝડપે જતી તેમની બાઈક હોટલના પાર્કિંગમાં ઉભેલ એક કન્ટેઈનરની પાછળ ધડાકાભેર ઘૂસી ગઈ હતી.

# ખેડાના લસુન્દ્રામાં 6 વર્ષની બાળકી પર બળાત્કાર કરનારને ફાંસીની સજા

ખેડા

ખેડા જિલ્લાના લસુન્દ્રા ગામ નશાબોર શખ્સે એક વર્ષ અગાઉ ઘર આગળ રમતી છ વર્ષીય બાળકીને આંબલી ખાવાની લાલચ આપી છાપરામાં લઈ ગયા બાદ તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. આ બનાવ અંગે નડિયાદ કોર્ટ આરોપીને ફાંસીની સજા ફટકારી છે.

45 વર્ષીય આરોપી દારૂ પીવાની ટેવવાળો હોય તેના લગ્ન થયા નહોતા. એક વર્ષ અગાઉ ગત તારીખ 3 માર્ચ 2021ના રોજ તેની નજર પોતાના ઘરની સામે રહેતી એક 6 વર્ષીય બાળા પર પડી હતી. તેના મગજમાં વાસનાનો

કીડો સરળતા તેણે આ કિશોરીને પોતાની પાસે બોલાવી હતી ચાલ તને આમલી અપાવું કહી છ વર્ષી કિશોરીને સાથે લઈ ગયો હતો. આરોપીના બદ ઈરાદાથી અજાણ આ બાળા તેની સાથે ગઈ હતી. કિશોરીનો હાથ પકડી તે તેના છાપરામાં લઈ ગયો હતો અને બળજબરી પૂર્વક તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું અને બાદમાં 10 રૂપિયા આપી આ વાત કોઈને ન કહેવા જણાવ્યું હતું. જોકે, લોહીલુહાણ હાલમાં કિશોરી ઘરે આવતા તેના પરિવારજનોને ખ્યાલ આવી ગયો હતો પોલીસે ગુનો નોંધી આરોપીની ધરપકડ કરી હતી અને ચાર્જશીટ નડિયાદ કોર્ટમાં મૂકી હતી.

# વડોદરાનો જવાન કાશ્મીરમાં શહીદ : ગાર્ડ ઓફ ઓનર સાથે અંતિમવિદાય અપાઈ

વડોદરા

કાશ્મીરમાં શહીદ થયેલા છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના અહલાદ પુરાના શહીદ જવાન તુલસીભાઈ બારીયાનો પાર્થિવ દેહ મંગળવારે વડોદરા એરપોર્ટ ઉપર આવ્યો ત્યારે તેઓને ગાર્ડ ઓફ ઓનર સાથે સન્માનપૂર્વક પુષ્પાંજલિ અર્પણ કરી તેમના ગામ રવાના કરવામાં આવ્યો હતો જ્યાં તેઓની અંતિમ વિધિ કરવામાં આવશે. ગઈકાલે કાશ્મીરમાં આર્મીમાં ફરજ બજાવતા છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના અહલાદ પુર ગામના તુલસીભાઈ બારીયાનું અકસ્માતમાં મોત નીપજ્યું હતું. ફરજ દરમિયાન શહીદ થયેલા જવાન તુલસીભાઈનો પાર્થિવદેહ આજે વિમાન દ્વારા વડોદરા એરપોર્ટ ઉપર આવી પહોંચ્યો હતો.

# ખંભાતમાં સીલીકોસીસથી વધુ 1 દર્દીએ જીવ ગુમાવ્યો, મૃતાંક 21

ખંભાત

ખંભાતમાં સીલીકોસીસના રોગે પુનઃ માથું ઉચ્ક્યું છે. સીલીકોસીસથી પીડાતા વધુ એક વ્યક્તિનું મૃત્યુ થતા કુલ મૃત્યુઆંક 21 ઉપર પહોંચ્યો છે. છેલ્લા ચાર વર્ષમાં સીલીકોસીસ પીડીતોના મૃત્યુ દરમાં થઈ રહેલ વધારાને લઈ આરોગ્ય તંત્ર પણ ચિંતામાં મુકાયું છે. હાલ ટીબી હોસ્પિટલમાં સીલીકોસીસના દર્દીઓના એક્સરે લઈ રોગનું નિદાન કાર્ય શરૂ કરાયું છે.

આ અંગે સીલીકોસીસ પીડીતો માટે કાર્યરત પીટીઆરસીના નિયામક જગદીશ પટેલના જણાવ્યા મુજબ નવાબી નગર ખંભાતમાં કલાત્મક અકીકના આભુષણો

બનાવવાનો વ્યવસાય વર્ષોથી ચાલે છે. જેમાં પથ્થર ઘસવાની પ્રક્રિયાના કારણે કારીગરોમાં સીલીકોસીસ બિમારી થતી હોય છે. જે જીવલેણ હોય છે. શહેરના સૈયદવાડા વિસ્તારમાં રહેતા એક ૪૩ વર્ષીય વ્યક્તિનું સીલીકોસીસના કારણે અવસાન થયું છે. પરિવારમાં તે તથા તેઓના વિધવા માતા એમ બે જ સભ્ય છે. બીજા અનેક અકીકના કારીગરોની જેમ મૃતક નિર્વિવાહિત હતા અને તેમણે વીસેક વર્ષ સુધી ડ્રમમાં કામ કર્યું હતું. દિવસે રીક્ષા ફેરવે અને રાત્રે ડ્રમમાં જતા હતા. છ વર્ષ પૂર્વે તેઓ બિમાર પડતા કામ અને આવક બંને બંધ થઈ ગયા હતા.

# વડોદરામાં 49મો બાળ મેળો સંપન્ન : પાંચ લાખ લોકોએ લાભ લીધો

વડોદરા

વડોદરા નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ, દ્વારા 11 મી માર્ચે “આઝાદી કા અમૃત મહોત્સવ” થીમ પર 49મો બાળમેળો પ્રજાવત્સલ સર સયાજીરાવ ગાયકવાડના 159માં જન્મ દિવસે ખુલ્લો મૂક્યો હતો. આ ત્રીદિવસીય બાળમેળાનો અંદાજે પાંચ લાખ નગરજનોએ લાભ લીધો હતો. બાળમેળામાં બાળકોને પ્રોત્સાહિત કરવા અધિકારીઓ પદાધિકારીઓએ સયાજીબાગની મુલાકાત લીધી હતી. નગરજનોએ જ્ઞાનસભર, મનોરંજન અને સ્વાદિષ્ટ વાનગીઓ આરોગી બાળમેળાનો રસાસ્વાદ માણ્યો હતો. વડોદરા સંસ્કારી નગરીની શૈક્ષણિક સંસ્થાઓ, શાળા-મહાશાળાઓ, પ્રવાસીઓએ મનભરી બાળમેળો નિહાળ્યો હતો.

# ડાકોરમાં સોનાની પાલખીમાં શ્રીજીની સવારી, રંગો ઉડાડી ધૂળેટીના વધામણાં

નડિયાદ

યાત્રાધામ ડાકોરમાં ફાગણી પૂનમના ધમધમાટ વચ્ચે તા.૧૪મી માર્ચને સોમવારના રોજ ફાગણ સુદ એકાદશીના દિવસે શ્રીરણછોડરાયજીના મંદિરમાં આમલકી એકાદશીના પર્વની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. સાંજે ઉત્પાથન આરતી બાદ પાંચ વાગ્યાના સુમારે સમરંગી રસછોડ ઉડાડી સૌપ્રથમ વખત સોનાની પાલખી ઉપર શ્રીજીની ભવ્ય સવારી નીકળી હતી. ભક્તોએ સાત રંગોની રસછોળો વચ્ચે ધૂળેટીના વધામણાં કર્યા હતા. મામલતદારની મંજૂરી ન મળવાથી વર્ષોથી પરંપરાગત ગજરાજ પર નીકળતી શ્રીજીની શાહી સવારી આ વર્ષે રદ



કરવામાં આવી છે. ડાકોરના મંદિરમાં આમલકી અગિયાસરના પર્વનું અનેરું મહાત્મ્ય છે. સવારથી મંદિરમાં શ્રીજી સમક્ષ દરેક ભોગ બાદ અબીલ-ગુલાલની રસછોળો અને પીચકારીમાં કેસૂડાના જળનો છંટકાવ કરવામાં આવ્યો હતો. વૈષ્ણવ સમુદાયમાં આમલકી એકાદશી ધામધૂમથી ઉજવવામાં

છે. ડાકોરના શ્રીરણછોડરાયજી મહારાજના મંદિરમાં દર વર્ષની જેમ આ વર્ષે પણ પરંપરા અનુસાર આ પર્વની ઉજવણી કરવામાં આવી હતી. આ પ્રસંગે શ્રીજીને વિવિધ આભૂષણોના સુંદર શણગાર સજવામાં આવ્યા હતા. સવારે ત્રણ ભોગ ખુલ્યા બાદ શણગાર આરતી કરવામાં આવી હતી.

# દારકામાં શ્રીજીને 101 કિલો ગુલાબના ફુલનો શૃંગાર



યાત્રાધામ દારકામાં જગ વિષ્ણાત દારકાદીશ જગતમંદિરે આજે એકાદશીના પાવન પર્વ નિમિત્તે ભગવાન દારકાદીશજીને શૃંગાર આરતી સમયે 101 કિલો ગુલાબ પુષ્પોની પાખડીના ફુલ હોળીના શૃંગાર દર્શન યોજાયા હતા. શૃંગાર આરતી સમયે શ્રીજીને ચાંદીની પિચકારીમાં કેસૂડાનો રંગ ભરી રંગે રંગવામાં આવ્યાનો ભાવ વ્યક્ત કરાયો હતો. ઠાકોરજીના અલૌકિક દર્શનનો લાહવો લઈ ભાવિકો અભિભૂત બન્યા હતા. યાત્રાધામ દારકામાં યાત્રીકોનું ઘોડાપુર ઉમટી પડ્યું છે. દારકા જગ વિષ્ણાત દારકાદીશ જગતમંદિરે આજે એકાદશી ના પાવન પર્વ નિમિત્તે ભગવાન દારકાદીશજીને શૃંગાર આરતી સમયે પુજારી નેતાજી પરીવાર દ્વારા 101 કિલો ગુલાબ પુષ્પોની પાખડીના ફુલ હોળીના શૃંગાર દર્શન યોજાયા હતા.



**First Flight**  
FFCL Couriers Inc.

દુનિયાના કોઈપણ દેશમાં ડોક્યુમેન્ટ્સ અને પાર્સલ મોકલવા માટે પણ સેવા ઉપલબ્ધ

તમારા ડોક્યુમેન્ટ્સ અને પાર્સલ ઈન્ડિયા મોકલવા માટે સૌથી વ્યાજબી ભાવ અને સર્વશ્રેષ્ઠ સ્થળ

<p>1 LB \$20 વધુ દર LB ના \$6 11 LB \$55 વધુ દર LB ના \$6 23 KG \$185, વધુ દર KG ના \$10 30 KG \$230, વધુ દર KG ના \$10</p>	<p>ખાવા-પીવાની વસ્તુ USA મોકલવા માટે FDA ની એપ્રુવલ અમે કરી આપીશું (Extra Charge)</p>
---	---

જીટીએની સૌથી મોટી ઈન્ડિયન કુરિયર કંપની હવે તમારી સેવા માટે ત્રણ શાખાઓ

<p><b>Brampton (West)</b> 519, Ray lawson boulevard, Unit-3, Brampton ON L6Y 0N2 Chandni Chowk Plaza, ATN Wireless Board Door Open Last Unit Ours Phone 647-761-1317, 647-657-9631 -----: MON-FRI : ----- 11.00 AM to 7.00 PM : SAT-SUN : 1.00 PM to 6.00 PM</p>	<p><b>Scarborough</b> WE ARE RE-OPENING 880 Markham Road, Unit-8 Main Intersection Markham Road &amp; Painted Post, Near Saileela Khaman-Dhokla House Complex, Phone 647-761-1317 647-657-9631 905-673-9631 -----: MON-THU : ----- 2.00 PM to 7.00 PM FRIDAY WEEKLY OFF : SAT-SUN : 11.00 AM to 6.00 PM</p>	<p><b>Mississauga</b> WE MOVED TO 6800 REXWOOD ROAD, UNIT - D : Phone : 905-673-9631 647-761-1317 647-657-9631 -----: MON-FRI : ----- 9.30 AM to 5.00 PM</p>
--	---	--

૬૪૭-૭૬૧-૧૩૧૭ [www.firstflightcanada.com](http://www.firstflightcanada.com)





## રાધે શ્યામ જોઈને પ્રભાસના ચાહકે આત્મહત્યા કરી

બાહુબલી જેવી બ્લોકબસ્ટર મૂવી આપીને ફિલ્મ જગતમાં નવો જ કીર્તિમાન સ્થાપિત કરનાર પ્રભાસ છેલ્લા કેટલાક સમયથી થોડા હટકે પાત્ર કરી રહ્યો છે. પરંતુ તેનો આ હટકે અંદાજ તેના ફેન્સને બાહુબલી જેટલો સંતોષ કે મનોરંજન આપી રહ્યું છે. થોડા દિવસ પહેલાં સિલીંગ થયેલી પ્રભાસ સ્ટારર રાધે શ્યામ મૂવી પર બોક્સ ઓફિસ પર ખાસ કમાલ કરી શકવામાં નિષ્ફળ રહી હતી. જેના કારણે પ્રભાસના એક બાચ હાર્ટ ફેન્સને ઝટકો લાગ્યો હતો. રવિ તેજા નામના ફેન્સને પ્રભાસની આ ફિલ્મથી એટલી નિરાશા થઈ હતી કે ફિલ્મ જોયા બાદ તેને ઘરે આવીને પંખાથી લટકીને આત્મહત્યા કરી લીધી હતી.



## 'ધ કાશ્મીર ફાઇલ્સ'ને લઈને ભાજપ-કોંગ્રેસ આમને સામને

ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'ને મળી શાનદાર ઓપનિંગ, ગુજરાત સહિત અન્ય રાજ્યમાં કરમુક્ત કરાઈ

બોલિવૂડ ફિલ્મ 'ધ કાશ્મીર ફાઇલ્સ'ને લઈને આજકાલ ખૂબ ચર્ચા થઈ રહી છે. આ ફિલ્મની થીમ કાશ્મીરી પંડિતોની હિજરત વિશે છે. ઘણા રાજ્યોએ આ ફિલ્મને ટેક્સ ફી જાહેર કરી છે. ફિલ્મ રિલીઝ થયા બાદ કેરળ કોંગ્રેસે જમ્મુ-કાશ્મીરમાંથી કાશ્મીરી પંડિતોની હિજરતને લઈને અનેક ટ્રિવટ કર્યા છે, જેનાથી વિવાદ છેડાઈ ગયો છે. કેરળ કોંગ્રેસ દ્વારા કાશ્મીરી પંડિતના મુદ્દે જે તથ્યો બહાર પાડવામાં આવ્યા



છે, તેને લઈને વિવાદ સર્જાયો છે. કાશ્મીરી પંડિતના મુદ્દે કેરળ કોંગ્રેસ દ્વારા જાહેર કરાયેલા તથ્યોને કારણે લોકો સોશિયલ મીડિયા પર ઘણી કોમેન્ટ કરી રહ્યા છે. સોશિયલ મીડિયાના ઘણા હેન્ડલ્સે કેટલીક તસવીરો ટ્રિવટ કરી છે. આમાંની એક તસવીરમાં યાસીન મલિક પૂર્વ વડાપ્રધાન

મનમોહન સિંહ એટલે કે યુપીએ નેતા અને બીજી તસવીરમાં પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયી એટલે કે એનડીએ નેતા સાથે હાથ મિલાવી રહ્યા છે. જો કે, કોંગ્રેસ અને ભાજપ બંને કાશ્મીરીઓની હિજરત માટે એકબીજા પર આરોપ લગાવી રહ્યાં છે. ગુજરાતમાં કાશ્મીર ફાઇલ્સ ફિલ્મ કરમુક્ત જાહેર કરાઈ છે. જેમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલે ફિલ્મને કરમુક્ત કરવાનો નિર્ણય કર્યો છે. ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સ પીએમ મોદીને પસંદ આવી છે. અનુપમ ખેર સ્ટારર ફિલ્મ ધ કાશ્મીર ફાઇલ્સને ખૂબ સારા રિવ્યુ મળી રહ્યાં છે. વિવેક અગિહોત્રીના નિર્દેશનમાં બનેલી આ ફિલ્મના દરેક લોકો વખાણ કરી રહ્યા છે. માત્ર જનતા જ નહીં પરંતુ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પણ આ ફિલ્મ પસંદ આવી છે.

## ટોપ B સ્કૂલમાં ગંગુબાઈના નેતૃત્વ પાઠ શીખવાડાશે



ઈજ્જત સે જીને કા... કિસી સે ડરને કા નહીં... ના પોલીસ સે, ના એમએલએ સે, ના મંત્રી સે...' સંજય લીલા ભણસાલીની ફિલ્મ ગંગુબાઈ કાઠિયાવાડીમાં સાડી પહેરેલી આલિયા ભટ્ટ આ સંવાદ રજૂ કરે છે. આવતા અઠવાડિયે IIMA ખાતેના સત્રમાં, ફિલ્મના પટકથા લેખક ઉત્કર્ષની વશિષ્ઠ કેન્દ્રીય પાત્રના સામાજિક નેતૃત્વ લક્ષણો પર બોલશે. જેમાં ગંગુબાઈના જીવનની ચર્ચા કરવામાં આવશે, જેઓ ગણિકાઓના મેડમ અને માફિયા ડોન બની ગયા. કઈ રીતે મુંબઈમાં સેક્સ વર્કરોની સુધારણા અને કેવી રીતે સામાજિક નેતૃત્વ કૌશલ્યનું પ્રદર્શન કરે છે તે અંગે વાત કરવામાં આવશે. ફિલ્મના પટકથા લેખક ઉત્કર્ષની વશિષ્ઠ સત્રનું સંચાલન કરશે. આગામી 22 માર્ચના રોજ 'મુંબઈની અંધારી ગલીમાંથી સામાજિક નેતૃત્વના પાઠ-ગંગુબાઈ કાઠિયાવાડી: ધ માફિયા ક્વીન' અંગે વર્ચ્યુઅલ ટોકનું આયોજન થશે.

## રશ્મિકા મંદાના આગામી ફિલ્મમાં આઈટમ ડાન્સ કરશે



મુંબઈ : રણબીર કપૂર આગામી ફિલ્મમાં પરિણીતી ચોપરા સાથે કામ જોવા મળવાનો છે. આ ફિલ્મને અર્જુન રેડ્ડી અને સંદીપ રેડ્ડી વાંગા બનાવી રહ્યા છે. હવે આ ફિલ્મને લઈને અપરેટ એ છે કે, આ ફિલ્મમાં રશ્મિકા મંદાનાની એન્ટ્રી થાય તેવી શક્યતા છે. આ ફિલ્મના એક આઈટમ નંબર માટે રશ્મિકા મંદાનાનો સંપર્ક કરવામાં આવ્યો છે. રિપોર્ટની માનીએ તો અદાકારાએ ફિલ્મસર્જક સાથે વાતચીત શરૂ કરી દીધી છે. જોકે તેણે

આ ફિલ્મની ઓફરને સ્વીકારી છે કે નહીં તે જાણવા મળ્યું નથી. રિપોર્ટના અનુસાર, આ ફિલ્મમાં રણબીર કપૂર એક ડાર્ક અને ઈન્ટેન્સ રોલમાં જોવા મળવાનો છે. ફિલ્મની વાર્તાને હજી ગુપ્ત જ રાખવામાં આવી છે. રસપ્રદ વાત એ પણ છે કે, રણબીર કપૂર અને પરિણીતી ચોપરાના મુખ્ય રોલ ધરાવતી આ ફિલ્મમાં અનિલ કપૂર અને બોબી દેઓલ જેવા ધૂરંધર સિતારાઓ પણ કામ કરવાના છે. આ ફિલ્મના નિર્માતા ભૂષણ કુમાર છે.

## OTT ડેબ્યુ માટે તૈયાર છે કરીના કપૂર ખાન

મુંબઈ: બોલિવુડ અભિનેત્રી કરીના કપૂર ખાન ફિલ્મ નિર્માતા સુજોય ઘોષના ડિરેક્શનમાં બનનારી Netflix ફિલ્મ સાથે પોતાના OTT ડેબ્યુ માટે તૈયાર છે અને સ્ટ્રીમરે બુધવારે આ અંગેની જાહેરાત કરી હતી. ફિલ્મના ટાઈટલનું નામ હજુ નક્કી નથી થયું પરંતુ આ મર્ડર મિસ્ટ્રી ફિલ્મ 2005ના



જાપાનીઝ બેસ્ટ સેલર 'ધ રિવોશન ઓફ સપ્લેક્ટ X' પર આધારિત છે અને તેમાં અભિનેતા જયદીપ અહલાવત અને વિજય વર્મા પણ જોવા મળશે. વિદ્યા બાલન અભિનીત ફિલ્મ 'કહાની' અને તાપસી પન્નુની 'બદલા' જેવી થ્રિલર ફિલ્મોના દિગ્દર્શન માટે પ્રખ્યાત એવા ઘોષે જણાવ્યું કે, તેઓ આ ફિલ્મ માટે કીગો હિગાશિનોની નવલકથાનો પ્લોટ સ્વીકારવા માટે ઉત્સાહિત છે. ડિરેક્ટરે જણાવ્યું કે 'રિવોશન' કદાચ મેં વાંચેલી શ્રેષ્ઠ લવ સ્ટોરી છે અને તેને ફિલ્મમાં રૂપાંતરિત કરવાની તક મળવી એ એક સન્માનની વાત છે. ઉપરાંત, મને કરીના, જયદીપ અને વિજય સાથે કામ કરવાની તક મળે છે. એનાથી વધારે હું શું માગું? કરીના છેલ્લે 2020માં ફિલ્મ 'અંગ્રેજી મીડિયમ'માં મોટા પડદા પર જોવા મળી હતી. તેણે આ પ્રોજેક્ટને 'ઇલેક્ટ્રીફાઈન્ગ' સફરની શરૂઆત ગણાવ્યો હતો. કરીનાએ જણાવ્યું કે, આ ફિલ્મમાં એક મહાન વાર્તા, એક સ્વપ્નદ્રષ્ટા દિગ્દર્શક અને એક સુપર પ્રતિભાશાળી કાસ્ટ અને કૂ એ બધું જ છે. હું ખરેખર સુજોય, જયદીપ અને વિજય સાથે કામ કરવા ઉત્સુક છું. 41 વર્ષીય અભિનેત્રીએ જણાવ્યું કે, આ એક ઇલેક્ટ્રીફાઈન્ગ સફરની શરૂઆત છે અને વિશ્વભરના પ્રેક્ષકો આ વૈશ્વિક બેસ્ટસેલર પુસ્તકને જીવંત રૂપમાં જુએ તે માટે હું અધીરી બની છું." આ ફિલ્મનું નિર્માણ ટ્વેલ્થ સ્ટ્રીટ એન્ટરટેઈનમેન્ટ, નોર્ધન લાઈટ્સ ફિલ્મ્સ દ્વારા બાઉન્ડસ્ક્રીપ્ટ અને કોસ પિક્ચર્સ સાથે મળીને કરવામાં આવ્યું છે.

## પુષ્પા-2ના રાઈટ માટે પ્રોડક્શન હાઉસે 400 કરોડની ઓફર કરી



પુષ્પાનો આ પહેલો પાર્ટ હતો. અલ્લુ અર્જુન હવે આ ફિલ્મથી આખા દેશમાં ફેમસ થઈ ગયો છે. હવે પુષ્પાના બીજા પાર્ટ માટે રાહ જોવાઈ રહ્યા છે ત્યારે મીડિયા રિપોર્ટ પ્રમાણે એક મોટા કોર્પોરેટ પ્રોડક્શન હાઉસે પુષ્પાના નિર્માતાઓને પાર્ટ ટુ માટે દરેક ભાષામાં ફિલ્મ સિલિંગ કરવાના રાઈટ માટે 400 કરોડ રૂપિયાની ઓફર કરી છે. જેમાં ઓટીટી અને સેટેલાઈટ રાઈટ્સ તો સામેલ પણ નથી. આમ

છતા મેકર્સ આ ઓફર સ્વીકારે નહીં તેવી સંભાવના છે. પુષ્પાના બીજા પાર્ટ માટે આ પ્રકારની ઓફર અત્યારથી જ થઈ રહી છે. જે બતાવે છે કે, આ ફિલ્મનો માર્કેટમાં કેવો પ્રભાવ છે. પુષ્પા ટુ તો સિલિંગ પહેલા જ હિટ મનાઈ રહી છે. પાર્ટ વનની વાત કરવામાં આવે તો કોરોના કાળમાં પણ તેના હિન્દી વર્ઝને 900 કરોડ રૂપિયા કરતા વધારે કમાણી કરી હતી.

**GUARANTEED ACCESS TO PRE-CONSTRUCTION CONDOS IN DOWNTOWN TORONTO & GTA CALL ME NOW!**

**BUY • SELL • INVEST**

**Nadir Shah**  
100% Professional, 0% Attitude  
Sales Representative  
MBA, ACEA (UK)

**416.625.3580**  
nadir.shah@sympatico.ca

4030, Sheppard Ave. East, Toronto, ON M1S 1S6  
T: 416.291.0929 (24/7) F: 416.291.0984

**CENTURY 21**  
Regal Realty Inc. Brokerage  
Member Broker

Not intended to solicit buyers or sellers already under a contract.



# ॥ संस्कृति ॥

હવે, સ્વદેશ વેબસાઈટના બદલાતા કલેવર

નિહાળો નીત નવા રૂપરંગમાં !!

માત્ર ગરવી ગુજરાત કે મેરા ભારત મહાન જ નહિ પરંતુ સમગ્ર વિશ્વની અટારીએ સર્જાતી અનેકવિધ ઘટનાઓનો સાક્ષાત્કાર ક્ષણેક્ષણ માણો !!

રાજકારણ, સમાજ, ધર્મ, શિક્ષણ, રમતગમત, મનોરંજનનો મહાસાગર, હોલીવુડ-બોલીવુડ, પ્રવાસ-પર્યટન, પર્યાવરણ તથા આરોગ્ય વિષયક માહિતીના રોમાંચક ખજાનાનો આવિષ્કાર !!

[www.swadesh.news](http://www.swadesh.news)

સ્વદેશમાં વિજ્ઞાપનો માટે ઈમેલ એડ્રેસ પર માહિતી મોકલો

[info@swadesh.news](mailto:info@swadesh.news)

હવે પછી નીચે મુજબના સરનામે તમામ પોસ્ટલ વ્યવહાર કરવા વિનંતી.

23 Lyric Road, Brampton ON L6S 0B4.



## કુદરત ટક્કર આપવા માનવજગત દ્વારા થનારો વધુ એક પ્રયોગ

# વૃદ્ધાવસ્થાને દૂર કરવા કિમીઓ શોધવા ક્વાયત

વૃદ્ધાવસ્થાને દૂર કરવા માટે આધુનિક કુદરતના નિયમોને પોતાની પોતે જ દુનિયામાં આધિપત્ય જમાવવાની મથામણ કરતો રહ્યો છે. અત્યાર સુધી અનેક આશ્ચર્યજનક શોધ કરવા છતાં પણ કુદરતના ક્રિશ્માઓ સામે માનવનો પનો ટૂંકો જ પડી રહ્યો છે. અનેક પુર વાવાઝોડુ સહિતની આફતોને લઈને પણ કુદરત તેની તાકાતનો પરચો બતાવે છે. સામે છેડે માનવો પણ તેના સંશોધનો ચાલુ જ રાખે છે. ઈંગ્લેન્ડમાં લિબ્રાહમ ઈન્સ્ટિટ્યૂટના Ph.D વિદ્યાર્થી દિલજીત ગિલને 2019માં જાણવા મળ્યું હતું કે, યોગ્ય સમયે કોષના રૂપાંતરણને રોકવાથી જૂના માનવ કોષોનું વૃદ્ધત્વ સમાપ્ત થઈ શકે છે, જે મનુષ્યને 25 વર્ષની આસપાસ “યુવાન” બનાવી શકે છે. જાન્યુઆરી, 2022માં અલ્ટોસ લેબને 3 બિલિયન ડોલરના ભંડોળ સાથે શરૂ કરાઈ હતી. હવે જેક બેન્ડોસ, યુરી મિલનર અને પીટર થિએલ જેવા અબજોપતિ રોકાણકારો ધરાવતી અલ્ટોસ લેબે વૃદ્ધત્વનો ઉકેલ શોધવા માટે ગિલ અને તેના સુપરવાઈઝર વુલ્ફ રિક સહિતના આ ક્ષેત્રના ઘણા મોટા નિષ્ણાતોને કાર્યમાં જોડ્યા છે.

અલ્ટોસ લેબ્સની ટોચની લીડરશીપમાં ગ્લેક્સો સ્મિથકલાઈનની રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ ટીમના ભૂતપૂર્વ વડા હેલ બેરોન, US નેશનલ કેન્સર ઈન્સ્ટિટ્યૂટના ભૂતપૂર્વ ડિરેક્ટર રિક ક્લાઉસનર અને જેનેટેકના ભૂતપૂર્વ વરિષ્ઠ ઉપપ્રમુખ એન લી-કાર્લોન આ સંશોધનમાં મુખ્ય ભૂમિકા ભજવી રહ્યા છે. તેમનું મિશન માણસને કાયમ માટે યુવાન રાખવાનો છે. આ માટે તેમને આધુનિક કુવારાની શોધ અને મૃત્યુને હરાવવાનો માર્ગ શોધવાનો છે. અલ્ટોસનો ઉદ્દેશ્ય બીમારીઓ અને વૃદ્ધત્વને કારણે થતાં નુકસાનને દૂર કરવાનો છે, જેના કારણે ઘણી વખત વ્યક્તિ અપંગ, લાચાર બની જાય છે. વળી, આવા જ કારણોસર દુનિયામાં મોતને ભેટનારા લોકોની સંખ્યા પણ વધુ રહે છે. અલ્ટોસ લેબનો મૂળ હેતુ ઉંમર વધતાં થતી પરેશાનીઓનો ઉકેલ શોધવા સાથે માણસની જિંદગીને 100-200 વર્ષ અને બની શકે તો 300 વર્ષ સુધી વધારવાનો છે. આ વાત આમ તો વધારે પડતી લાગે છે. પરંતુ આમ છતાં સંશોધકોના પ્રયત્નો સતત ચાલુ છે. રોગ અને પછી મૃત્યુ તરફ દોરી જતી પ્રક્રિયાઓને ધીમી કરવા અને તેને ઉલટાવી દેવાની કોશિશો માટે આ સંશોધનો થઈ રહ્યા છે. 5 BCમાં હેરોડોટસ અને 2021માં અલ્ટોસ લેબ્સ, 16મી સદીથી મનુષ્યો કાયમ યુવાન રહેવા ‘વૈજ્ઞાનિક રીતે’ માર્ગ શોધી વૃદ્ધત્વને ઉલટાવી લેવાનો પ્રયાસ કરતા રહ્યા છે.



વૃદ્ધત્વની સૌથી ખરાબ અસરોને અટકાવવાનો પ્રયાસ પણ કરતા રહ્યા છે.

1550માં એક ઈટાલિયન લુઈગી કોર્નારોએ ધ આર્ટ ઓફ લિવિંગ લોંગ પુસ્તક લખ્યું હતું, જેમાં તેણે લાંબું જીવન જીવવા માટે આદતો સુધારવા વિશે ચર્ચા કરી હતી. તે પછી 19મી સદી આવી અને વૈજ્ઞાનિક પ્રગતિએ શરીરના અનેક રોગો અને ખામીઓને ઓળખી લીધી, જે વધતી ઉંમર સાથે આવે છે. આ સાથે જ સંશોધનો દરમિયાન એવું પ્રસ્થાપિત થયું કે, વૃદ્ધાવસ્થા અને રોગ વચ્ચે અતૂટ સંબંધ હોવાથી વૃદ્ધાવસ્થાને જ શક્ય હોય તો દૂર કરવાની કોશિશ થવી જોઈએ. આ જ સમયની આસપાસ વૃદ્ધત્વના ઉકેલની શોધ બે અલગ અલગ રસ્તે વિભાજિત થઈ ગઈ હતી. કોર્નારોનો પહેલો રસ્તો, જે વૃદ્ધત્વની રક્તારને ધીમી કરવી અને શરીર પર વૃદ્ધત્વનાં ચિહ્નોને દૂર કરવા વિશેનો છે. વર્તમાન

**ઓફબીટ**  
ધવલ શુક્લ

અલગ થઈ ગયા હતા. એ પછી બેરોન 2022માં અલ્ટોસ લેબ્સના CEO બન્યા હતા. કેલિકો અને અલ્ટોસ લેબ્સ જેવી સંસ્થાઓ વૃદ્ધત્વને ઉલટાવવા કેવી રીતે પ્રયાસ કરી રહી છે તે જાણવું પણ જરૂરી છે. વૃદ્ધાવસ્થા એ ટેલોમેર શોર્ટનિંગનું

પ્રથમ પદ્ધતિમાં તેની અસરકારકતા સાબિત કરવા માટે ઘણી વસ્તુઓ છે, બીજી પદ્ધતિમાં હજુ પણ સંશોધન અને ફેરફારો થઈ રહ્યાં છે. આમ છતાં પણ આજે દુનિયાના સંશોધકો વૃદ્ધાવસ્થાને રોકવા અથવા ઉલટાવી દેવા વૈજ્ઞાનિક રીતે પહેલાં કરતાં વધુ આગળ ધપી ગયા છે. 2013માં ગૂગલ કો-ફાઉન્ડર લેરી પેજ દ્વારા ભંડોળ પૂરું પાડવામાં આવતી કંપની કેલિકો સાથે એન્ટી-એજિંગ સોલ્યુશન્સ માટેની શોધ શરૂ થઈ હતી.

રસપ્રદ વાત એ છે કે, 2017માં તેના બે ટોચના વૈજ્ઞાનિકો હેલ બેરોન અને ડેન્કે કોલર અચાનક કેલિકોથી અલગ થઈ ગયા હતા. એ પછી બેરોન 2022માં અલ્ટોસ લેબ્સના CEO બન્યા હતા. કેલિકો અને અલ્ટોસ લેબ્સ જેવી સંસ્થાઓ વૃદ્ધત્વને ઉલટાવવા કેવી રીતે પ્રયાસ કરી રહી છે તે જાણવું પણ જરૂરી છે. વૃદ્ધાવસ્થા એ ટેલોમેર શોર્ટનિંગનું

તમે વૃદ્ધ થવાનું શરૂ કરો છો. જો કે, તે એકદમ ખરાબ નથી. ટેલોમેર શોર્ટનિંગ ગાંઠોને વધતી અટકાવે છે અને કેન્સર સામે લડવામાં મદદ કરે છે પરંતુ સેન્સેટ કોશિકાઓ જ્વલનશીલ પદાર્થો પણ છોડે છે, જે વૃદ્ધાવસ્થા સાથે આવનારી અન્ય બીમારીઓ અને સમસ્યાઓને જન્મ આપે છે. તમારું શરીર ધીમે ધીમે તમારા કોષોને જાળવવાની ક્ષમતા ગુમાવે છે અને તમારા અંગોનું સ્વાસ્થ્ય ધીમે ધીમે બગડવા લાગે છે. હવે આમાંની કેટલીક એજ-રિવર્સલ કંપનીઓ વૃદ્ધત્વને અટકાવવા કેવા પ્રયાસ કરી રહી છે, તે જાણવું પણ જરૂરી છે. વૃદ્ધત્વને રોકવા માનવીઓનો હાલનો પ્રયાસ સારો રહ્યો છે. જો કે, હજુ સુધી ઊંડાણપૂર્વક તપાસ કરવામાં આવી નથી. કેલિકો દ્વારા 2020માં બહાર પાડવામાં આવેલા સંશોધન પેપરમાં સ્પષ્ટતા થઈ છે કે, સેલ રિપ્રોગ્રામિંગ કોષોની “નવયુવાન સ્થિતિને પુનઃસ્થાપિત” કરી શકે છે. પરંતુ સાથે કોષોની બેકાબૂ કોષો બનાવવા માટે તો ટ્યુમરનો ખતરો વધી જાય છે. એટલે તેનો અર્થ એ છે કે આ વૃદ્ધત્વ ઉલટાવી શકાય છે. પરંતુ કોષોની અનિયંત્રિત નકલનું કારણ બની શકે છે, જે ગાંઠો તરફ દોરી જઈ શકે છે. બર્મિંગહામ ખાતે યુનિવર્સિટી ઓફ અલાબામાં જિનેટિક્સ, પેથોલોજી અને પર્યાવરણીય સ્વાસ્થ્યના પ્રોફેસર ડૉ. કેશવ સિંઘે 2018માં દર્શાવ્યું હતું કે માર્થટોકોન્ડ્રીયલ કાર્ય વૃદ્ધત્વ સાથે સંકળાયેલું છે અને ઉદરમાં કૃત્રિમ રીતે માર્થટોકોન્ડ્રીયલ કાર્યને ધીમું કરી વૃદ્ધત્વની ગતિને ધીમી કરાઈ હતી. આ અભ્યાસનું તારણ એવું નીકળ્યું હતું કે, માર્થટોકોન્ડ્રીયલ ફંક્શન રિપેર કરવાથી વૃદ્ધ ત્વચાને વધુ યુવા, સ્વસ્થ સ્થિતિમાં પુનઃસ્થાપિત કરી શકાય છે. આ સાથે મનુષ્યના વાળનો વિકાસ પણ યુવાવસ્થા જેવો થવા લાગે છે.

આ અભ્યાસમાં ઉદરોને ડોક્સિસાયક્લિન નામની દવા આપીને કૃત્રિમ રીતે વૃદ્ધત્વને વેગ અપાયો, જે બાદ જેવી આ દવા બંધ કરવામાં આવી કે તરત ઉદરો પર અસર દેખાઈ. ઉદરોની ત્વચા યુવાન થઈ ગઈ હતી. તેના વાળમાં ફરીથી ચોક્કસ વૃદ્ધિ થઈ હતી. જો કે, આ બધા પ્રયોગો પછી પણ હજુ મનુષ્યમાં વૃદ્ધત્વને ઉલટાવી શકાય કે કેમ તે અંગે અનિશ્ચિતતા છે. દિલજીત ગિલ અને વુલ્ફ રિક દ્વારા 2019ના અભ્યાસમાં જાણવા મળ્યું છે કે, નિયમિત કોષોને સ્ટેમ સેલમાં રૂપાંતરિત કરવા માટે સેલ રિપ્રોગ્રામિંગ કરી શકાય છે. એટલે કોઈને પણ 25 વર્ષની યુવાવયે પરત લાવી શકાય છે.

## એમેઝોનના માલિક જૈફ બેઝોસે, ડીએસપીટી ગ્લોબલના યુરી મિલનર અને પે-પાલના પીટર થિએલે અબજોનું રોકાણ કરી વૃદ્ધાવસ્થાને દૂર ધકેલવા રિસર્ચ માટે અલ્ટોસ લેબ ઉભી કરી

યુગમાં આ ઉપાયોમાં કસરત, આરોગ્યપ્રદ ખોરાક, જરૂરી પોષણ, પૂરતી ઊંઘ લેવી અને જીવનશૈલીમાં જરૂરી ફેરફારો જેવી બાબતો છે. જ્યારે બીજો રસ્તો તેનાથી તદ્દન અલગ છે, જેમાં વૈજ્ઞાનિક ડી-એજિંગ કહે છે કે, વૃદ્ધત્વને એક રોગ તરીકે જોવામાં આવે છે, જેની પર “હુમલો કરી નાશ” કરવામાં આવે તો માણસને ફાયદો થાય.

પરિણામ છે. ટેલોમેરસ એ રંગસૂત્રની ધાર પરની નાની વસ્તુઓ છે અને તેઓ આપણી જિંદગીમાં વિભાજિત થતાંની સાથે નાના બની જાય છે અને પોતાની કોષી બનાવી લે છે.

ઘણી બધી નકલો બની ગયા પછી તેઓ વધુ વિભાજિત થઈ શકતા નથી. તેઓ ‘સેનેસેન્સ’ નામની સ્થિતિમાં પહોંચી જાય છે અને આ સમયે

# ભાજપ ગુજરાતમાં વહેલી ચૂંટણીની ફિરાકમાં, ઉમેદવારો પસંદગી માટે પીએમ મોદી સક્રિય

- ત્રણ રોડ શો યોજી  
પ્રધાનમંત્રીએ ભાજપનો  
જયજયકાર કર્યો  
અમદાવાદ

ગુજરાતમાં આવીને બે દિવસમાં ત્રણ રોડ શો અને ત્રણ સમારોહને ગજવનાર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આ સાથે જ દરેકને સ્પષ્ટ સંદેશ આપી દીધો છે કે ગુજરાતમાં દરેકને દોરી જવા તેઓ જ સક્ષમ છે. ગુજરાતની જનતા અને તેમની વચ્ચે અન્ય કોઈ જ મધ્યસ્થી નથી.

હવે પછી ગુજરાતના સંદર્ભમાં લેવાનારા દરેક નિર્ણય અને પગલાંઓ તેમની મંજૂરીથી જ લેવામાં આવશે.

રાજ્યમાં ૧-૨ ધોરણથી જ અંગ્રેજી વિષય ભણાવાશે

ગાંધીનગર

રાજ્યમાં પ્રાથમિક શિક્ષણ અંગે સરકારે આ મહત્વનો નિર્ણય લીધો છે. ગુજરાતમાં હવેથી ધોરણ-૧ અને ૨થી જ અંગ્રેજી વિષય દાખલ કરવામાં આવશે તેવી જાહેરાત શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી દ્વારા કરવામાં આવી છે. હાલમાં રાજ્યમાં પાંચમાં ધોરણથી અંગ્રેજી વિષય ભણાવવામાં આવે છે. પરંતુ હાલમાં અંગ્રેજીનું જ્ઞાન હોવું અત્યંત જરૂરી બની ગયું છે અને તેવામાં ગુજરાતના વિદ્યાર્થીઓ પણ અંગ્રેજીમાં પાછળ ન રહી જાય તે માટે સરકાર શરૂઆતથી જ આ વિષય ભણાવવાનું શરૂ કરશે. ધોરણ-૧ અને ધોરણ-૨થી જ અંગ્રેજી ભણાવવામાં આવશે.

તેમના સિવાય કોઈની મંજૂરી લેવાની રહેશે નહિ. આ સાથે જ તેમણે આપેલા વક્તવ્યો દરમિયાન ગુજરાતના મુખ્યમંત્રી તરીકે ભૂપેન્દ્ર પટેલના નામ તથા ગુજરાત પ્રદેશ ભાજપના પ્રમુખ તરીકે સી.આર. પાટિલના નામને જ મંજૂરીની મહોર મારી છે.

ગત અઠવાડિયે બે દિવસમાં યોજાયેલા દરેક સમારોહમાં મુખ્યમંત્રી અને ભાજપના પ્રદેશ પ્રમુખ પ્રધાનમંત્રીની સાથે સાથે જ રહ્યા હતા. એરપોર્ટથી શ્રી કમલમ સુધીના રોડ શો, વસ્ત્રાપુરના સમારોહ તથા આજના દહેગામ સુધીના રોડ શો અને સરદાર પટેલ સ્ટેડિયમમાં મહાકુંભ સહિતના દરેક કંકણમાં ભૂપેન્દ્ર પટેલ અને સી.આર. પાટિલ તેમની સાથે જ ઉપસ્થિત રહ્યા હતા.

કમલમ ખાતે યોજવામાં આવેલી પક્ષના ચૂંટણી વ્યૂહ અંગેની બેઠકમાં પણ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નિર્દેશ આપ્યો હતો કે ગુજરાતમાં યોજનારી આગામી વિધાનસભાની ચૂંટણી દરમિયાન પણ ભાજપના મુખ્ય ચહેરા તરીકે પોતાની જાતને જ પ્રોજેક્ટ કરવામાં આવશે.

ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણી માત્ર ને માત્ર નરેન્દ્ર મોદીના નામને ચહેરો બનાવીને લડવામાં આવશે, કારણ કે ગુજરાતની જતનતા સાથેનો તેમનો સીધો નાતો ઘણો જ મજબૂત છે.

## ગુજરાતમાં વિદ્યાર્થીઓને ભણાવાશે હવે શ્રીમદ્ ભગવદ્ ગીતાના પાઠ

અમદાવાદ

ગુજરાતની શાળાઓમાં હવે શ્રીમદ્ ભગવદ્ ગીતાના પાઠ વિદ્યાર્થીઓને ભણાવવામાં આવશે. ગુજરાત સરકારે નવી શિક્ષણ નીતિ હેઠળ આ નિર્ણયની જાહેરાત કરી છે. તમામ શાળાઓમાં ધોરણ ૬થી ધોરણ ૧૨ના ક્લાસમાં ગીતાના પાઠ ભણાવવામાં આવશે. વિદ્યાર્થીઓને ગીતાના સિદ્ધાંતો અને મૂલ્યોનો અભ્યાસ કરાવવામાં આવશે. નવી શિક્ષણ નીતિ હેઠળ ગીતાનો અભ્યાસ ફરજિયાત કરવામાં આવ્યો છે. રાજ્યના શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી દ્વારા આ નિર્ણયની જાહેરાત કરવામાં આવી છે. હવે રાજ્યમાં સ્કૂલના બાળકો પણ

પણ ગીતાના શ્લોકોનો પાઠ કરશે.

રાજ્ય સરકારે ભલામણ કરતાં શૈક્ષણિક વર્ષ ૨૦૨૨-૨૩થી શાળા શિક્ષણમાં ભારતીય સંસ્કૃતિ અને જ્ઞાનપ્રણાલીનો સમાવેશ કરવાનો રહેશે. જે પૈકી પ્રથમ તબક્કામાં રાજ્યની શાળાઓમાં ધોરણ ૬થી ૧૨માં શ્રીમદ્ ભગવદ્ ગીતામાં સમાવિષ્ટ મૂલ્યો અને સિદ્ધાંતોનો બાળકોને સમજ અને રસ પડે તે પ્રમાણે પરિચય કરાવવામાં આવે. ધોરણ ૬થી ૮માં શ્રીમદ્ ભગવદ્ ગીતાનો પરિચય સર્વાંગી શિક્ષણ વિષયના પાઠ્ય પુસ્તકમાં વાર્તા અને પઠન-પાઠન વગેરે સ્વરૂપે આપવામાં આવે.

# ગુજરાત કોંગ્રેસમાં સળવળાટ, રાહુલને મળવા 25 ધારાસભ્યોએ પત્ર લખ્યો

વિધાનસભાની 2017ની ચૂંટણીમાં કોંગ્રેસને સૌરાષ્ટ્રમાં વધુ બેઠકો મળી હતી

રાજકોટ

ગુજરાત વિધાનસભાની આગામી ચૂંટણીને લઈને સૌરાષ્ટ્ર - ગુજરાતનાં કોંગ્રેસનાં ધારાસભ્યોમાં સળવળાટ જોવા મળ્યો છે. ૨૫ જેટલા કોંગ્રી ધારાસભ્યોએ પત્ર લખીને પક્ષનાં નેતા રાહુલ ગાંધીને મળવાનો સમય માગ્યો છે. જો કે કોંગ્રેસમાં આ મુદ્દે પણ ધારાસભ્યો બે જૂથમાં વહેંચાયા હોવાનું ચિત્ર ઉપસ્યુ છે. ગુજરાતમાં હજુ પ્રદેશ કોંગ્રેસ સંગઠનનું નવું માળખું જાહેર કરી શક્યુ નથી. વર્તમાન રાજકીય માહોલમાં

આગામી ગુજરાત વિધાનસભાની ચૂંટણી એ પક્ષ માટે મોટો પડકાર હોવાથી ગુજરાત કોંગ્રેસનાં ધારાસભ્યોનાં એક જૂથે દિલ્હીમાં પક્ષનાં નેતાઓને મળવા પ્રયાસો શરુ કર્યા છે. દરમિયાન રાજકોટમાં કોંગ્રેસનાં ધારાસભ્ય લલિત કુશરાએ જણાવ્યુ હતું કે, ૨૦૧૭ની વિધાનસભાની ચૂંટણીનાં સમયે પાટીદાર આંદોલનનાં કારણે જે માહોલ ઉભો થયો હતો તેને કારણે કોંગ્રેસને ફાયદો થયો હતો, ખાસ કરીને સૌરાષ્ટ્રમાં સૌથી વધુ બેઠકો કોંગ્રેસે મેળવી હતી પરંતુ આગામી ૨૦૨૨ની

વિધાનસભાની ચૂંટણીમાં હાલ આવો કોઈ વેવ નથી ત્યારે વર્તમાન સ્થિતિમાં કોંગ્રેસે જીત મેળવવા કેવી રણનીતિ અપનાવી જોઈએ તેની ચર્ચા કરવી જરૂરી છે એટલે ગુજરાત કોંગ્રેસનાં ૨૫ જેટલા ધારાસભ્યોએ રાહુલ ગાંધીની હાજરીમાં સોનિયા ગાંધી સાથે બેઠક કરવા સમય માગ્યો છે. અત્રે ઉલ્લેખનીય છે કે ગુજરાત કોંગ્રેસનાં ધારાસભ્યો રાહુલ ગાંધીને દ્વારકામાં ચિંતન શિબિર વખતે જ મળવા માગતા હતા પરંતુ પ્રદેશનાં નેતાઓ આ બેઠક ગોઠવી શક્યા ન હતા.

## કોઈપણ મા-બાપ યુવાનોને રમતના મેદાન પર જતાં ન રોકે : નરેન્દ્ર મોદી

અમદાવાદ

ખેલ મહાકુંભે જ સ્પોર્ટ્સના વિકાસમાં મોટી ભૂમિકા ભજવીને યુવાનોને દુનિયાના મંચ પર ભારતને તિરંગો લહેરાવીગૌરવ અપાવવાનું કામ કર્યું હોવાથી કોઈપણ માતા પિતા તેમના સંતાનોને રમતગમતના મેદાનમાંથી પાછા ખેંચી લઈને ચોપડીમાં ખૂંપાવી દેવાની કોશિશ ન કરવા અને તેમને આગળ વધવા પ્રોત્સાહન આપવાની સલાહ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આજે અમદાવાદ શહેરમાં સરદાર પટેલ સ્ટેડિયમ ખાતે 11માં ખેલમહાકુંભનું

વિમોચન કરતાં આપી હતી. વધુમાં તેમણે કહ્યું હતું કે, ગામેગામમાં થતાં રમતોત્સવ જોવા દરેક પરિવારોએ ઉપસ્થિત રહેવું જોઈએ. તેમની હાજરી અને તેમની તાળીઓનો ગડગડાટ પણ યુવા ખેલાડીઓના જુસ્સાને બુલંદ બનાવે છે, જે યુવાનોને નવા ભારતના નિર્માણ કરવા માટે પણ સજ્જ પણ કરશે. આ સાથે જ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ 1600 કિલોમીટરનો દરિયાકિનારો ધરાવતા ગુજરાતમાં બીચ સ્પોર્ટ્સનું કલ્ચર ચાલુ કરવા પણ ગુજરાતની યુવા પેઢીને આવાહન આપ્યું હતું.

## સરકારની મંજૂરી લીધા વિના પ્રાથમિક સ્કૂલોના 99 શિક્ષકો વિદેશ ઉપડી ગયા

ગાંધીનગર

ગુજરાતમાં સરકારને જાણ કર્યા વિના 99 સરકારી સ્કૂલના શિક્ષકો વિદેશ ઉપડી ગયા છે. રાજ્યની સરકારી સ્કૂલોમાં કુલ 347 જેટલા શિક્ષકો એવાં હતા કે જેઓ મંજૂરી વિના લાંબી રજા પર ઉતરી ગયા હતા. શિક્ષણ વિભાગે બેદરકાર રહેલા 128 શિક્ષકોને ફરજમુક્ત કર્યા છે. વિધાનસભામાં એક પ્રશ્નના લેખિત જવાબમાં શિક્ષણ મંત્રીએ જણાવ્યું હતું મોટાભાગના આવા કિસ્સા સરકારી સ્કૂલોના જોવા મળ્યા છે.

## સંક્ષિપ્ત સમાચાર

### કોંગ્રેસના MLA ડૉ. જોષીયારાનું નિધન



**અમદાવાદ :** કોરોના સંક્રમિત કોંગ્રેસના ધારાસભ્ય અને પૂર્વ આરોગ્યમંત્રી ડૉ.અનિલ જોષીયારાનું નિધન થયું છે. છેલ્લા એક મહિનાથી ચેન્નાઈમાં એકમો ટેકનિકથી ડૉ.જોષીયારાની સારવાર ચાલી રહી છે. 69 વર્ષની વયે તેઓ કોરોના સામેનો યંગ હારી ગયા હતાં. મિલોડાના ધારાસભ્ય ડૉ.અનિલ જોષીયારા કોરોના સંક્રમિત હતાં જેના કારણે તેઓને અમદાવાદ સ્થિત એક ખાનગી હોસ્પિટલમાં રખાયા હતાં. આમ છતાંય તેમના ફેફસા કામ કરી શકતા ન હતાં. લાંબી સારવારના અંતે સોમવારે બપોરે એક વાગે ડૉ.જોષીયારાનું અવસાન થયું હતું. આ દુખદ ઘટનાને પગલે ગૃહમાં કોંગ્રેસના ઉપનેતા શૈલેષ પરમારે વિધાનસભા ગૃહ મુલતવી રાખવાની દરખાસ્ત મૂકી હતી જેને સંસદીય મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ ટેકો આપ્યો હતો. બે મિનીટનું મૌન પાળીને ગૃહની બેઠક મુલતવી રાખવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે પણ શ્રદ્ધાંજલિ અર્પી હતી.

### રાજ્યમાં અગનવર્ષા: તાપમાન 41 સે.ને પાર

રાજકોટ : ગુજરાતમાં સામાન્ય રીતે માર્ચના અંતિમ સપ્તાહમાં નોંધાતી ગરમી આ વર્ષે માર્ચના બીજા સપ્તાહથી, અને દેશી કેલેન્ડર મૂજબ હોળી પહેલા ૪ હીટ વેવ શરુ થયો છે. ગુરુવારે ગુજરાતના 11 શહેરોમાં તાપમાનનો પારો ૪૧ સે.એ પહોંચી ગયો હતો અને અમદાવાદ, સુરેન્દ્રનગરમાં તો રાઉન્ડ ફીગરમાં તાપમાન ૪૨ સે.નોંધાયું છે. હોળી તાપ્યા પહેલા ૪ ઠંડીની માત્ર વિદાય નહીં પણ બળબળતા તાપથી લોકોમાં આશ્ચર્ય ફેલાયું છે. હવે બે દિવસ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં હીટવેવની આગાહી કરાઈ છે.



### આમ આદમી પાર્ટી બમણાં જોરથી ચૂંટણી લડશે

**રાજકોટ :** ઈ. 2017 ધારાસભા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીએ મજબૂત સંગઠન, નેટવર્ક વગર ચૂંટણીમાં ઝુકાવતા બેઠકો તો મળી નહોતી પણ મતો મળ્યા હતા અને હવે આ પક્ષને દિલ્હીમાં મર્યાદિત સત્તા બાદ રાજ્ય સરકારની પૂર્ણ સત્તા સાથે પંજાબમાં જીત પછી ગુજરાતમાં ભાજપ સામે બમણાં જોરથી ચૂંટણી લડવાનો આજે રાજકોટમાં જાહેર કરાયો હતો. દિલ્હીથી આવેલા આમ આદમી પાર્ટીના બે નેતાઓએ જણાવ્યું કે ચૂંટણી પરિણામો પછી ગુજરાતના લોકોનો ભરોસો વધી રહ્યો છે. આજે પંજાબના પરિણામથી સર્જાયેલા માહોલની તકનો લાભ લઈ રાજકોટમાં આમ આદમી પાર્ટીએ આજે તિરંગા યાત્રા ચોજી હતી અને બાદમાં યોજાયેલા કાર્યક્રમમાં પ્રથમવાર ભાજપનું કાર્ય કરતા 15થી વધુ કાર્યકરો કે જેઓએ તેમની સાથે બીજા દોરસો કાર્યકરો હોવાનું જણાવ્યું છે તેઓ આજે આપમાં જોડાયા હતા. મંચ ઉપર 60થી વધુ લોકોએ આપની ટોપી પહેરી લીધી હતી. ભાજપના કેટલાક નેતા અંદરખાને આપને મદદ કરી રહ્યાનું પણ સૂત્રો જણાવે છે.

### ગુજરાતમાં બાળકોના રસીકરણનો પ્રારંભ

ગાંધીનગર : મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર શહેરની બોરીજ પ્રાથમિક શાળા ખાતેથી રાજ્યમાં 12થી 14 વર્ષની વયજૂથના બાળકોને કોરોના વેક્સિનેશનના સુરક્ષા કવચથી આવરી લેવાની કામગીરીનો રાજ્યવ્યાપી પ્રારંભ કરાવ્યો હતો. ભારત સરકારની માર્ગદર્શિકા મુજબ રાજ્યમાં આજે તા. 16 માર્ચ, બુધવારથી આ વેક્સિનેશન કાર્યવાહીનો આરંભ થયો છે. ગુજરાતમાં આ કામગીરી અંતર્ગત 12થી 14 વર્ષની વયના 22.63 લાખ જેટલા બાળકોને કોવિડ-19ની રસી આપવામાં આવશે. રાજ્યના આરોગ્ય વિભાગ પાસે આ હેતુસર કોર્બેવેક્સ નામની રસીના 23.05 લાખ ડોઝ ઉપલબ્ધ છે અને તેને કોલ્ડ ચેઇન પોઈન્ટ સુધી પહોંચાડવામાં આવ્યા છે. તેને 2થી 8 ડિગ્રી સેન્ટીગ્રેડ તાપમાન પર સ્ટોર કરવામાં આવે છે. રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ, માતૃ અને બાળ વિકાસ વિભાગ તથા અન્ય સંબંધિત વિભાગના સહયોગથી આ કોર્બેવેક્સ વેક્સિનેશન ડોઝ પાત્રતા ધરાવતા તમામ બાળકોને અપાવાના છે. તદ્દનુસાર વેક્સિનેશન પ્રથમ ડોઝ લીધાના 28 દિવસ બાદ બીજો ડોઝ અપાશે.

### વીજ ચોરી પકડવા ડ્રોનનો પ્રથમવાર ઉપયોગ

**અંજાર :** ગુજરાતમાં વીજ ચોરીને પકડવા માટે પહેલીવાર વીજ કંપની દ્વારા ડ્રોનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. પશ્ચિમ ગુજરાત વીજ કંપની લિમિટેડ કંપનીએ હાઇટેક ડ્રોન કેમેરાની મદદથી ગાંધીધામના આદિપુર વિસ્તારમાં આવેલા મીઠાના અગરના એકમો પાસેથી અંદાજે રૂ. 48 લાખની વીજ ચોરી પકડી પાડી છે. આદિપુર પાસે આવેલા સંઘાડ ગામ નજીક આવેલ મીઠાના અગરોના વીજ જોડાણ તા. ૧૧.૦૩.૨૦૨૨ના રોજ ચેક કરતા કુલ ત્રણ જોડાણોમાં ટ્રાન્સફોર્મરની એલટી પીલ્ડરપુફ કરેલા સ્ટડને ડેમેજ કરીને વીજ ચોરી કરવા માટેની વ્યવસ્થા કરવામાં આવી હતી. આ વીજ જોડાણોમાં અંદાજ રૂ. ૧૫ લાખની વીજ ચોરીના પુરવણી બીલો આપવામાં આવેલા છે. આમ આદિપુર વિસ્તારમાં મીઠાના અગરોને કુલ અંદાજિત 48 લાખ રૂપિયાના વીજ ચોરીના બીલો ફટકારવામાં આવતા વીજ ચોરી કરનાર લોકોમાં ફફડાટ ફેલાયો છે.





# અપનાવો આ હેર સ્ટાઈલ : દેખાશો કંઈ અલગ

## એલિગેંટ સ્ટાઈલ



પ્રસંગ ખાસ હોય તો હેરસ્ટાઈલ પણ ખાસ હોવી જોઈએ તો જ પ્રસંગની રંગત જામે. ગ્લેમરસ લુક માટે આ હેરસ્ટાઈલ કરો ફટાફટ અને થઈ જાઓ ઝટપટ

તૈયાર તમારી અદાઓનો જાદુ વિખેરવા. પહેલાં નીચેના વાળમાં હોટ રોલ્સનો પ્રયોગ કરો. સેટ કરવા માટે મૂસ લગાવો. આગળના વાળને બંને બાજુથી પિનઅપ કરો.

## ઓપન હેરસ્ટાઈલ



વાળને ઘોઈને છૂટા રાખવા એ સામાન્ય વાત છે, પરંતુ કર્લ કરી છૂટા રાખવાથી તે અલગ જ લુક આપશે. પહેલાં વાળમાં કલર્સનો ઉપયોગ કરો. થોડીવાર પછી

વાળ સેટ થઈ જાય તો તેને ધીમેથી કાઢી લો. કર્લ થયેલા કેશ પર લાઈટ હેરસે કરો જેથી કર્લ ખરાબ ન થાય. એક બાજુ વાળમાં નાની હેર ક્લિપ અથવા બીડ્સ લગાવો.

## કર્લી હેરસ્ટાઈલ



લોંગ સ્ટ્રેટ હેર કર્લ કરી એક નવો લુક આપો. વાળ ઉપરથી નીચે સુધી કર્લ કરો પછી ઉપરની તરફ કર્લ કરેલા વાળનો અંબોડો બનાવો. અંબોડો

કરતાં પહેલાં કર્લ કરેલી એકબે લટ બહાર કાઢી લો. હેરસ્ટાઈલ આકર્ષક લાગે એ માટે બટરફ્લાય ક્લિપ અથવા ડ્રેસ સાથે મેચ થતી બીજી કોઈ ક્લિપ લગાવો.

## સ્ટાઈલિશ હેરસ્ટાઈલ



ઈવનિંગ પાર્ટીમાં જવા માટે તમારા કાળા રેશમી વાળની આ રીતે હેરસ્ટાઈલ કરો. પહેલાં વચ્ચે પાથી પાડી વાળ બંને બાજુ ક્લિપ દ્વારા સેટ કરી લો. પછી પાછળના

નીચેની તરફના વાળ કે જે અગાઉથી જ કર્લ કર્યા છે એને પાછળની બાજુ ઉપરનીચે એવી રીતે પિનઅપ કરો કે કર્લ દેખાય. સાઈડમાં હેર બ્રોચ અથવા ક્લિપથી સજાવો.

## ઘરે કસરત કરવી હોય તો વસાવી લો આ વસ્તુ

સ્ત્રીઓ ઘરે કસરત કરીને પોતાની જાતને ફિટ રાખી શકતી હોય છે. અલબત્ત, ઘરે અમુક યોગાસન કરીને ફિટ રહી શકાય છે પણ તેની સાથે સાથે અમુક સાધનો પણ ઘરે વસાવવાં જરૂરી હોય છે જેનો ઉપયોગ કરીને તમે કસરત કરી શકો છો. આ સાધનો કયા કયા તે જાણવા જેવું.

### દોરડાં ફૂદવા

દોરડાં ફૂદવાં એ શ્રેષ્ઠ કાર્ડિયાક વર્કાઉટની કેટેગરીમાં આવે છે. તેથી જ તમે ઘરે જ વર્કાઉટ કરવાનું વિચારી રહ્યાં હોવ તો દોરડાં અચૂક વસાવો. તમે ચાહો તો સ્માર્ટ રોપ પણ વસાવી શકો છો. સ્માર્ટ રોપ તમારી ફિટનેસ બાબતે તમને ડેટા પણ બતાવે છે. તમે દોરડાં ફૂદવાની સાથે તમારી ફિટનેસ બાબતે પણ સ્માર્ટ રોપ થકી જાણી શકો છો. સ્માર્ટ રોપ સ્માર્ટ વોચ સાથે એટેચ કરવામાં આવે છે જેથી ડેટા પ્રાપ્ત થઈ શકે.



### સ્માર્ટ વોચ રાખવી

આજના યુગમાં સ્માર્ટ વોચ ખૂબ જ મદદગાર થાય છે. તે તમારા ઇબકારા બતાવવાની સાથે તમે આખા દિવસમાં કેટલાં સ્ટેપ્સ ચાલ્યા અને તમારે ખરેખર કેટલું ચાલવાની જરૂર છે તે પણ બતાવે છે. તમે કહો કે તે જોઈને તમને પ્રેરણા પણ મળી શકશે, માટે તે પણ ચોક્કસ વસાવી લેવી જોઈએ. આ સિવાય પણ બીજાં ત્રણ સાધનો વિશે આવતાં સમાહમાં વાત કરીશું.

કવચિત્રી : હિના મોદી,  
શીર્ષક : કાશ...!

કાશ...  
મારી પણ મા હોત - તો,  
એના છીપ સમાન ખોબામાં  
મારાં વહી જતાં અશ્રુચિંદુઓને ઝીલી  
લેત; ને,  
મોતીડાં પકવી દેત.  
કાશ...  
મારી પણ મા હોત - તો,  
દલનકુંડ જેવી એની છાતીએ મને ચાંપી  
મારી હૃદયવેદનાને ભસ્મીભૂત કરી દેત.  
કાશ...  
મારી પણ મા હોત - તો,  
આ માણસનાં જંગલમાં સિંહણ બની  
મને, શિકારીઓનાં પંજામાંથી ઉગારી  
લેત.  
કાશ...

## CaddyWiper



યુકેન સામેના હુમલામાં ડેટા વાઈપર સ્ટ્રેઈન વિશે વિગતો બહાર આવ્યાના બે અઠવાડિયા પછી રશિયામાં સતત લશ્કરી આક્રમણ વચ્ચે વધુ એક વિનાશક માલવેર શોધી કાઢવામાં આવ્યો છે. સ્વોવાક સાયબર સિક્યુરિટી કંપની ESET એ ત્રીજા વાઈપરને "CaddyWiper" તરીકે ઓળખાવ્યું હતું. જે સૌપ્રથમ 14 માર્ચ 2022 ના રોજ મળી આવ્યું હતું. એક્ટિવિટીબલ ("caddy.exe") સાથે સંકળાયેલ મેટાડેટા દર્શાવે છે કે માલવેર સૌપ્રથમ સંકલિત કરવામાં આવ્યું હતું.

વધુમાં કંપનીએ જણાવ્યું હતું કે આ નવો માલવેર એટેચ ડાઈવમાંથી યુઝર ડેટા અને પાર્ટીશનની માહિતીને ભૂંસી નાખે છે. ESET ટેલિમેટ્રી દર્શાવે છે કે તે મર્યાદિત સંખ્યામાં સંસ્થાઓમાં થોડા ડઝન સિસ્ટમો પર જોવામાં આવ્યું હતું.

CaddyWiper એ હકીકત માટે નોંધપાત્ર છે કે તે યુકેનમાં અગાઉ શોધાયેલા વાઈપર સાથે કોઈ સમાનતા શેર કરતું નથી. અગાઉ વાઈપરના 2 વેરિયન્ટ મળ્યા હતા જેમાં HermeticWiper જેને FoxBlade અથવા KillDisk તરીકે પણ ઓળખવામાં આવે છે અને IsaacWiper. આ બંને વેરિયન્ટ મોટેભાગે સરકારી સંસ્થા અને વ્યાપારી સંસ્થાઓની સિસ્ટમમાં દાખલ કરવામાં આવ્યું હતું.

HermeticWiper જે સૌપ્રથમ ૨૮ ડીસેમ્બર ૨૦૨૧ માં મળી આવ્યો હતો. જ્યારે

IsaacWiper એ ૧૯ ઓક્ટોબર ૨૦૨૧ માં મળી આવ્યો હતો. CaddyWiper આ બંને વેરિયન્ટથી વિપરીત છે પરંતુ બધા વેરિયન્ટ સમાન ફેમિલીમાં હોવાનું અનુમાન છે. એટલે કે બધા વેરિયન્ટ એક જ હેકર ગ્રુપ દ્વારા બનાવવામાં આવ્યા હશે. પરંતુ નવા શોધાયેલ વાઈપર હર્મેટિકવાઈપર સાથે એક વ્યૂહાત્મક ઓવરલેપ શેર કરે છે. જેમાં માલવેર વિન્ડોઝ ડોમેન કંટ્રોલર દ્વારા તૈનાત કરવામાં આવ્યું હતું. જે દર્શાવે છે કે હુમલાખોરોએ એક્ટિવ ડિરેક્ટરી સર્વર પર નિયંત્રણ મેળવી લીધું છે.

Cisco Telos ના રિસર્ચર જણાવે છે કે યુકેનમાં ચાલી રહેલા યુદ્ધમાં વૈશ્વિક રસ તેને સાયબર અપરાધીઓ માટે શોષણ કરવા માટે એક અનુકૂળ અને અસરકારક સમાચાર ઘટના બનાવે છે. પરંતુ માત્ર યુકેન જ નહીં જે વાઈપર હુમલાઓના અંતમાં છે. ગયા અઠવાડિયે, સાયબર સિક્યુરિટી ફર્મ ટ્રેન્ડ માઈક્રોએ .NET-આધારિત RURansom નામના વાઈપરની વિગતો જાહેર કરી હતી જેણે રેન્ડમલી જનરેટ કરેલી ક્રિપ્ટોગ્રાફિક કી વડે ફાઈલોને એન્ક્રિપ્ટ કરીને રશિયામાં વિશિષ્ટ રૂપે એકમોને લક્ષ્યાંકિત કર્યા છે.

રિસર્ચર જણાવે છે કે દરેક એન્ક્રિપ્ટેડ ફાઈલ માટે કી અનન્ય છે અને ગમે ત્યાં સંગ્રહિત થતી નથી. જે એન્ક્રિપ્શનને બદલી ન શકાય તેવી બનાવે છે અને માલવેર અને રેન્સમવેર વેરિઅન્ટને બદલે વાઈપર તરીકે ચિહ્નિત કરે છે.

@beinghumanmj

## DIVINE YOGA

By Geeta

### Children Yoga Class

Every Tuesday 5-6 PM

---

### Adult Yoga Class

Every Saturday 9-10 AM

Join today on ZOOM!

: Classes Available :  
One to One Individual  
and Therapeutic

Geeta Tailor

416-456-2261

Contact Geeta at  
divineyogabygeeta@gmail.com  
IG & FB: @divineyogabygeeta

# ખસ્તાહાલ: ગુજરાત સરકારે જાહેર દેવાના વ્યાજ પેટે બે વર્ષમાં 42,292 કરોડ ચૂકવ્યા

સરકારનું જાહેર દેવું માર્ચ 2021ના અંતે 300963 કરોડ, એક વર્ષના અંતે 20 હજાર કરોડ થશે

**ગાંધીનગર**

ગુજરાત સરકારનું જાહેર દેવું વધતું જાય છે, જેના કારણે વ્યાજની રકમમાં પણ વિક્રમી વધારો થઈ રહ્યો છે. 31મી માર્ચ 2021ના અંતે એક વર્ષમાં દેવાની રકમ 300963 કરોડ રૂપિયા સુધી પહોંચી છે, જ્યારે રાજ્ય સરકારે દેવાના વ્યાજપેટે છેલ્લા બે વર્ષમાં 42292 કરોડનો ખર્ચ કર્યો છે.



વિધાનસભામાં વિપક્ષના ધારાસભ્યએ પૂછેલા પ્રશ્નના જવાબમાં રાજ્યના નાણામંત્રીએ કહ્યું હતું કે રાજ્યનો વિકાસ કરવો હોય તો જાહેર દેવું કરવું જરૂરી છે. જાહેર દેવાં પેટે સરકારે 2019-20માં 20293 કરોડ વ્યાજ ચૂકવ્યું છે અને 16701

કરોડ રૂપિયા મુદત આપી છે. એવી જ રીતે સુધારેલા અંદાજ પ્રમાણે 2020-21માં એટલે કે માર્ચ 2021 સુધીમાં સરકારે એક વર્ષમાં વ્યાજપેટે 22099 કરોડ રૂપિયા ચૂકવ્યા છે અને 17918 કરોડ રૂપિયા મુદત આપી છે. સરકાર પર દરવર્ષે વ્યાજનું ભારણ વધતું જાય છે. જાહેર દેવામાં વ્યાજના દરો અંગે નાણામંત્રીએ જણાવ્યું હતું કે નાણાકીય સંસ્થાઓની લોન 4.96 ટકાના વ્યાજે મળે છે. એ ઉપરાંત બજાર લોન 7.85 ટકાના દરે લેવામાં આવે છે. એનએસએસએફ લોન 9.55 ટકાના વ્યાજદરે મળે છે જ્યારે કેન્દ્રીય દેવામાં 2.29 ટકાનું વ્યાજ હોય છે.

## ક્લાસીફાઈડ / Classified

**MOTEL JOB**  
Front- Desk Help, Computer Knowledge Preferred, and other motel help work.  
Email : wallaceburginn@gmail.com  
Call in Afternoon  
Cell : 647-931-0721

## સયાણા પાસે બોલેરોએ સાધ્વીજી અને સેવિકાને અડફેટે લેતા બંનેના મોત

**વિરમગામ**  
શુક્રવારના રોજ જખવાડા નાગેશ્વર ધામથી સાધ્વીજી તત્વપ્રજ્ઞાશ્રીજી મ.સા. વ્હીલચેરમાં લઈ સેવિકા કંચનબેન સાથે જઈ રહ્યા હતા. ત્યારે બોલેરો પીકઅપ વાહનના ચાલકે વ્હીલચેરને પાછળથી જોરદાર ટક્કર મારતા અકસ્માત સર્જતા વ્હીલચેરમાં બેઠેલા સાધ્વી તત્વપ્રજ્ઞાશ્રીજી અને વ્હીલચેર ચાલક કંચનબેનના શરીરના ભાગે ગંભીર ઈજાઓ પહોંચતા ઘટના સ્થળે મોત નિપજ્યું હતું. બોલેરો પીકઅપ વાહન રોડની સાઈડ ઉપર આવેલ વરસાદી ગટર કુદાવીને બાજુમાં પસાર થતી રેલ્વેટ્રેક ઉપર અટકી ગઈ હતી. આ બનાવ બનેલો ત્યારે વિરમગામ સ્થા. જૈન સંઘના ટ્રસ્ટી ઈલેશ દોશી સહિતના મિત્રો ત્યાંથી ગાડીમાં અમદાવાદ જઈ રહ્યા હતા ત્યારે આ અકસ્માત જોતા ગાડી ઉભી રાખી વિરમગામ જૈન સંઘના અગ્રણીઓ ઘટનાની જાણ થતા વિરમગામથી જૈન સમાજના અગ્રણીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા. સાધ્વીજી મ.સા. તથા સેવિકાની લાશને પી.એમ. અર્થે વિરમગામ સરકારી હોસ્પિટલમાં ખસેડવામાં આવી હતી. બાદમાં સાધ્વીજી મ.સા.ને થરા મુકામે અંતિમ ક્રિયા માટે લઈ જવામાં આવ્યા હતા.

## 519 ગુજરાતી માછીમાર હજુ પણ પાક.ની જેલમાં : માત્ર 20 જ છુટયા

**અમદાવાદ**  
દરિયાઈ સરહદ પર પાકિસ્તાન મરીનની અવળચંડાઈ યથાવત રહી છે. દરિયામાં માછીમારી કરતાં માછીમારોને પકડી લઈ જવામાં આવી રહ્યા છે. વિધાનસભા ગૃહમાં સરકારે એ વાતની કબૂલાત કરી છેકે, આજની તારીખે ગુજરાતના 519 માછીમારો પાકિસ્તાનની જેલમાં સબડી રહ્યા છે. છેલ્લા બે વર્ષમાં માત્ર 20 જ માછીમારોને મુક્ત કરવામાં આવ્યા છે. ગુજરાત વિધાનસભા ગૃહમાં વિપક્ષના ધારાસભ્યોએ પૂછેલાં સવાલોના જવાબમાં સરકારે એવો ખુલાસો કર્યો છેકે, વર્ષ 2020માં 163 અને વર્ષ 2021માં 195 એમ બે વર્ષમાં કુલ મળીને 358 માછીમારોને પાકિસ્તાન મરીને પકડી લીધા હતાં. પાકિસ્તાન મરીનના હાથે પકડાયેલા ગુજરાતી માછીમારોના જીવન ગુજારા માટે રાજ્ય સરકાર દ્વારા દૈનિક રૂ.300ની સહાય આપવામાં આવે છે. વર્ષ 2020માં સરકારે 184 અને વર્ષ 2021માં 323 કુટુંબોને સહાય ચૂકવી છે. વિપક્ષના આરોપ છેકે, પાકિસ્તાનની જેલમાં 519 માછીમારો સબડે છે પણ સહાય માત્ર 323 કુટુંબોને જ ચૂકવવામાં આવી છે. રાજ્ય સરકારે ગુજરાતના માછીમારોને મુક્ત કરવા પ્રયાસો કર્યા છે. સરકારનું કહેવું છેકે, પાકિસ્તાની જેલમાં માછીમારોને છોડાવવા માટે ગુજરાત સરકારે વર્ષ 2020માં સાત વાર અને વર્ષ 2021માં અગિયાર વાર એમ કુલ મળીને 18 વાર રજૂઆત કરવામાં આવી હતી. આમ છતાંય વિપક્ષનો આરોપ છેકે, સરકાર દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી.

# પોલીસ દ્વારા વકીલને માર મારવાનો મુંદ્રા પોર્ટ પર પકડાયેલા હેરોઈનનાં નાણાં મુદ્દો ગંભીર, તપાસ થશે : હાઈકોર્ટ આતંકી સંગઠનો પાસે જવાના હતાં: NIA

**અમદાવાદ**  
રાજકોટ જિલ્લાના જામકંડોરણામાં અસીલને સલાહ આપવા બદલ વકીલને પોલીસ સ્ટેશનમાં ગોંધી રાખી માર મારવામાં આવ્યો હોવાનો અને તેના કારણે પેરાલિસિસનો એટેક આવ્યો હોવાનો આક્ષેપ કરતી પિટિશન ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવી છે. ચીફ જસ્ટિસ અરવિંદ કુમાર અને જસ્ટિસ આશુતોષ જે. શાસ્ત્રીની બંડપીઠે સુનાવણી દરમિયાન કહ્યું હતું કે મુદ્દો ગંભીર છે તેથી કોર્ટ આ મુદ્દે વધુ તપાસ કરશે. ઘટના બની તે દિવસની સ્ટેશન ડાયરી એક કલાકની સમયમર્યાદામાં સ્થાનિક જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટને આપવા માટે કોર્ટે ડી.વાય.એસ.પી.ને નિર્દેશ કર્યો છે. કેસની વધુ સુનાવણી 28મી માર્ચના રોજ નિયત કરવામાં આવી છે.

અરજદાર તરીકે વકીલે આક્ષેપ કર્યો છે તે તેના અસીલની જામકંડોરણા પોલીસ સ્ટેશનના અધિકારીઓ દ્વારા ધરપકડ કરવામાં આવી હતી અને બીજા દિવસે તેને છોડી મૂકવામાં આવ્યો હતો. ત્યારબાદ અરજદારને જાણ થઈ હતી કે તેના અસીલને પોલીસ દ્વારા નિર્દેશી રીતે માર મારવામાં આવ્યો છે. જેથી તેણે સલાહ આપી હતી કે આ અંગે પોલીસ સામે ફરિયાદ નોંધાવવી જોઈએ અને તેની સલાહ માની અસીલે પોલીસ સામે ફરિયાદ નોંધાવી હતી.

**અમદાવાદ**  
ઓક્ટોબર-2021માં કચ્છના મુંદ્રા પોર્ટ પરથી પકડાયેલા રૂપિયા 21,000 કરોડની કિંમતના ત્રણ હજાર કિલો હેરોઈનના કેસમાં એન.આઈ.એ.(નેશનલ ઈન્વેસ્ટિગેશન એજન્સી)એ અમદાવાદ સ્થિત સ્પેશિયલ એન.આઈ.એ. કોર્ટમાં ચાર્જશીટ ફાઈલ કરી છે. એજન્સી દ્વારા કરવામાં આવેલી ચાર્જશીટમાં 11 આરોપીઓના નામનો સમાવેશ કરવામાં આવ્યો છે અને ચાર આરોપી હજુ પણ વોન્ટેડ છે. અફઘાનિસ્તાનથી આવેલા આ ડ્રગ્સના નાણા હવાલા મારફતે આતંકી સંગઠનોને મોકલવાના હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. ચાર્જશીટમાં ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે હુસૈન દાદ અને ગાસન દાદ અફઘાનિસ્તાનના કંદહારમાં આવેલી હસન હુસૈન લિમિટેડના માલિકો છે. તેમની કંપનીએ જ અફઘાનિસ્તાનથી ડ્રગ્સનું કન્સાઈનમેન્ટ મોકલ્યું હતું અને ઈરાનના અબ્બાસ બંદરથી તેને મુંદ્રા મોકલવામાં આવ્યું હતું. કન્સાઈનમેન્ટમાં મોકલવામાં આવેલા ડ્રગ્સને શુદ્ધ હેરોઈન બનાવવા માટે દસ ટકા પ્રોસેસ બાકી હતી અને આ પ્રોસેસ દિલ્લીમાં થવાની હોવાનું તપાસમાં બહાર આવ્યું છે. આ નેટવર્કમાં ભારત, પાકિસ્તાન અને અફઘાનિસ્તાનના ડ્રગ માફિયા સંડોવેલા છે અને આ જો ચનલ મારફતે અગાઉ પણ તેમણે ભારતમાં ડ્રગ્સ મોકલ્યું હતું. કન્સાઈનમેન્ટમાં સેમિ પ્રોસેસ પથ્થર હોવાનું કહી ભારતમાં ડ્રગ્સ ઘૂસાડવામાં આવ્યું હતું. ચાર્જશીટમાં ભારતના ચાર, અફઘાનિસ્તાનના 11 અને અઈરાનના એક નાગરિકનું સંડોવણી આ નેટવર્કમાં હોવાનું બહાર આવ્યું છે.

## મહાનુભાવોની સુરક્ષા જાળવવા પોલીસને પાંચ કરોડના શસ્ત્રો અપાશે

**ગાંધીનગર**  
ગુજરાતમાં મહાનુભાવોની સુરક્ષા વ્યવસ્થા જાળવવા માટે પોલીસને આધુનિક સાધનો અને શસ્ત્રો ખરીદવા માટે પાંચ કરોડ રૂપિયા આપવામાં આવશે. એટલું જ નહીં સુરતને ડાયમન્ડ સિટી પોલીસ સ્ટેશન અને ગાંધીનગર પાસેના ગિફ્ટ સિટીને અલાયદું પોલીસ સ્ટેશન આપવાની જોગવાઈ પણ કરવામાં આવી છે. વિધાનસભામાં ગૃહ વિભાગની 8325 કરોડ રૂપિયાના ખર્ચની માગણીઓ મંજૂર કરવામાં આવી છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ અંગે વિપક્ષના પ્રહાર પછી ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું હતું કે આગામી નાણાકીય વર્ષમાં નવી સેવાઓ માટે 665 કરોડ રૂપિયાની જોગવાઈ કરાઈ છે.

## જેતપુર: સાધુની હત્યા કરી મૃતદેહ કેનાલમાં ફેંકનારા ચાર શખ્સોની ધરપકડ

**રાજકોટ**  
4થી માર્ચ જેતપુરમાં દાસીજીવણપુરા વિસ્તારમાં આવેલી કેનાલમાં સાધુનો મૃતદેહ મળી આવ્યો હતો. રુદ્રાનંદગીરી બાપુના શિષ્ય કિશોર દેવરાજભાઈ નારોદાએ મૃતદેહ ઓળખી કાઢ્યો હતો. પોલીસે ઘટના સ્થળની મુલાકાત લીધી. તપાસ દરમિયાન સીસીટીવી ફૂટેજ ચેક કરતા તેમાં શંકાસ્પદ સફેદ કલરની કાર રાત્રે પસાર થતી જોવા મળી હતી. આ કાર વિશે લોકલ હુમન ઈન્ટેલીજન્સ તેમજ ટેકનીકલ સોર્સના આધારે તપાસ કરતા સ્વીફ્ટ કાર જયેશ દવેનું જાણવા મળ્યું હતું. ધરપકડ કરાયેલા આરોપી જયેશ દવે, દર્શક દેગામા, દિનેશ ભાદાણી, વિજય વઘાસીયા છે.

## મોટર ટાઉન સાણંદમાં ફોર્ડનો પ્લાન્ટ ટાટા મોટર્સ દ્વારા હસ્તગત કરાશે

**અમદાવાદ**  
અમદાવાદથી 40 કિમી દૂર આવેલા સાણંદમાં ટાટા મોટર્સ ફોર્ડ ઈન્ડિયાના પેસેન્જર વ્હીકલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટને ટેકઓવર કરવા માટેની ડીલ ક્લોઝ થવામાં છે. આ સાથે જ સાણંદમાં ટાટાના બે પ્લાન્ટ વર્કિંગ થઈ જશે. બંને કંપનીઓએ ફોર્ડના પેસેન્જર વ્હીકલ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટની માલિકી ટાટા મોટર્સને ટ્રાન્સફર કરવા માટે સંમતિ પ્રસ્તાવ રજૂ કર્યો છે. તમામ સંભાવનાઓને જોતા રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત હાઈ-પાવર કમિટી (HPC) દરખાસ્તને મંજૂરી આપશે, જે બાદ આવતા અઠવાડિયા સુધીમાં ટાટા મોટર્સ માટે આ પ્લાન્ટના ટેકઓવર માટેનો માર્ગ સાફ થશે.

## રાજ્યમાં બે વર્ષમાં 86 પ્રા. શાળાઓને તાળાં વાગ્યાં, 491 શાળાઓને મર્જ કરાઈ

**અમદાવાદ**  
છેલ્લા બે વર્ષમાં જ ગુજરાતમાં 86 સરકારી પ્રાથમિક શાળાઓને ખંભાતી તાળા વાગ્યા છે જ્યારે 491 પ્રાથમિક શાળાઓને મર્જ કરવામાં આવી છે. વિપક્ષનો આરોપ છે કે, સરકારી શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી રહી છે જેના કારણે શાળાઓને મર્જ કરવામાં આવી રહી છે. એટલું જ નહીં, ખાનગી શાળાઓને પ્રોત્સાહન આપવા સરકારે આ નીતિ અપનાવી છે. વિધાનસભા ગૃહમાં શિક્ષણ વિભાગે આપેલી માહિતીમાં ખુલાસો થયો છેકે, આખાય ગુજરાતમાં કુલ મળીને 86 સરકારી પ્રાથમિક શાળાઓ બંધ થઈ છે. સૌથી વધુ જૂનાગઢ જિલ્લામાં 25 પ્રાથમિક શાળાઓને તાળા વાગ્યા છે.



## પેટીએમે ચાઈનીઝ કંપનીઓને ડેટા મોકલી નિયમોનું ઉલ્લંઘન કર્યું હોવાનો ઘટસ્ફોટ

પેટીએમ બેન્કને ટેકનોલોજી ઓડિટરની નિમણૂક કરવા રિઝર્વ બેન્કનો આદેશ

મુંબઈ

ભારતની ડિજિટલ પેમેન્ટ્સ જાયન્ટ પેટીએમ માટે ટ્રાન્ઝેક્શન્સ પ્રોસેસ કરતી પેટીએમ પેમેન્ટ્સ બેંક વિદેશોમાં સર્વરોને ડેટા મોકલીને નિયમોનું ઉલ્લંઘન કરતી હોવાના અને તેના ગ્રાહકોનું યોગ્ય વેરિફિકેશન નહીં કરવા બદલ રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ નવા ગ્રાહકો લેવા પર મનાઈ ફરમાવી પેટીએમ પેમેન્ટ્સ બેંકને સજા કરી હોવાના અહેવાલ વહેતા થયા છે.

વિગતો ખાનગી હોવાનું કહીને પોતાની ઓળખ નહીં આપી આ

જાણકારી ધરાવતી એક વ્યક્તિએ જણાવ્યું હતું કે, પેટીએમ પેમેન્ટ્સ બેંકમાં પરોક્ષ રીતે હોલિંગ ધરાવતી ચાઈના સ્થિત કંપનીઓ સાથે કંપનીના સર્વરો થકી માહિતી પહોંચાડતી હોવાનું રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાને વાર્ષિક ઈન્સ્પેક્શન્સમાં જણાવ્યું છે. પેટીએમ પેમેન્ટ્સ બેંક એક પેટીએમ અને તેના સ્થાપક વિજય શેખર શર્મા વચ્ચેનું સંયુક્ત સાહસ છે.

અલીબાબા ગ્રૂપ હોલિંગ લિમિટેડ અને તેના સહયોગી જેક માની એન્ટ ગ્રૂપ કંપની પેટીએમની માલિકીના શેરો

ધરાવે છે. ઉલ્લેખનીય છે કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયાએ ગત સપ્તાહમાં શુક્રવારે તેના પગલા મટીરિયલ સુપરવાઈઝરી ચિંતાને લઈને લેવામાં આવ્યા હોવાનું નિવેદન કર્યું હતું. પેટીએમની પેરન્ટ વન 97 કોમ્યુનિકેશન્સ લિમિટેડનો શેર આજે 13 ટકા ટૂટ્યો હતો.

પેટીએમ પેમેન્ટ્સ બેંકને રિઝર્વ બેંક ટેકનોલોજી ઓડિટરની નિમણૂક કરવાનો આદેશ આપ્યો છે. કંપની રિઝર્વ બેંકના આદેશ મુજબ બાહ્ય ઓડિટરની નિમણૂક કરવા પગલાં લઈ રહી હોવાનું જણાવ્યું હતું.

## પંજાબમાં હાર બાદ કોંગ્રેસ પ્રદેશ અધ્યક્ષ પદેથી સિદ્ધુનું રાજીનામું

અમૃતસર

પંજાબ વિધાનસભા ચૂંટણીમાં શરમજનક હાર બાદ પંજાબ કોંગ્રેસ અધ્યક્ષ નવજોત સિંહ સિદ્ધુએ રાજીનામું આપી દીધું છે. હકીકતમાં, 5 રાજ્યોમાં હાર બાદ કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધીએ આ રાજ્યોના પ્રદેશ અધ્યક્ષોના રાજીનામાની માંગ કરી હતી. નવજોત સિંહ સિદ્ધુએ ટૂંક સમયમાં રાજીનામાની જાણકારી આપી હતી. નવજોત સિદ્ધુએ કહ્યું કે, કોંગ્રેસ અધ્યક્ષની ઈચ્છા અનુસાર હું પંજાબ કોંગ્રેસના અધ્યક્ષ પદ પરથી રાજીનામું આપું છું.

ઉત્તર પ્રદેશ, ઉત્તરાખંડ, પંજાબ, ગોવા અને મણિપુરમાં યોજાયેલી



વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને ખરાબ હાર મળી છે. આ હારને લઈને પાર્ટી હાઈકમાન્ડે રવિવારે બેઠક બોલાવી હતી. ત્યારથી, સતત કાર્યવાહીનો સમયગાળો શરૂ થયો. સોનિયા ગાંધીએ આ રાજ્યોમાં પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખો પાસેથી રાજીનામું માંગ્યું હતું. કોંગ્રેસના રાષ્ટ્રીય મહાસચિવ રણદીપ સુરજેવાલાએ કહ્યું હતું કે આ રાજ્યોમાં સંગઠનના પુનર્ગઠન માટે પીસીસી પ્રમુખોને પદ છોડવા માટે કહેવામાં આવ્યું છે.

## અકસ્માતો પર કાબૂ મેળવવા માટે 7500 કરોડની યોજના લાગુ થશે

દુર્ઘટનાની આશંકાવાળા ક્ષેત્રોને ઘટાડવા પર કામ કરાશે

નવી દિલ્હી

કેન્દ્રીય સડક પરિવહન અને રાજમાર્ગ મંત્રી નીતિન ગડકરીએ બુધવારે રાજ્યસભામાં જણાવ્યું કે, વિભિન્ન ઉપાયો છતાં પણ રોડ અકસ્માતો મામલે ભારતનો રેકોર્ડ ખાસ સારો નથી અને દર વર્ષે આશરે ૧.૫ લાખ લોકો અકસ્માતોમાં પોતાનો જીવ ગુમાવે છે.

ગડકરીએ જણાવ્યું કે, યુદ્ધ અને કોરોના મહામારીના આંકડાઓ સાથે સરખામણી કરીએ તો માર્ગ અકસ્માતોમાં વધારે લોકોના મોત થાય છે. તેમણે આ બાબતને દુખદ ગણાવી હતી અને કહ્યું કે,

આ મામલે ભારતનો રેકોર્ડ વિશ્વના અનેક દેશોની સરખામણીએ ખરાબ છે.

ગડકરીના કહેવા પ્રમાણે સરકાર ટૂંક સમયમાં જ વિશ્વ બેંકની મદદથી ૭,૫૦૦ કરોડ રૂપિયાની એક યોજના લાગુ કરશે જેથી આ સમસ્યા પર કાબૂ મેળવી શકાય તથા રાષ્ટ્રીય અને રાજ્ય રાજમાર્ગો પર દુર્ઘટનાની આશંકાવાળા ક્ષેત્રો (બ્લેક સ્પોટ)ને ઘટાડી શકાય. સરકાર આ મુદ્દાને લઈ ખૂબ જ સંવેદનશીલ છે અને ટૂંક સમયમાં જ દેશભરમાં વિશ્વ બેંકની મદદથી ૭,૫૦૦ કરોડ રૂપિયાની એક યોજના લાગુ કરવામાં આવશે.

## વિદેશોમાં કોરોના ફરીથી વકરતાં ભારત સરકાર એલર્ટ: બેઠક યોજી સૂચનો કરાયા

નવી દિલ્હી

દેશભરમાં ૧૨-૧૪ વર્ષના બાળકોન રસી આપવાનો પ્રારંભ કરવામાં આવ્યો છે કે જેથી બાળકોને કોરોના સામે સુરક્ષા કવચ મળી રહે. કોરોનાની ત્રીજી લહેર જે ગતિએ આવી તે જ ગતિએ ઠરી પણ ગઈ છે, પરંતુ હવે ચીન, હોંગકોંગ, સિંગાપોર, દક્ષિણ કોરિયા અને યુરોપના દેશોમાં વધતા કેસોએ ફરી એકવાર ચિંતા વધારી છે. દેશમાં ફરી કોરોના માથું ના ઉચકે તે માટે કેન્દ્ર સરકાર પણ સતર્ક બની ગઈ છે.

સૂત્રોએ જણાવ્યું છે કે, અન્ય દેશોમાં

વધતા કેસોને ધ્યાનમાં લઈને કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ હાલ લેવલની બેઠક કરી છે, આ સાથે જરૂર પડે અને કયાંય કેસમાં વધારો થાય તો સઘન તપાસના પણ આદેશ આપ્યા છે.

બુધવારે મંત્રી મનસુખ માંડવિયા દ્વારા બુધવારે મહત્વની બેઠક કરવામાં આવી હતી, જેમાં કોરોનાની સ્થિતિ ભારતમાં ચાલતા રસીકરણ અભિયાન અંગે ચર્ચા કરી હતી. આ સાથે ૨૭ માર્ચથી ઈન્ટરનેશનલ ફ્લાઈટને મંજૂરી આપવામાં આવી છે તે અંગે પણ મહત્વના મુદ્દાઓ ધ્યાને લેવા

માટે જણાવ્યું છે. સૂત્રો જણાવે છે કે, આ અંગેના નિર્ણયમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી. સૂત્રોએ એ પણ જણાવ્યું છે કે, આ બેઠકમાં ઉચ્ચ કક્ષાના સ્વાસ્થ્ય અધિકારીઓ પણ હાજર રહ્યા હતા, જેમાં સ્વાસ્થ્ય સચિવ, ફાર્મા સચિવ અને સરકારના મુખ્ય સાયન્ટિફિક એડવાઈઝર પણ જોડાયા હતા. આ બેઠકમાં નીતિ આયોગના સભ્ય (સ્વાસ્થ્ય) વીકે પોલ, ICMRના ડિરેક્ટર બલરામભાર્ગવ, નેશનલ સેન્ટર ફોર ડિસિઝ કંટ્રોલના અધ્યક્ષ સુરજોત સિંઘ અને અન્ય અધિકારી જોડાયા હતા.

## યુપીના અમેઠીમાં જમીનના વિવાદ મામલે લોહીયાળ સંઘર્ષ, 4 લોકોની ઘાતકી હત્યા

અમેઠી

ઉત્તર પ્રદેશના અમેઠી ખાતે ગ્રામ સમાજની જમીનને લઈને થયેલો વિવાદ લોહીયાળ સંઘર્ષમાં ફેરવાઈ ગયો હતો અને ત્યારબાદ એક પરિવારે લાકડીઓ અને તિક્ષ્ણ હથિયારથી બીજા પરિવાર પર હુમલો કર્યો હતો. જેમાં 4 લોકોના મોત થઈ ગયા હતા અને 6 લોકોના ઘાયલ થવાના સમાચાર મળી રહ્યા છે. અમેઠીના ગુંગવાચના રાજાપુર કૌહારમાં રહેનાર સંકટા પ્રસાદના ઘરની પાસે ગ્રામ સભાની જમીન પડી છે જેના પર ગામના જ રામદુલારે, બ્રિજેશ અને અખિલેશ બળજબરી પૂર્વક કબ્જો કરી રહ્યા હતા. જ્યારે સંકટ પ્રસાદે ના પાડી ત્યારે કબજે કરનારાઓએ સંકટા પ્રસાદ અને તેના પરિવારના સભ્યો પર હુમલો કર્યો હતો. હુમલાખોરોએ સંકટા પ્રસાદ, હનુમાન યાદવ, ધત્રો દેવી,



નયકા દેવી, રાજકુમાર યાદવ અને અશોક કુમારને લાકડી અને ડંડા વડે માર માર્યો હતો અને તિક્ષ્ણ હથિયારો વડે હુમલો કર્યો હતો. આ હુમલા બાદ બધાને હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં સંકટા યાદવ, હનુમાન યાદવ, અમરેશ યાદવ, પાર્વતી યાદવનું મોત થઈ ગયું હતું.

## કોંગ્રેસનું G-21 જૂથ સક્રિય, પક્ષને મજબૂત કરવા ક્વાયત

નવી દિલ્હી

પાંચ રાજ્યોમાં યોજાયેલી વિધાનસભા ચૂંટણીમાં મળેલી હાર બાદ કોંગ્રેસ જી-૨૧નું અસંતુષ્ટ જૂથ ફરી એકવાર સક્રિય થઈ ગયું છે. જી-૨૧એ બુધવારે સાંજે દિલ્હીમાં ગુલામ નબી આઝાદના ઘરે એક બેઠક કરી હતી અને નિવેદન આપીને જણાવ્યું હતું કે, ભાજપને પડકારવા માટે સારો વિકલ્પ જરૂરી છે એટલા માટે કોંગ્રેસે સમાન વિચારધારા વાળા દળો સાથે વાતચીત કરવી જોઈએ. પાર્ટીના અસંતુષ્ટ નેતાઓએ જણાવ્યું કે, ભાજપને ટક્કર આપવા માટે કોંગ્રેસ પાર્ટીને મજબૂત કરવી ખૂબ જ જરૂરી

બની ગઈ છે. મીટિંગ બાદ કોંગ્રેસના ૧૮ નેતાઓએ એક પ્રેસ રિલીઝ બહાર પાડીને જણાવ્યું હતું કે, વિધાનસભા ચૂંટણીમાં કોંગ્રેસને મળેલી કારમી હાર અને સતત નેતાઓ અને કાર્યકરોના પક્ષ છોડવા તરફ કઈ રીતે ધ્યાન નથી આપી રહ્યું તે અંગે ચર્ચા કરવા માટે આ બેઠક બોલાવવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે અસંતુષ્ટ કોંગ્રેસી નેતાઓની બેઠકમાંથી ૩ મહત્વના તારણો બહાર આવ્યા છે.આવ્યા છે. જી-૨૧ના નેતાઓનું કહેવું છે કે, જ્યાં સુધી અમને બહાર કરવામાં નહીં આવે ત્યાં સુધી અમે પાર્ટી નહીં છોડીશું.

## મેં પોતે જ સાસંદોના સંતાનોની ટિકિટ કાપવા કહ્યું હતું: પીએમ મોદી

નવી દિલ્હી

પાંચમાંથી ચાર રાજ્યોની વિધાનસભા ચૂંટણીમાં શાનદાર જીત બાદ આજે ભાજપની સંસદીય દળની બેઠક બોલાવવામાં આવી હતી. સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ બેઠકમાં પીએમ મોદીએ સ્પષ્ટપણે કહ્યું હતું કે, વિધાનસભા ચૂંટણીઓમાં જો કોઈ નેતાની ટિકિટ કપાઈ છે તો તે મારી જવાબદારી છે. ઉલ્લેખનીય છે કે, ભાજપના સાંસદ રીટા બહુગુણા જોશીએ પોતાના પુત્ર માટે લખનૌથી ટિકિટ માંગી હતી પણ પાર્ટીએ ટિકિટ આપી નહોતી.આ સિવાય ઉત્તરાખંડના પૂર્વ ભાજપના નેતા હરક સિંહ રાવતે પણ પોતાની પુત્રવધુ માટે ટિકિટ માંગી હતી અને ભાજપે ટિકિટ નહીં આપતા તેઓ કોંગ્રેસમાં જોડાઈ ગયા હતા.

## પંજાબના મુખ્યમંત્રી પદે ભગવંત માને શપથ લીધા 21મીએ યોગીનો શપથ સમારોહ સોનિયા સહિત 200ને આમંત્રણ

નવી દિલ્હી

પંજાબમાં આમ આદમી પાર્ટીની સરકાર બની ગઈ છે. જ્યારે આપના નેતા ભગવંત માને પંજાબના મુખ્યમંત્રી પદે શપથ ગ્રહણ કર્યા હતા. શપથ ગ્રહણ કરતા જ માને કહ્યું હતું કે મારા મુખ્યમંત્રી બન્યા બાદ એક પણ દિવસને વેડફવા નહીં દઉં. દરમિયાન ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી પદે યોગી આદિત્યનાથ શપથ ગ્રહણ કરવા જઈ રહ્યા છે.

યોગી આદિત્યનાથનો શપથ ગ્રહણ

સમારોહ અતી ભવ્ય હશે જેમાં 200થી વધુ વીવીઆઈપી મહેમાનોને આમંત્રણ અપાયું છે. જે 200થી વધુ વીવીઆઈપી મહેમાનોને આમંત્રણ આપવામાં આવ્યું છે તેમાં કોંગ્રેસ અધ્યક્ષા સોનિયા ગાંધી, સપાના પ્રમુખ અખિલેશ યાદવનો પણ સમાવેશ થાય છે. યોગી આદિત્યનાથનો આ ભવ્ય શપથ સમારોહ 21મીએ લખનઉના અટલ બિહારી વાજપેયી ક્રિકેટ સ્ટેડિયમમાં યોજાશે. જે અન્ય મોટા નેતાઓને આમંત્રણ આપવામાં આવ્યું છે.

## આગામી અઠવાડિયે બંગાળની ખાડીમાં અસની ચક્રવાત આવે તેવી શક્યતા

નવી દિલ્હી

આગામી અઠવાડિયે બંગાળની ખાડીમાં અસની ચક્રવાત આવી શકે છે. હવામાન વિભાગે કહ્યું છે કે, દક્ષિણ-પશ્ચિમ હિંદ મહાસાગરમાં નીચા દબાણનો વિસ્તાર આવતા સપ્તાહની શરૂઆતમાં તીવ્ર ચક્રવાતી વાવાઝોડામાં પરિણમી શકે છે. હવામાન વિભાગની આગાહી અનુસાર, આ ચક્રવાત બાદમાં બાંગ્લાદેશ અને તેની નજીકના ઉત્તર મ્યાનમાર તરફ આગળ વધશે. હવામાન વિભાગના જણાવ્યા અનુસાર, વર્તમાન લો પ્રેશર એરિયા મંગળવારે રચાયો હતો અને તે શનિવાર સુધી પૂર્વ-ઉત્તર પશ્ચિમ દિશામાં આગળ વધે તેવી શક્યતા છે. ત્યાર બાદ તે આંદામાન અને નિકોબાર ટાપુઓ તરફ આગળ વધશે.

# ડેવલોપર ઓમેક્સ ગ્રુપના 45 એકમો પર આવકવેરા વિભાગ ટીમના દરોડા

ટેક્સ ચોરી-ફ્લેટ વેચવાનો આરોપ : દિલ્હી, યુપી, હરિયાણા, પંજાબમાં તપાસ

નોંધડા

આવકવેરા વિભાગની ટીમે સોમવાર સવારથી રિયલ એસ્ટેટ ડેવલોપર ઓમેક્સ ગ્રુપના દિલ્હી, ઉત્તર પ્રદેશ, હરિયાણા અને પંજાબ સહિત સમગ્ર દેશમાં 45 સ્થળોએ દરોડા પાડ્યા હતાં. ઓમેક્સ બિલ્ડર ટેક્સ ચોરીનો આરોપ છે. નોએડાના સેક્ટર 62 અને 93માં પણ દરોડા પાડવામાં આવ્યા હતાં. ચંડીગઢ આવકવેરા વિભાગ દ્વારા પાડવામાં આવેલા દરોડામાં અન્ય સ્થળોના આવકવેરા વિભાગની ટીમની પણ મદદ લેવામાં આવી હતી.



દિલ્હી એનસીઆરમાં 20 સ્થળોની સાથે સમગ્ર દેશમાં સવારે 45 સ્થળોએ સવારે સાત વાગ્યાથી દરોડા પાડવામાં આવ્યા હતાં. અત્યાર સુધી મળેલી નોંધડામાં ત્રણ, ગુરૂગ્રામમાં ત્રણ, ગાઝિયાબાદમાં એક, ચંડીગઢમાં ચાર, લુધિયાણામાં ત્રણ, લખનઉમાં પાંચ,

ઈન્દોરમાં ચાર સ્થળોએ દરોડા પાડવામાં આવ્યા હતાં. ઓમેક્સ બિલ્ડરની હેડ ઓફિસ દિલ્હીના કાલકાજમાં આવેલી છે. નોંધડાથી બે ટીમ દિલ્હી ગઈ છે. દિલ્હીમાં બિલ્ડરનું ઘર અને ઓફિસ છે. ઓમેક્સ બિલ્ડર પર ટેક્સ ચોરીની સાથે મોટા પ્રમાણમાં રોકડ લઈ ફ્લેટ વેચવાનો આરોપ છે. ગ્રેટર નોંધડામાં અન્ય શહેરની ટીમ તપાસ કરી રહી છે. આવકવેરા વિભાગના કુલ 250 અધિકારી આ ટીમોમાં સામેલ છે. દિલ્હીની એક ટીમ નોંધડામાં અગાઉ જ આવી કાર્યવાહી કરી હતી.

# કોઈ લાંચ માંગે તો મને વીડિયો-ઓડિયો મોકલો : ભગવંત માન

પંજાબમાં નવી સરકારમાં એન્ટી કરપ્શન હેલ્પલાઈન ચંદીગઢ

પંજાબના નવા મુખ્યમંત્રી ભગવંત માને આજે જાહેરાત કરી છે કે ભગત સિંહના શહીદી દિવસ પર એન્ટી કરપ્શન હેલ્પલાઈન નંબર જાહેર કરવામાં આવશે. પંજાબના લોકો વોટ્સએપ પર ભ્રષ્ટાચારની ફરિયાદ કરી શકશે. તેમણે ટ્વીટ કરી કહ્યું-મારો પર્સનલ વોટ્સએપ નંબર હશે. જો તમારી પાસે કોઈ લાંચ માંગે, તેનો વીડિયો/ઓડિયો રેકોર્ડ કરી મને મોકલો. ભ્રષ્ટાચારીઓ વિરુદ્ધ કડક પગલા લેવામાં આવશે.

ભગવંત માને કહ્યું કે, 23 માર્ચ નંબર જાહેર કરવામાં આવશે. 99

ટકા લોકો ઈમાનદાર છે, 1 ટકાને કારણે સિસ્ટમ બગડે છે. તેમણે કહ્યું કે, ઈમાનદાર ઓફિસરો સાથે હું ઉભો છું. પંજાબમાં હવે હમા વસૂલી બંધ થશે. હમા વસૂલી માટે કોઈપણ નેતા કોઈ અધિકારીને પરેશાન કરશે નહીં. દિલ્હીના મુખ્યમંત્રી અને આમ આદમી પાર્ટીના મુખિયા અરવિંદ કેજરીવાલે આ નિર્ણયને ઐતિહાસિક ગણાવ્યો છે. તેમણે કહ્યું કે, હવે પંજાબમાં ભ્રષ્ટાચાર ચાલશે નહીં. આ પહેલાં મુખ્યમંત્રી ભગવંત માને ટ્વીટ કરી કહ્યું હતું કે પંજાબની જનતાના હિતમાં આજે મોટો નિર્ણય લેવામાં આવશે. પંજાબના ઈતિહાસમાં આજ સુધી આવો નિર્ણય લેવાયો નથી.

# હિજાબ ઈસ્લામનું અનિવાર્ય અંગ નથી: કર્ણાટક હાઈકોર્ટ

ઉડુપીની કોલેજની વિદ્યાર્થિનીઓની અરજી હાઈકોર્ટે ફગાવી

બેંગલુરુ, તા. ૧૫

કર્ણાટક હાઈકોર્ટે હિજાબ વિવાદ પર મંગળવારે મહત્વપૂર્ણ ચૂકાદો આપતા જણાવ્યું કે હિજાબ પહેરવો ઈસ્લામિક ધર્મની અનિવાર્ય પ્રથા નથી. આ સાથે હાઈકોર્ટે સ્કૂલ-કોલેજોમાં હિજાબ પર પ્રતિબંધના રાજ્ય સરકારના નિર્ણયને પડકારતી અરજીઓ નકારી કાઢી છે. ઉડુપીની વિદ્યાર્થિનીઓએ ક્લાસરૂમમાં હિજાબ પહેરવા મંજૂરી માગતા કરેલી

અરજી નકારતા હાઈકોર્ટે કહ્યું કે સ્કૂલને ડ્રેસ નક્કી કરવાનો અધિકાર છે અને વિદ્યાર્થીઓ સ્કૂલ ડ્રેસ પહેરવાનો ઈનકાર કરી શકે નહીં. સાથે જ હાઈકોર્ટે અચાનક જ હિજાબ વિવાદ ઊભો થવા અંગે પણ સવાલ ઉઠાવતા કહ્યું કે ચાલુ શૈક્ષણિક સત્રમાં જે રીતે હિજાબ વિવાદ ઊભો થયો છે તે જોતાં તેની પાછળ કોઈનો હાથ હોય તેમ લાગે છે.

**શિવમોગામાં સ્કૂલ-કોલેજ બંધ :** આ વિવાદની સંવેદનશીલતાને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકારે કર્ણાટકના જિલ્લાઓમાં કલમ ૧૪૪ લાગુ કરી દીધી હતી. જે વિસ્તારો વધુ સંવેદનશીલ છે ત્યાં શૈક્ષણિક સંસ્થાઓ બંધ રાખવાનો નિર્ણય પર કરાયો હતો. શિવમોગામાં સ્કૂલ-કોલેજો બંધ કરી દેવાયા હતા. અહીં ૨૧મી માર્ચ સુધી કલમ ૧૪૪ લાગુ કરાઈ છે. હાઈકોર્ટના ન્યાયાધીશોના આવાસની સુરક્ષા પણ વધારી દેવાઈ હતી.

**અલીગઢમાં હિજાબ પર હોબાળો : IITમાં બુરખાનો વિરોધ**

**6 છોકરીએ સુપ્રીમ કોર્ટમાં હાઈકોર્ટના ચુકાદાને પડકાર્યો**

કર્ણાટક હાઈકોર્ટે હિજાબ પહેરીને સ્કૂલ-કોલેજોમાં જવા પર પ્રતિબંધ મૂકતો ચૂકાદો આવ્યો છે ત્યારે અલીગઢ ખાતે આઈઆઈટી કોલેજમાં ભૂતપૂર્વ વિદ્યાર્થીઓએ બુરખા પહેરી આવતી કેટલીક વિદ્યાર્થિનીઓ સામે વાંધો ઉઠાવી તેમના વિરોધ સૂત્રોચ્ચાર કર્યો હતો. આ ભૂતપૂર્વ વિદ્યાર્થીઓ ભગવા શાલ પહેરી આવ્યા હતા. જોકે, થોડાક સમયમાં સ્થિતિ થાળે પડી ગઈ હતી.

કર્ણાટકની કોલેજમાં શરૂ થયેલો વિવાદ હવે સુપ્રીમ કોર્ટ સુધી પહોંચ્યો છે. હાઈકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકારવા માટે કોલેજની 6 છોકરીઓ દ્વારા અરજી કરવામાં આવી છે. આ બધી છોકરીઓ હાઈકોર્ટમાં પણ અરજીકર્તા રહી ચૂકી છે. તો બીજી તરફ સુપ્રીમ કોર્ટમાં હિન્દુ સેના તરફથી કેવિએટ દાખલ કરવામાં આવી છે.

# નવી દિલ્હીમાં એક જ સ્થળ પર કિસાન મોરચાના બે જૂથની અલગ-અલગ બેઠક

નેતાઓ વચ્ચે સામસામે બોલાચાલી, કિસાન મોરચાના નેતાઓ વચ્ચે બે ફાટા પડ્યા નવી દિલ્હી

કૃષિ કાયદાઓના વિરોધથી શરૂ થયેલા ખેડૂત આંદોલનનું નેતૃત્વ કરી રહેલા કિસાન સંયુક્ત મોરચામાં હવે તિરાડ પડવા લાગી છે. દિલ્હીમાં સંયુક્ત કિસાન મોરચાની બેઠક યોજાઈ હતી. જોકે એક જ સ્થળે આ બેઠક યોજાઈ હોવા છતાં નેતાઓએ પોતાની મનમાની મજબૂ અલગ અલગ બેઠકો યોજી લીધી હોવાના અહેવાલો છે. એટલે કે સંયુક્ત કિસાન મોરચા હવે પહેલા જેટલું મજબૂત સંગઠન ન રહ્યું હોવાની અટકળો છે. ખેડૂતોએ આંદોલન દરમિયાન કૃષિ કાયદા પરત લેવા, ટેકાના ભાવ, ખેડૂતો સામે આંદોલન દરમિયાન થયેલા કેસો પરત ખેંચવા અને માર્યા ગયેલા ખેડૂતોના પરિવારને વળતરી માગણી કરી હતી. જેમાંથી કૃષિ કાયદા પરત લઈ લેવાયા હતા જ્યારે



અન્ય માગો સરકારે ન સ્વિકારી હોવાના દાવા સંયુક્ત કિસાન મોરચા કરી રહ્યું છે. આ બેઠકમાં નેતાઓ વચ્ચે વિવાદો જોવા મળ્યા હતા. એવા પણ અહેવાલો છે કે નેતાઓ વચ્ચે સામસામે બોલાચાલી પણ થઈ હતી. સંયુક્ત કિસાન મોરચાના નેતાઓ વચ્ચે બે ફાટા પડી ગયા હતા.

# કર્ણાટકમાં ACBનો સપાટો : 18 જેટલા સરકારી અધિકારીઓના ઘરે રેડ કરાઈ

100 અધિકારીઓ અને 300 કર્મીઓની ટીમની 10 જિલ્લાના 75 સ્થળોએ તપાસ

બેંગલુરુ

કર્ણાટકમાં એસીબીએ આવકના સ્ત્રોત કરતા વધુ સંપત્તિ એકત્ર કરવાના આરોપી 18 સરકારી અધિકારીઓ વિરુદ્ધ કરેલી કાર્યવાહીના ભાગરૂપે બેંગલોર સહિત 10 જિલ્લાના 75 સ્થળોએ દરોડા પાડ્યા હતાં તેમ એસીબી અધિકારીઓએ એક નિવેદનમાં જણાવ્યું હતું. એસીબીના 100 અધિકારીઓ અને 300 કર્મચારીઓની અનેક ટીમોએ સવારે સરકારી અધિકારીઓના ઘરોમાં દરોડા પાડ્યા

હતાં. બાગલકોટ જિલ્લા મુખ્યમથકમાં બાદામી રેન્જના વન અધિકારી શિવાનંગ ખેડાગીની પાસેથી નોટ ગણવાનું મશીન અને 3.17 કીલો ચંદનના લાકડા મળી આવ્યા છે. એસીબીએ ગડગ જિલ્લાના શિરસ્તદાર બી એસ અન્નિગીરી પાસેથી સોના, ચાંદીના ઘરેણા , 25 એકર જમીન, 12 રેસિડેન્સિયલ પ્લોટ અને 1.5 લાખ રૂપિયાની રોકડ જમ કરી હતી. એસીબીના અધિકારીઓથી બચવા માટે સોનાના ઘરેણાને કચરા પેટીમાં

સંતાડવામાં આવ્યા હતાં. જે સરકારી અધિકારીઓના ઘરોમાં દરોડા પાડવામાં આવ્યા છે તેમાં બેંગલુરુના એડિશનલ કમિશનર ટ્રાન્સપોર્ટ શાનેન્દ્રકુમાર, બીડીએ ટાઉન પ્લાનિંગ અધિકારી રાકેશ કુમાર, યાદગીરના રેન્જ વન અધિકારી રમેશ કાનકાદે, ગોકાક બસવરાજના એક્ઝિક્યુટીવ એન્જિનિયર શેખર રેડ્ડી પાટીલ અને વિજયપુરા નિર્મિતી કેન્દ્ર પ્રોજેક્ટ મેનેજર ગોપીનાથ મલાગીનો સમાવેશ થાય છે.

# ભારતના લદાખ અને જમ્મુ-કાશ્મીર પાસે ભૂકંપનાં આંચકા

લદાખ

લદાખ અને જમ્મુ કાશ્મીરમાં શ્રીનગર પાસે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. લદાખ ખાતે આશરે 0૭:૦૫ કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા જેની તીવ્રતા ૫.૨ જેટલી નોંધાઈ હતી. જ્યારે જમ્મુ કાશ્મીરમાં શ્રીનગરથી ૧૧૯ કિમી ઉત્તરમાં રાતે આશરે ૦૮:૪૦ કલાકે ભૂકંપના આંચકા અનુભવાયા હતા. જોકે સદનસીબે હજુ સુધી નુકસાનને લગતી કોઈ વિગતો સામે નથી આવી. જીએફએડજર્મન રિસર્ચ સેન્ટર ફોર જીઓસાયન્સના અહેવાલ પ્રમાણે ગુરૂવારે વહેલી સવારે દક્ષિણ ઈરાન નજીક ૬.૦ની તીવ્રતાનો ભૂકંપ આવ્યો હતો. આ ભૂકંપનું કેન્દ્ર જમીનથી ૧૦ કિમીની ઊંડાઈએ નોંધાયું હતું.

# સતત બીજા મહિને રીટેલ ફુગાવો 6 ટકાથી વધુ નોંધાયો ફેબ્રુઆરીમાં રીટેલ ફુગાવો વધીને ૬.૦૭ ટકા : આઠ મહિનાની ટોચે

નવી દિલ્હી

ફેબ્રુઆરીમાં રીટેલ ફુગાવો વધીને ૬.૦૭ ટકા રહ્યો છે. જે છેલ્લા આઠ મહિનાની ઉચ્ચ સપાટી છે. સળંગ બીજા મહિને રીટેલ ફુગાવો ૬ ટકાથી વધારે રહ્યો છે. ઉલ્લેખનીય છે કે ૬ ટકાથી વધુના રિટેલ ફુગાવાને આરબીઆઈના કમ્ફર્ટ ઝોનથી ઉપર ગણવામાં આવે છે. ફેબ્રુઆરીમાં ખાદ્ય વસ્તુઓના ભાવ વધવાને કારણે રીટેલ ફુગાવામાં વધારો જોવા મળ્યો છે. ફેબ્રુઆરી, ૨૦૨૧માં

કન્ઝયુમર પ્રાઈસ ઈન્ડેક્સ(સીપીઆઈ) આધારિત ફુગાવો ૫.૦૩ ટકા રહ્યો હતો. જ્યારે જાન્યુઆરી, ૨૦૨૨માં રીટેલ ફુગાવો ૬.૦૧ ટકા રહ્યો હતો. આ અગાઉ જૂન, ૨૦૨૧માં રીટેલ ફુગાવો ૬.૨૬ ટકા રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે આરબીઆઈ ઈચ્છે છે કે રીટેલ ફુગાવો ૬ ટકાથી ઉપર ન જાય. ઉલ્લેખનીય છે કે રિઝર્વ બેંક ઓફ ઈન્ડિયા દ્વિમાસિક નાણાકીય નીતિ ઘડતી વખતે સીપીઆઈ આધારિત રીટેલ ફુગાવાને ધ્યાનમાં લેતી હોય છે.

# ભારતના રોડ 2024 સુધીમાં અમેરિકા જેવા બનાવી દઈશું : ગડકરી

નવી દિલ્હી

કેન્દ્રીય રોડ અને ટ્રાંસપોર્ટેશન મંત્રી નિતિન ગડકરીએ કહ્યું હતું કે તેમનું લક્ષ્ય 2024 સુધી ભારતીય રોડને અમેરિકા જેવા બનાવી દેવાનું છે. મંત્રીએ દાવો કર્યો હતો કે કેન્દ્ર સરકાર ભારતીય રોડને વધુ સારા બનાવવાની યોજના પર કામ કરી રહી છે. એવા રોડ બનાવવામાં આવશે કે તેના પર ચાલીએ ત્યારે એવું લાગે કે જાણે કોઈ સુંદર સફર પર નિકળ્યા હોઈએ. બુધવારે રાજ્યસભાને જાણકારી આપતા કેન્દ્રીય મંત્રી નિતિન ગડકરીએ કહ્યું હતું કે કેન્દ્ર 2024ના અંત સુધીમાં ભારતીય રોડના મૂળભૂત માળખામાં ફેરફાર કરીને તેને અમેરિકા જેવા બનાવી દેશે. આ માટે હાલ યોજના તૈયાર કરવામાં આવી રહી છે.



# ...અને બળદના પૂંછડા આમળનાર ઠાકોરભાઈ દેસાઈ વિદ્યાપીઠના વાઈસ ચાન્સેલર બની ગયા

ગુજરાતના પૂર્વ મંત્રી અને ગુજરાત વિદ્યાપીઠના પૂર્વ વાઈસ ચાન્સેલર ઠાકોરભાઈ દેસાઈ જે ગુજરાત વિદ્યાપીઠમાં ભણ્યા હતા તે જ વિદ્યાપીઠના તેઓ કુલનાયક અર્થાત વાઈસ ચાન્સેલર થયા હતા. ડૉ. રાજેન્દ્ર પ્રસાદના અવસાન બાદ મોરારજી દેસાઈ ગુજરાત વિદ્યાપીઠના ચાન્સેલર બન્યા હતા. કોઈએ તેમને પૂછ્યું કે, ‘ગુજરાત વિદ્યાપીઠમાંથી તમે શું શીખ્યા?’ ઠાકોરભાઈ દેસાઈએ જવાબ આપ્યો હતો : ‘ગાંધીજી, જગદગુરુ શંકરાચાર્ય, અંબાલાલ સારાભાઈ મિલમાલિક અને મારો રવિયો દૂબળો એ સહુ સમાન છે.’

## રવિયો એટલે કોણ?

ઠાકોરભાઈ દેસાઈ મૂળ નવસારી પાસેના ખરસાડ ગામના વતની. તેમના વડવાઓ મોસાળમાં ગણદેવી જિલ્લાના વેગાળ ગામે ગયા હતા. તેઓ અનાવિલ હતા. મોરારજી દેસાઈ પણ અનાવિલ હતા. વાપીથી તાપી વસતાં અનાવિલ ખેડૂત કુટુંબોમાં ઢાળીની પ્રથા હતી.

ઢાળી એટલે સુખી જમીનદાર ખેડૂતના ત્યાં કામ કરતો જમીનવિહોણો ખેત મજૂર. એક એક પ્રકારની ગુલામીની જ પ્રથા હતી. ઠાકોરભાઈ યુવાન હતા ત્યારે તેમને ઘર ‘રવિયો’ નામનો ઢાળી-ખેતમજૂર કામ કરતો હતો. આ ‘રવિયો’ ઠાકોરભાઈના મનમાં વસી ગયો હતો. રવિયો એટલે સમાજનો નબળામાં નબળો છેવાડાનો ગરીબ માણસ. ગુજરાત વિદ્યાપીઠમાં ભણ્યા બાદ ઠાકોરભાઈ દેસાઈ વાઈસ ચાન્સેલરથી માંડીને ગુજરાત સરકારમાં પ્રધાન બન્યા પરંતુ આ સમગ્ર કાળ દરમિયાન ‘રવિયો’-ગરીબ માણસની સેવા જ તેમનો જીવનમંત્ર બની ગયો. એટલે જ તેઓ રવિયા દૂબળાને અને મિલમાલિકને

એક સરખા ગણતા.

## પાંચ એડમિશન રિઝર્વ

એ વખતે ગુજરાત વિદ્યાપીઠના કુલનાયક એટલે કે વાઈસ ચાન્સેલર કોને બનાવવા તેની શોધ ચાલતી હતી. ઠાકોરભાઈ દેસાઈ તેમના સ્વભાવ પ્રમાણે કોઈ પદ માગે જ નહીં. વિદ્યાપીઠના વરિષ્ઠોએ નક્કી કર્યું કે, ‘ઠાકોરભાઈ દેસાઈને જ વાઈસ ચાન્સેલર બનાવો.’ ઠાકોરભાઈને વાઈસ ચાન્સેલર બનાવવાનું નક્કી થયું તે વખતે ઠાકોરભાઈએ વરિષ્ઠો આગળ એક શરત મૂકી : ‘તમારે દર વર્ષે મારા માટે પાંચ એડમિશન રિઝર્વ રાખવાં. હું જેના નામની ભલામણ કરું તેને એડમિશન આપવાં.’

પ્રસ્તાવ લઈને ગયેલા રામલાલ પરીખ તેમને ઓળખે એટલે એમણે તરત જ એ શરત મંજૂર રાખી, પણ વાત બહાર આવી ગઈ. અધ્યાપકોમાં ગણગણાટ શરૂ થયો : ‘આ શરત કેવી? પાંચ એડમિશન વાઈસ ચાન્સેલર ધારે તેને આપે તે કેવું?’

## આદિવાસી વિદ્યાર્થી

કેટલાક સમય બાદ એક આદિવાસી ગરીબ વિદ્યાર્થીએ ગુજરાત વિદ્યાપીઠમાં પ્રવેશ માટે અરજી કરી. તે લેખિત પ્રવેશ પરીક્ષામાં નાપાસ થયો. તે વિદ્યાર્થી ઠાકોરભાઈ દેસાઈ પાસે આવ્યો. ઠાકોરભાઈ દેસાઈએ તે ગરીબ વિદ્યાર્થીને પ્રવેશ આપવા સૂચના આપી.

કોઈએ પૂછ્યું : ‘આમ કેમ કર્યું?’ તો ઠાકોરભાઈ દેસાઈએ જણાવ્યું : ‘કોઈ વિદ્યાર્થી પછાત વિસ્તારમાંથી આવતો હોય અને તેને ભણવાની તીવ્ર ઈચ્છા હોય તો તેને પ્રવેશ મળવો જ જોઈએ. આવા પછાત વિસ્તારમાંથી આવતા વિદ્યાર્થીઓને ભણાવવા જ મેં ગુજરાત વિદ્યાપીઠનું કુલનાયકપદ સ્વીકાર્યું છે. મેં શરત કરી હતી ને કે દર વર્ષે પાંચ એડમિશન મારા માટે

રિઝર્વ રાખવાં. મેં આવા કામ માટે એ શરત મૂકી હતી.’

જેને ભણવું છે અને કોઈ ગરીબ રવિયા દૂબળાનો દીકરો છે તેથી તેને નિયમાનુસાર પ્રવેશ મળતો નથી એ વાત

દેસાઈ કે તેઓ પણ એક તબક્કે ગુજરાત યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર થયા હતા. તેઓ પણ માતૃભાષાના કડક આગ્રહી હતા. મગનભાઈ દેસાઈની માતૃભાષાના ખૂબ હઠાગ્રહના

આ બંને મહાનુભાવો પર વ્યંગ કરતા : ‘જેમને અંગ્રેજી આવડતું ના હોય તે લોકો જ અંગ્રેજીનો વિરોધ કરે છે.’ એક કટાર લેખકે તો લખી નાંખ્યું કે ‘બળદિયા ચારનારા આ બે જણ બળદના પૂંછડા આમળનાં આમળનાં યુનિવર્સિટીના વાઈસ ચાન્સેલર બની ગયા છે.’ એ બંને જણ ઊઠાં સુધી ભણેલા આમળનાં વાઈસ ચાન્સેલર બની ગયા હતા. તેઓ દેખાવમાં પણ તેઓ પહેરવેશના કારણે ગામડિયા લાગતા.

નામ મૂક્યું નથી. નોંધપાત્ર વાત એ છે, ‘ઝડમઝમીઠીઠી ઉરિજ ક સ્ટવરટ્વંદ્વ’ પુસ્તકનો ગુજરાતી અનુવાદ પણ ઠાકોરભાઈ દેસાઈની કલમે થયો. તે પુસ્તકનું નામ ‘ગાંધીજીનો અક્ષરદેહ’ છે. એ નામ પણ ઠાકોરભાઈએ જ આપ્યું હતું. કાકાસાહેબ કાલેલકર તો આ નામ પર જ વારી ગયા હતા. તેઓ બોલ્યા હતા : ‘આ નામ તો ઠાકોરભાઈને જ સૂઝે.’

## વાસ્તવિકતા શું હતી?

પણ વાસ્તવિકતા કાંઈ જુદી જ હતી. ઠાકોરભાઈ દેસાઈ ગુજરાત વિદ્યાપીઠમાં ભણ્યા હતા અને અંગ્રેજી અને સંસ્કૃત સાથે ભાષાવિશારદની પરીક્ષા પાસ કરી હતી. પરીક્ષા તો પાસ કરી પરંતુ પદવીદાન સમારંભમાં તેઓ પદવી લેવા ગયા નહોતા.

કારણ ખબર નથી. ઘણાં વર્ષો સુધી તેમની પદવી વિદ્યાપીઠમાં અનામત પરી રહી હતી. ઘણાં વર્ષો બાદ તેમણે પદવી લીધી હતી. કાકા કાલેલકરના તેઓ પ્રિય શિષ્ય હતા. ઠાકોરભાઈ દેસાઈએ વિનોબાજીના ગીતા પ્રવચનો નામના મરાઠી પુસ્તકનો ગુજરાતી અનુવાદ કર્યો હતો. તે પછી વિનોબાજીના ‘સ્થિતપ્રજ્ઞ દર્શન’ પુસ્તકનો અનુવાદ કર્યો. એ પછી જવાહરલાલ નેહરુએ જેલમાંથી તેમનાં પુત્રી ઈન્દિરાજીને જે પત્રો લખ્યા હતા તે પત્રો ‘લેટર, ફ્રોમ ફાધર ટુ ડિઝ ડોટર’ નામે પ્રગટ થયા હતા. તે અંગ્રેજી પુસ્તકનો અનુવાદ પણ ઠાકોરભાઈ દેસાઈએ ‘ઈન્દુને પત્રો’ના નામે ગુજરાતીમાં કર્યો હતો. આ ઉપરાંત અચ્યુત પટવર્ધન અને અશોક મહેતાના ‘ધી કોમ્યુનલ ટ્રાયંગલ’ પુસ્તકનો પણ અનુવાદ તેમણે જ કર્યો હતો. મજાની વાત એ છે કે આ તમામ પુસ્તકોના અનુવાદક ઠાકોરભાઈ દેસાઈ હોવા છતાં તેમણે ક્યાંયે અનુવાદક તરીકે પોતાનું

## અસ્ખલિત અંગ્રેજી

સહુથી અગત્યની વાત એ છે કે પ્રચલિત માન્યતાથી વિરુદ્ધ ઠાકોરભાઈનું અંગ્રેજી તેમના સમકાલીનોના અંગ્રેજી કરતાં ઘણું ઉત્તમ હતું. ગુજરાત વિદ્યાપીઠને યુનિવર્સિટીનો દરજ્જો આપવાના મુદ્દે યુજીસી તરફથી ડૉ. કોઠારીના અધ્યક્ષપદે ઉચ્ચ કમિટી ગુજરાત વિદ્યાપીઠ આવી હતી. તે વખતે ઠાકોરભાઈ દેસાઈ વિદ્યાપીઠના કુલનાયક હતા. ડૉ. કોઠારી અને તેમના સભ્યો અંગ્રેજીમાં જ રજૂઆત સાંભળવાનો આગ્રહ રાખતા હતા. તે પછી ઠાકોરભાઈ દેસાઈએ અસ્ખલિત અંગ્રેજીમાં બોલવાનું શરૂ કર્યું. ડૉ. કોઠારી અને તેમના સાથીઓ ઠાકોરભાઈ દેસાઈના પ્રભાવશાળી અંગ્રેજીથી સ્તબ્ધ થઈ ગયા અને તેઓ તેમનું અંગ્રેજી બરાબર સમજી શકે તે માટે વાકપ્રવાહ ધીમે કરવા વિનંતી હતી. ઠાકોરભાઈની મશ્કરી કરનાર એ વખતના કટાર લેખકોને ખબર જ નહોતી કે ઠાકોરભાઈ દેસાઈ એલેક્ઝાન્ડર ડૂમા અને ચાર્લ્સ ડિકન્સનનાં બધાં જ પુસ્તકો અંગ્રેજીમાં વાંચી ચૂક્યા હતા. ઠાકોરભાઈ દેસાઈ સ્વયં એક સાક્ષર હતા.

આવા હતા ઠાકોરભાઈ દેસાઈ.

**દેવેન્દ્ર પટેલ**

સંપર્ક

+91 98792 07102



રવિયો એટલે સમાજનો નબળામાં નબળો છેવાડાનો ગરીબ માણસ. ગુજરાત વિદ્યાપીઠમાં ભણ્યા બાદ ઠાકોરભાઈ દેસાઈ વાઈસ ચાન્સેલરથી માંડીને ગુજરાત સરકારમાં પ્રધાન બન્યા પરંતુ આ સમગ્ર કાળ દરમિયાન ‘રવિયો’-ગરીબ માણસની સેવા જ તેમનો જીવનમંત્ર બની ગયો. એટલે જ તેઓ રવિયાને અને મિલમાલિકને એક સરખા ગણતા

ઠાકોરભાઈ દેસાઈને ખૂંચતી.


## ઠાકોરભાઈ આઠમાવાળા

ઠાકોરભાઈ દેસાઈ આઠમા ધોરણથી અંગ્રેજી ભણાવવાના હિમાયતી હતા. યુનિવર્સિટીનું શિક્ષણ માતૃભાષામાં જ હોવું જોઈએ તે માટેના આગ્રહી હતા. તેમના સાથી મગનભાઈ

કારણે ગુજરાતી માધ્યમ માટે ‘મગન માધ્યમ’ શબ્દ પ્રચલિત થયો હતો. કેટલાક લોકો ગુજરાત યુનિવર્સિટીના ટાવરને મગન ટાવર કહેતા. ઠાકોરભાઈ દેસાઈ અને મગનભાઈ દેસાઈના આઠમાથી જ અંગ્રેજી ભણાવવાના આગ્રહના કારણે એ વખતના કટાર લેખકો

## જાણવા જેવું

### પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ અવકાશમાં ક્યાં સુધી લાગે?



પૃથ્વી ભમરડાની જેમ ચક્રાકાર ફરે છે અને તે પણ દર સેકન્ડે ૪૬૦ મીટરની ઝડપે. આટલી ઝડપ હોવા છતાંય માણસો સહિતની પૃથ્વી પર રહેલી વસ્તુઓ બહાર ફેંકાઈ જતી નથી કેમકે પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ તમામ ચીજોને પોતાની તરફ ખેંચી રાખે છે. પૃથ્વીનું ગુરુત્વાકર્ષણ બળ દૂર અવકાશમાં રહેલા ચંદ્રને પણ ખેંચી રાખે છે એટલે જ ચંદ્ર પૃથ્વીની આસપાસ ફર્યા કરે છે. ગુરુત્વાકર્ષણ એટલે ગ્રેવીટી. તમે ઝીરો ગ્રેવીટી શબ્દ સાંભળ્યો હશે. અવકાશયાત્રીઓ અવકાશી સફરમાં ગુરુત્વાકર્ષણ વિનાની સ્થિતિનો અનુભવ કરે છે. જો કે પૃથ્વીના ગુરુત્વાકર્ષણની બહાર કશું જ જઈ શકતું નથી. પરંતુ આકાશ તરફ દર સેકન્ડે ૧૦ કિલોમીટરની ઝડપે ગતિ કરતા પદાર્થ ઉપર ગુરુત્વાકર્ષણ બળ તો હોય જ છે. પરંતુ ચીજની ઝડપ અને કદ પ્રમાણે તેમાં વધઘટનો અનુભવ થાય. વિજ્ઞાનીઓના અંદાજ મુજબ પૃથ્વીના ગુરુત્વાકર્ષણની બહાર નિકળતું હોય તો ચંદ્ર કરતાં ૧૦ ગણા અંતરે જવું પડે.

### શિકારી વનસ્પતિ : પિચર પ્લાન્ટ

જગતમાં ૨૦૦ જેટલી વનસ્પતિ જંતુઓનો શિકાર કરનારી છે. શિકારી વનસ્પતિ પિચર પ્લાન્ટ નોંધપાત્ર અને જાણીતી વનસ્પતિ છે. વનસ્પતિને ફોટોસિન્થેસીસ દ્વારા તેનાં પાન ખોરાક બનાવી શકે છે તેમ છતાં આ વનસ્પતિને જંતુઓ ખાવાની શું જરૂર તેવો સવાલ પણ થાય. વનસ્પતિને પોષણ માટે પૂરતા પ્રમાણમાં પોષકદ્રવ્યો જોઈએ. કેટલાક પ્રદેશમાં વધુ વરસાદથી જમીન ઘોવાઈ જાય. પૂરતો સૂર્યપ્રકાશ ન મળતો હોય તેવી સ્થિતિમાં થતી વનસ્પતિ ઉત્ક્રાંતિકાળમાં જંતુભક્ષી બની હતી. અમેરિકા અને ઓસ્ટ્રેલિયામાં જોવા મળતા પિચર પ્લાન્ટ લગભગ સો જાતના હોય છે. પિચર પ્લાન્ટના ફૂલ છટકાં જેવા હોય છે. તે લટકતી કોથળી જેવા હોય છે. તેમાં ચીકણું પાચક દ્રવ્ય હોય છે. જંતુઓ તેની ઉપર બેસે એટલે ચોંટી જાય અને ધીમે ધીમે કોથળીમાં ઉતરી જાય. કોથળીની અંદરની સપાટી મીણ જેવી ચિકણી અને નીચેની તરફ ઝૂંકેલા સુક્ષ્મ તાંતણાની બનેલી હોય છે. જંતુ તેમાં ફસાય એટલે લપસીને કોથળીના તળિયે જઈને પડે.





# ટેનિસ: ચારેય ગ્રાન્ડસ્લેમમાં હવે અંતિમ સેટમાં ૧૦ પોઈન્ટનો ટાઈબ્રેકર રમાશે



લંડન

વિશ્વ ટેનિસના ચારેય ગ્રાન્ડસ્લેમ ઓસ્ટ્રેલિયન ઓપન, ફ્રેન્ચ ઓપન, વિમ્બલ્ડન તથા યુએસ ઓપનમાં મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. આ ચારેય ગ્રાન્ડસ્લેમના અંતિમ સેટમાં સ્કોર ૬-૬થી સરભર રહ્યા બાદ પરિણામ માટે ૧૦ પોઈન્ટનો ટાઈબ્રેકર

લાગુ કરી દેવામાં આવ્યો છે. ગ્રાન્ડસ્લેમ સમિતિએ ચારેય મેજર ટૂર્નામેન્ટના આયોજકોને તાત્કાલિક અસરથી આ નિયમ લાગુ કરવાનો નિર્દેશ કરી દીધો છે. ઓસ્ટ્રેલિયન ઓપનમાં અગાઉથી જ ૧૦ પોઈન્ટના ટાઈબ્રેકરનો ઉપયોગ થઈ રહ્યો છે. વિમ્બલ્ડનમાં ૧૨-૧૨ના સ્કોર બાદ સાત પોઈન્ટનો ટાઈબ્રેકર હોય છે. યુએસ ઓપનમાં ૬-૬ના સ્કોર બાદ સાત પોઈન્ટનો ટાઈબ્રેકર રમાડવામાં આવે છે. માત્ર ફ્રેન્ચ ઓપનમાં નિર્ણાયક સેટમાં નિર્ધારિત પોઈન્ટવાળા ટાઈબ્રેકરનો ઉપયોગ કરવામાં આવતો નથી. ગ્રાન્ડસ્લેમ બોર્ડે જણાવ્યું હતું કે સમિતિનો નિર્ણય ગ્રાન્ડસ્લેમમાં રમતના નિયમોને વધારે સ્થિરતા આપવા માટે લેવાયો છે. આ ખેલાડીઓ તથા સમર્થકો માટે સમાનરૂપે અનુભવ વધારશે. આ ટ્રાયલ મુજબ જો અંતિમ સેટનો સ્કોર ૬-૬થી સરભર થશે તો ઓછામાં ઓછા બે પોઈન્ટના ફરક સાથે જે ખેલાડી સૌથી પહેલાં ૧૦ પોઈન્ટ સુધી પહોંચશે તે તેને વિજેતા માનવામાં આવશે.

## લક્ષ્ય સેને ત્રીજા ક્રમાંકિત એન્ટોનસનને હરાવ્યો, સાઇના વર્લ્ડ ચેમ્પિયન સામે પરાસ્ત

લંડન

ઓલ ઈંગ્લેન્ડ બેડમિન્ટન ચેમ્પિયનશિપના બીજા દિવસે ભારતને મિશ્રિત પરિણામ મળ્યા હતા. મેન્સ સિંગલ્સમાં યુવા ખેલાડી લક્ષ્ય સેને શાનદાર ફોર્મને જારી રાખીને ત્રીજા ક્રમાંકિત ડેનમાર્કના એન્ડર્સ એન્ટોનસનને ૨-૧-૧૬, ૨-૧-૧૮થી હરાવીને અભિયાન આગળ વધાર્યું હતું. બીજી તરફ વિમેન્સ સિંગલ્સમાં હેદરાબાદની અનુભવી ખેલાડી સાઈના નેહવાલના અભિયાનનો અંત આવી ગયો હતો. વર્તમાન વર્લ્ડ ચેમ્પિયન જાપાનની અકાને યામાગુચી સામે સાઈનાને ૨-૧-૧૪, ૧-૦-૨૧, ૨-૧-૧૭થી હરાવી હતી. લંડન ઓલિમ્પિક્સની બ્રોન્ઝ

મેડાલિસ્ટ સાઈના લાંબા સમયથી ઈજા અને કંગાળ ફોર્મનો સામનો કરી રહી છે પરંતુ ઓલ ઈંગ્લેન્ડ ટૂર્નામેન્ટમાં તેણે પ્રથમ રાઉન્ડમાં આસાન વિજય હાંસલ કરીને ફોર્મમાં પરત ફરવાનો સંકેત આપ્યો હતો પરંતુ બીજા રાઉન્ડમાં જ તેના અભિયાનનો અંત આવી ગયો હતો. બંને વચ્ચે ૫૦ મિનિટ સુધી મુકાબલો રમાયો હતો. પ્રથમ દિવસે છઠ્ઠી ક્રમાંકિત સિંધુએ ૪૨ મિનિટ સુધી રમાયેલી મેચમાં ચીનની જી યી વાંગને ૨-૧-૧૮, ૨-૧-૧૩ના સ્કોરથી હરાવી હતી. સાઈનાએ ૩૮ મિનિટમાં સ્પેનની બિએટ્રિસ કોરાલેસને ૨-૧-૧૭, ૨-૧-૧૮ના સ્કોરથી પરાજય આપ્યો હતો.

## રશિયાના બદલે હવે ચેન્નઈમાં ચેસ ઓલિમ્પિયાડ યોજાશે

નવી દિલ્હી

યૂકેન ઉપર હુમલાના કારણે રશિયા પાસેથી છીનવી લેવામાં આવેલી ૪૪મી ચેસ ઓલિમ્પિયાડનું હવે ચાલુ વર્ષે ચેન્નઈ ખાતે આયોજન કરવામાં આવશે. ૨૦૧૩માં વર્લ્ડ ચેમ્પિયનશિપ બાદ ભારતમાં આ બીજી સૌથી મોટી ચેસ ટૂર્નામેન્ટ રમાશે. તામિલનાડુના મુખ્યમંત્રી એમ.કે. સ્ટાલિને ટ્રિવટર ઉપર આ બાબતને સમર્થન આપીને જણાવ્યું હતું કે ભારત ચેસ ઓલિમ્પિયાડની યજમાની કરી રહ્યું છે. તામિલનાડુ માટે આ શાનદાર બાબત છે. ચેન્નઈ વિશ્વભરના કિંગ અને ક્વીનનું ઉખાભર્યું સ્વાગત કરશે.

## દિલ્હી કેપિટલ્સની બસ પર હુમલો! MNSના 4 કાર્યકરની અટકાયત



દિલ્હીની કંપનીને બસ કોન્ટ્રાક્ટ આપવાથી નારાજગી

મુંબઈ : મુંબઈમાં દિલ્હી કેપિટલ્સની બસ પર ૫-૬ અજાણ્યા લોકોએ હુમલો કર્યો હતો. જે બાદ હલચલ મચી ગઈ હતી. મહારાષ્ટ્ર નવનિર્માણ સેના (MNS)ના કાર્યકરો દ્વારા આ હુમલો કરવામાં આવ્યો હોવાની જાણકારી મળ્યા બાદ પોલીસ દ્વારા MNS ચાર લોકોની અટકાયત કરવામાં આવી હતી.

ચાર લોકોની અટકાયત કરી છે, જ્યારે એક આરોપીની શોધ ચાલી રહી છે. હવે સવાલ એ છે કે જો આ હુમલો MNSના કાર્યકરો દ્વારા કરવામાં આવ્યો છે તો પછી શા માટે થયો?

ઈન્ડિયન પ્રીમિયર લીગ ૨૦૨૨ (આઈપીએલ ૨૦૨૨) ૨૬ માર્ચથી શરૂ થઈ રહી છે અને તે પહેલા ખૂબ જ ચોંકાવનારા સમાચાર સામે આવ્યા છે. મુંબઈમાં દિલ્હી કેપિટલ્સની ટીમની બસ પર હુમલો થયો છે. અહેવાલો અનુસાર ૫-૬ અજાણ્યા લોકોએ દિલ્હી કેપિટલ્સની બસમાં તોડફોડ કરી હતી. આ ઘટના બાદ મુંબઈ પોલીસે ચાર કલમો હેઠળ કેસ નોંધ્યો છે. એવું માનવામાં આવે છે કે આ હુમલો મહારાષ્ટ્ર નવનિર્માણ સેનાના કાર્યકરો દ્વારા કરવામાં આવ્યો હતો. કોલાબા પોલીસે આ કેસમાં MNSના

દિલ્હી સ્થિત કંપનીને IPL ટીમોના બસ કોન્ટ્રાક્ટ આપવાથી MNS કાર્યકર્તાઓ નારાજ છે. MNSના મતે આ કોન્ટ્રાક્ટ મહારાષ્ટ્રની કંપનીને આપવો જોઈતો હતો. તેના વિરોધમાં આ કામદારો પર તોડફોડનો આરોપ છે. MNS એ રાજ ઠાકરેની પાર્ટી છે અને ઉત્તર ભારતીયોના મુદ્દે તે ઘણીવાર મુંબઈના વિવાદોમાં જોવા મળે છે. દિલ્હી કેપિટલ્સનું અભિયાન ૨૭ માર્ચથી બ્રેબોર્ન સ્ટેડિયમથી શરૂ થશે. દિલ્હીની ટીમ પ્રથમ મેચ પાંચ વખતની ચેમ્પિયન મુંબઈ ઈન્ડિયન્સ સામે રમશે. દિલ્હીના મોટાભાગના ખેલાડીઓ ટીમમાં જોડાયા છે અને તેઓ ટીમ સાથે બાયો બબલમાં જતા પહેલા ત્રણ દિવસનો ક્વોરન્ટાઇન સમયગાળો પૂર્ણ કરશે.

## ભારતે ઘરઆંગણે સતત ૧૫મી ટેસ્ટશ્રેણી જીતી, શ્રીલંકા સામે શ્રેણીવિજયની હેટ્ટિક

બેંગ્લોર

ભારતે બેંગ્લોરમાં રમાયેલી પિંક બોલ ડે-નાઈટ બીજી ટેસ્ટમાં શ્રીલંકાને ૨૩૮ રનના માર્જિનથી હરાવીને બે ટેસ્ટની શ્રેણીને ૨-૦થી જીતી લીધી હતી. ચિત્રાસ્વામી સ્ટેડિયમ ખાતે રમાયેલી ડે-નાઈટ ટેસ્ટમાં ભારતે શ્રીલંકાને મેચ જીતવા માટે ૪૪૭ રનનો તોર્નિંગ લક્ષ્યાંક આપ્યો હતો. જેની સામે પ્રવાસી ટીમ બીજા દાવમાં ૨૦૮ રનના સ્કોરે સમેટાઈ ગઈ હતી. ભારતે શ્રીલંકાને ટીર૦ શ્રેણી બાદ ટેસ્ટ સિરીઝમાં પણ ક્લીનસ્વીપ કરી છે. ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરનાર ભારતે ૨૫૨ રન બનાવ્યા હતા. તેના જવાબમાં શ્રીલંકાનો પ્રથમ દાવ ૧૦૮ રનમાં સમેટાઈ ગયો હતો. ભારતે ૧૪૩ રનની લીડ મેળવ્યા બાદ બીજા દાવને નવ વિકેટે ૩૦૩ રનના સ્કોરે ડિક્લેર કરી દીધી હતી.

## મેસ્સી બાદ રોનાલ્ડો પણ ૧૬ વર્ષમાં પ્રથમ વખત ક્લબ ટ્રોફીથી વંચિત રહ્યો

પેરિસ: ચેમ્પિયન્સ લીગ ફૂટબોલમાં કિસ્તિયાનો રોનાલ્ડોની માન્ચેસ્ટર યુનાઇટેડ ક્લબને પરાજયનો સામનો કરવો પડ્યો છે. રાઉન્ડ-૧૬ના મુકાબલામાં એટ્લેટિકો મેડ્રિડ ક્લબે યુનાઇટેડને એગ્રિગેટ ગોલ સ્કોર ૨-૧થી હરાવ્યું હતું. માન્ચેસ્ટર યુનાઇટેડનો સ્ટાર રોનાલ્ડો ક્લબ ફૂટબોલમાં પ્રથમ વખત કોઈ પણ ટ્રોફી જીત્યા વિના સિઝનનો અંત કરશે. યુનાઇટેડની ટીમ ચાલુ વર્ષે પ્રીમિયર લીગ અને ચેમ્પિયન્સ લીગ સહિત કોઈ પણ ટૂર્નામેન્ટની ટ્રોફી જીતી શકી નથી. બીજા લેગના મુકાબલામાં એટ્લેટિકોએ ૧-૦ના માર્જિનથી વિજય મેળવ્યો હતો. નોકઆઉટ રાઉન્ડમાં બન્ને ટીમો એકબીજા સામે પોતપોતાના હોમ ગ્રાઉન્ડમાં બે મેચ રમતી હોય છે. પ્રથમ લેગમાં યુનાઇટેડ અને એટ્લેટિકોનો સ્કોર ૧-૧થી સરભર રહ્યો હતો. બીજા લેગનો મુકાબલો એટ્લેટિકોની તરફેણમાં રહ્યો હતો. આ પહેલાં આર્જેન્ટિનાના દિગ્ગજ ફૂટબોલર લાયોનલ મેસ્સીની ક્લબ પેરિસ સેન્ટ જર્મેનને પણ નોકઆઉટ રાઉન્ડમાંથી બહાર થવું પડ્યું હતું.



## ઓસી.-પાક. ટેસ્ટ: ૬૦૩ મિનિટની બેટિંગમાં ૪૨૫ બોલ રમી બાબરે મેચ ડ્રો કરી

કરાચી

પાકિસ્તાન અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી બીજી ક્રિકેટ ટેસ્ટ મેચ ભલે ડ્રો રહી હોય પરંતુ આ મેચમાં બાબર આજમે વિક્રમી ઈનિંગ રમી હતી. ઓસ્ટ્રેલિયા દ્વારા આપવામાં આવેલા ૫૦૬ રનના જંગી ટાર્ગેટ સામે બેટિંગ માટે મેદાને પડેલી પાકિસ્તાનની ટીમ માટે બાબરે ૬૦૩ મિનિટની બેટિંગમાં ૪૨૫ બોલનો સામનો કરીને ૧૮૬ રન બનાવ્યા હતા. તે ચાર રન માટે બેવડી સદી ચૂકી ગયો હતો પરંતુ આ ઈનિંગ તેની કારકિર્દી માટે એક સિદ્ધિ સમાન બની ગઈ હતી. પાંચમા દિવસે ઓસ્ટ્રેલિયાની ટીમ માત્ર સાત વિકેટ ઝડપી શકી હતી. બે દિવસમાં ઓસ્ટ્રેલિયા પાકિસ્તાનની ટીમને ઓલઆઉટ કરી શકી નહોતી. બાબર આજમે ઉપરાંત મોહમ્મદ રિઝવાને પણ સદી પૂરી કરી હતી.

## એક મેચમાં હવે કુલ આઠ ડીઆરએસ

એક ટીમ પાસે મેચમાં બેટિંગ અને બોલિંગના બે-બે ડીઆરએસ રહેશે

મુંબઈ

આઈપીએલ ટીર૦ લીગની ૧૫મી સિઝન નવા નિયમો સાથે રમાશે અને ગવર્નિંગ કાઉન્સિલે અમ્પાયર્સ ડિસિઝન રિવ્યૂ સિસ્ટમ (ડીઆરએસ)થી લઈને કેચઆઉટ અને રનઆઉટના નિયમો પણ બદલ્યા છે. કોરોનાના જોખમને પણ ધ્યાનમાં રાખીને ટૂર્નામેન્ટના કાર્યક્રમમાં ફેરફાર કરી શકવાનો વિકલ્પ ખુલ્લો રાખ્યો છે. જો કોરોનાના કારણે કોઈ ટીમ પ્લેઈંગ ઈલેવનને (ઓછામાં ઓછા સાત ભારતીય ખેલાડીઓ હોવા જરૂરી છે) મેદાનમાં ઉતારી ના શકે તો આ મેચનું ફરીથી આયોજન થઈ શકશે. ત્યારબાદ પણ મેચ રમાડી નહીં શકાય તો પૂરો મામલો ટેકનિકલ સમિતિ પાસે મોકલવામાં આવશે અને તે આ અંગેનો અંતિમ નિર્ણય લેશે. જો નોન-સ્ટ્રાઈકર બેટ્સમેન બોલ નંબાયા પહેલાં કિઝની બહાર આવી જાય અને બોલર બેઈલ્સને ઉડાવી દે તો તેને

રનઆઉટ માનવામાં આવશે. આઈપીએલમાં અગાઉ નિયમ હતો કે જો કોરોનાના કારણે કોઈ મેચ રમાડી શકાય નહીં તો તેનું ફરીથી આયોજન કરવામાં આવશે. આઈપીએલમાં અત્યાર સુધી મેચમાં એક ટીમ પાસે બોલિંગ અને બેટિંગનો એક-એક રિવ્યૂ રહેતો હતો પરંતુ હવે આ સંખ્યા વધારીને બેની કરવામાં આવી છે. મેચમાં કુલ ડીઆરએસની સંખ્યા આઠની થઈ છે. બીસીસીઆઈએ પોતાની ટીર૦ લીગમાં એમસીસીના નિયમને લાગુ કર્યો છે. કોઈ બેટ્સમેન કેચઆઉટ થાય તો નવા બેટ્સમેને સીધા સ્ટ્રાઈકર છેડે જવું પડશે. અત્યાર સુધી કેચ પકડાય તે પહેલાં જો બેટ્સમેને છેડા બદલી નાખ્યો હોય તો નોન-સ્ટ્રાઈકર બેટ્સમેન નવો બોલ રમતો હતો. હવે કોઈ બેટ્સમેન ઓવરના છેલ્લા બોલે કેચઆઉટ થાય તો આગામી ઓવરનો પ્રથમ બોલ બીજા છેડે રહેલો બેટ્સમેન રમશે.

## કોહલીની ચાર ક્રમાંકની પીછેહઠ, બુમરાહ છ ક્રમના ફાયદા સાથે છઠ્ઠા સ્થાને પહોંચ્યો

દુબઈ

ભારત અને શ્રીલંકા વચ્ચેની ટેસ્ટ શ્રેણી પૂરી થયા બાદ આઈસીસીએ ટેસ્ટ રેન્કિંગ જાહેર કર્યા છે. ભારતીય પેસ બોલર જસપ્રીત બુમરાહ છ ક્રમાંકના ફાયદા સાથે છઠ્ઠા ક્રમે પહોંચી ગયો છે. વિરાટ કોહલીને ચાર ક્રમાંકનું નુકસાન થયું છે અને તે બેટ્સમેનોની યાદીમાં નવમા ક્રમે સરકી ગયો છે. મોહાલી ટેસ્ટમાં ૧૭૫ રનની ઐતિહાસિક ઈનિંગ રમનાર રવીન્દ્ર જાડેજાને પણ નુકસાન થયું છે. તે ઓલરાઉન્ડરની રેન્કિંગમાં બીજા ક્રમે પહોંચી ગયો છે. બુમરાહે પાકિસ્તાનના શહિન આફ્રિદી, ન્યૂઝીલેન્ડના કેયલ જેમિસન, ટિમ સાઉથી

અને નીલ વેગનર ઉપરાંત ઓસ્ટ્રેલિયાના જોસ હેઝલવૂડ અને ઈંગ્લેન્ડના જેમ્સ એન્ડરસનને પાછળ રાખી દીધા છે. બેંગ્લોર ટેસ્ટમાં બુમરાહે શ્રીલંકાની આઠ વિકેટ ઝડપી હતી. તેણે હોમગ્રાઉન્ડમાં પ્રથમ વખત પાંચ વિકેટ ઝડપવાની સિદ્ધિ મેળવી હતી. આ પ્રદર્શનના કારણે તેને છ ક્રમાંકનો ફાયદો થયો છે. મોહમ્મદ શમી એક ક્રમાંકના ફાયદા સાથે ૧૭મા સ્થાને પહોંચી ગયો છે. બોલર્સની યાદીમાં ઓસ્ટ્રેલિયાનો પેટ કમિન્સન પ્રથમ, ભારતનો સ્પિનર આર. અશ્વિન બીજા અને સાઉથી આફ્રિકાનો કાગિસો રબાડા ત્રીજા સ્થાને જળવાઈ રહ્યા છે.



# રશિયાનો ખેર્સોન પર કબજો, ડોનેટસ્કમાં 20ના મોત રિવનેમાં ટીવી ટાવર ઉપર આડેઘડ બોમ્બ ઝીંકાયા

રશિયા હવે નાગરિક વિસ્તારો પર બોમ્બગોળા વરસાવી રહ્યું છે, ડોનેટસ્ક શહેરમાં મિસાઈલ એટેકમાં 35 લોકો ઘાયલ

**ડોનેટસ્ક** સોમવારે રશિયન સમર્થિત એક તરફ શાંતિમંત્રણા આવી રહી છે ત્યારે બીજી તરફ રશિયન સેનાએ મંગળવારે દાવો કર્યો હતો કે તેમણે યુકેનના ખેર્સોન વિસ્તારને સંપૂર્ણપણે પોતાના કબજામાં લઈ લીધો છે. રશિયા એકતરફ યુકેન સાથે શાંતિ મંત્રણા કરી રહ્યું છે ત્યારે બીજી તરફ પોતાનું આક્રમણ ઉગ્ર બનાવીને હવે નાગરિક વિસ્તારો પર પણ બોમ્બગોળા ફેંકી રહ્યું છે. આ બધાની વચ્ચે પોલેન્ડ, ચેક રિપબ્લિકન અને સ્લોવેકિયાના વડાપ્રધાનો યુકેનના પ્રેસિડેન્ટને મળવા માટે કિવ જઈ રહ્યા છે. દરમિયાન

સોમવારે રશિયન સમર્થિત વિદ્રોહિઓના કબજા ધરાવતાં ડોનેટસ્ક શહેરમાં એક બેલેસ્ટિક મિસાઈલ હુમલામાં 20 સામાન્ય લોકોનાં મોત થયા હતાં અને અન્ય 35 ઘવાયા હતા. બીજી તરફ યુકેનમાં રિવને નામના શહેરના ટીવી ટાવર પર રશિયાએ હુમલો કર્યો છે અને તેમાં 19 લોકોના મોત થયા હોવાનો દાવો આ પ્રાંતના ગવર્નરે કર્યો છે. હાલમાં પણ અહીંયા રાહત અને બચાવ કાર્ય ચાલી રહ્યું છે. સંખ્યાબંધ લોકો ઘાયલ પણ થયા હોવાના અહેવાલો છે. યુકેનની રાજધાની કીવ પર રશિયાએ મિસાઈલ એટેક કર્યો



છે અને નવ માળના એપાર્ટમેન્ટ પર મિસાઈલ ખાબકી છે. જેમાં બે લોકોના મોત થયા છે. બીજા સેક્ટો લોકોને રેસ્ક્યુ કરવામાં આવ્યા છે. અમેરિકાના સંરક્ષણ વિભાગનો દાવો છે કે, રશિયાએ

યુકેન પર 900 કરતા વધારે મિસાઈલો લોન્ચ કરી છે.

યુકેનના રાષ્ટ્રપતિ જેલેન્સ્કીનું કહેવું છે કે, આટલા દિવસના યુધ્ધમાં રશિયાએ ચેચેન્યા સામે બે યુધ્ધમાં જેટલા સૈનિક

ગુમાવ્યા હતા તેના કરતા બમણા સૈનિક ગુમાવ્યા છે. જેલેન્સ્કીએ યુધ્ધ પર બ્રેક વાગે તે માટે ઈઝરાયેલના વડાપ્રધાન નફતાલી બેનેટ સાથે વાતચીત કરી છે. દરમિયાન યુધ્ધ વચ્ચે પણ યુકેન અને રશિયા વચ્ચે મંત્રણા ચાલી રહી છે. આજે પણ બંને દેશોના અધિકારીઓ વચ્ચે એક બેઠક યોજાવાની છે.

રશિયાએ આ હુમલાનો આરોપ યુકેનની સેના પર મૂક્યો છે. બીજી તરફ મંગળવારે બપોરે રશિયા અને યુકેન વચ્ચેની મંત્રણાના પુનઃઆરંભ વચ્ચે રશિયન દળોએ યુકેનના પાટનગર કિવ પરના હુમલાને વધારે

તીવ્ર બનાવ્યા હતા. મંગળવારે વહેલી સવારે રહેણાક વિસ્તારો પર રશિયાના હવાઈ હુમલામાં ઓછામાં ઓછા બે નાગરિકોનાં મોત થયા હતા. યુકેનની ઈમર્જન્સી સર્વિસિસે જણાવ્યું હતું કે રશિયન દળોએ મોટિસ્કા સ્ટ્રીટમાં એક 10 માળના બિલ્ડિંગ પર મિસાઈલ છોડી હતી, જેને પરિણામે પ્રથમ પાંચ માળ આગની લપેટમાં આવી ગયા હતાં. મંગળવારે સવારે કિવમાં ઓછામાં ઓછા ત્રણ ભયાનક ધડાકા સંભળાયા હતાં, તેમ એક જર્નાલિસ્ટે જણાવ્યું હતું. તેણે ઉમેર્યું હતું કે તેણે જોરદાર ધડાકા બાદ ધુમાડાનો મોટો ગોળો આકાશમાં ચડતો જોયો હતો.

## યુકેન જંગ ભયાનક તબક્કામાં, 30 લાખ લોકોની વતનમાંથી હિજરત

કીવ : યુકેન પર રશિયાના હુમલા પછી યુરોપમાં શરણાર્થીઓના ઘોડાપૂર આવ્યાં છે. યુક્રની સૌથી વધુ ખરાબ અસર યુકેનનાં બાળકો પર પડી છે. યુનિસેફના પ્રવક્તા જેમ્સ એલ્ડરના જણાવ્યા મુજબ યુકેનમાં અત્યારસુધી ચાલેલા યુદ્ધ દરમિયાન 30 લાખ લોકો યુકેનમાંથી પલાયન કરી ચૂક્યા છે. પલાયન કરી ચૂકેલા આ લોકોમાં અડધોઅડધ બાળકોનો સમાવેશ થાય છે. રશિયા-યુકેન યુદ્ધ શરૂ થયા પછી દરેક મિનિટે યુકેનના 55 બાળકો યુરોપમાં શરણાર્થી બનવા મજબૂર

છે. પ્રત્યેક સેકન્ડે એક બાળક શરણાર્થી બની રહ્યું છે. આંતરરાષ્ટ્રીય નાણાબંડોના જણાવ્યા પ્રમાણે યુકેનમાં રશિયાએ કરેલી ઘૂસણખોરી સમગ્ર વૈશ્વિક અર્થવ્યવસ્થાને અસર કરશે, વિશ્વનો વિકાસ દર ધીમો પડશે તેમજ મોંઘવારીમાં વધારો થશે તેમજ તે પાયાના સ્તરે વૈશ્વિક આર્થિક વ્યવસ્થાને નવો આકાર આપશે. એજન્સીએ પોતાની વેબસાઈટ પર કહ્યું હતું કે માનવીય વ્યથા અને ઐતિહાસિક શરણાર્થી પ્રવાહની આગળ યુદ્ધ ભોજન અને ઊર્જાની કિંમતોમાં વધારો કરી રહ્યો છે.

## USને 9/11, પર્લ હાર્બરની યાદ અપાવતા યુકેન પ્રમુખ ઝેલેન્સ્કી

વોશિંગ્ટન : યુકેનના રાષ્ટ્રપતિ વાલોદિમીર ઝેલેન્સ્કીએ વચ્ચે અમેરિકન સંસદના સત્રને સંબોધન કર્યું હતું. સંબોધનનો પ્રારંભ થાય તે પહેલા અમેરિકાના સંસદોએ રશિયા સામે શિંગડા ભેરવી રહેલા યુકેનિયન રાષ્ટ્રપતિને સ્ટેન્ડિંગ ઓવેશન આપ્યું હતું. ઝેલેન્સ્કીએ યુદ્ધને કારણે પોતાના દેશમાં સર્જાયેલી તારાજની સાથે જ દેશવાસીઓની વ્યથા જણાવી હતી. ઝેલેન્સ્કીએ પોતાના સંબોધનમાં અમેરિકા પર 11 સપ્ટેમ્બર, 2011ના રોજ થયેલા ભીષણ

આતંકવાદી હુમલાનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે અમેરિકન સંસદોને કહ્યું હતું કે, તેઓ જ્યારે પણ યુકેન વિશે વિચારે ત્યારે અમેરિકા પર થયેલા 9/11ના ભીષણ આતંકવાદી હુમલાને યાદ કરે. ઝેલેન્સ્કીએ યુકેનના આકાશને નો ફલાય ઝોન જાહેર કરવાની પોતાની માગણીને દોહરાવતા કહ્યું હતું કે જો નો ફલાય ઝોનની જાહેરાતની માગણી વધારે પડતી હોય, તો યુકેનને પોતાની રક્ષા માટે યુદ્ધ વિમાનો અને એર ડિફેન્સ સિસ્ટમ આપવામાં આવે.

## યુકેન-રશિયા વચ્ચે તણાવ વધ્યો, બાઈડને પુતિનને ગણાવ્યા વોર ક્રિમિનલ

લંડન : રશિયન રાષ્ટ્રપતિ પુતિનના ઓફિસ કેમલિનનું કહેવું છે કે, વ્લાદિમિર પુતિન વિશેની અમેરિકી રાષ્ટ્રપતિ જો બાઈડનની ટીપ્પણી અસ્વીકાર્ય અને અક્ષમ્ય છે. એક અહેવાલ પ્રમાણે કેમલિનના પ્રવક્તા દિમિત્રી પેસકોવે બુધવારે જણાવ્યું હતું કે, અમેરિકી રાષ્ટ્રપતિએ રશિયન નેતા પુતિનને યુદ્ધના અપરાધી ગણાવ્યા છે જે અસ્વીકાર્ય અને અક્ષમ્ય નિવેદન છે. અમેરિકી રાષ્ટ્રપતિએ રશિયન રાષ્ટ્રપતિનો ઉલ્લેખ કરતા વોશિંગ્ટનમાં સંવાદદાતાઓને જણાવ્યું હતું કે, પુતિન એક યુદ્ધ અપરાધી છે. યુકેન પર રશિયાના હુમલા બાદ અમેરિકી રાષ્ટ્રપતિ દ્વારા પુતિન વિરુદ્ધ કરવામાં આવેલી આ સૌથી તીખી ટિપ્પણી છે. આ અગાઉ પણ જો બાઈડન યુકેન પર હુમલાને લઈને ઘણી વખત રશિયાને ચેતવણી આપી ચૂક્યા છે. 12 માર્ચે બાઈડને ધમકીભર્યા અંદાજમાં કહ્યું હતું કે, અમે પુતિન પર અમારું આર્થિક દબાણ વધારવા અને વૈશ્વિક મંચ પર રશિયાને અલગ કરવા માટે સક્ષમ છીએ.

## રશિયામાં બર્ગર ખાવા માટે રસ્તા પર લાંબી લાઈનો લાગી



રશિયા અને યુકેન વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે ઘણા પશ્ચિમી દેશોએ રશિયા પર પ્રતિબંધો લગાવી દીધા છે. 13 માર્ચે, મેક્કોનાલ્ડ્સે રશિયામાં તેની તમામ 850 રેસ્ટોરાં બંધ કરી દીધી. આ પહેલા મેક્કોનાલ્ડ્સમાં છેલ્લું બર્ગર ખાવા માટે રશિયન લોકોની ભીડ ઉમટી પડી હતી. હવે લાસ્ટ બર્ગરનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

## અમેરિકન સેનેટે પુતિનને યુદ્ધ અપરાધી જાહેર કર્યા, સર્વસંમતિથી ઠરાવ પસાર

વોશિંગ્ટન : અમેરિકન સેનેટે મંગળવારે રશિયન રાષ્ટ્રપતિ વ્લાદિમીર પુતિનને યુદ્ધ અપરાધી ગણાવતો ઠરાવ પસાર કર્યો હતો. આ ઠરાવ સર્વાનુમતે પસાર કરવામાં આવ્યો છે. ઠરાવ પસાર થવા દરમિયાન વિભાજિત કોંગ્રેસમાં એકતા જોવા મળી હતી. સેનેટના બંને પક્ષોએ વારાફરતી હેગ અને અન્ય દેશોમાં આઈસીસીને યુકેન પર રશિયાના આક્રમણ દરમિયાન થયેલા યુદ્ધ અપરાધોની તપાસમાં રશિયન દળોને નિશાન બનાવવા માટે પ્રોત્સાહિત કર્યા. ડેમોક્રેટિક સેનેટના નેતા ચક શૂમરે ભાષણમાં કહ્યું, 'અમે, ડેમોક્રેટ્સ અને રિપબ્લિકન, સાથે મળીને કહીએ છીએ કે પુતિન યુકેનિયન લોકો પર થયેલા અત્યાચાર માટે જવાબદારીમાંથી છટકી શકે નહીં.' રશિયાએ તેની કાર્યવાહીને યુકેનના ડિમિલિટરાઈઝેશન અને અસ્વીકાર માટે ખાસ લશ્કરી કાર્યવાહી ગણાવી હતી. 24 ફેબ્રુઆરીએ રશિયાએ યુકેન જે હુમલો કર્યો છે એ 1945 પછી કોઈ પણ યુરોપિયન દેશ પરનો સૌથી મોટો હુમલો છે.

## યુકેન પ્રમુખ ઝેલેન્સ્કીએ રશિયન સૈનિકોને સરન્ડર કરવા માટે ઓફર આપી

કીવ : આ દરમિયાન યુકેન પ્રેસિડેન્ટ વાલોદિમીર ઝેલેન્સ્કીએ રશિયન સૈનિકોને સરન્ડર કરવાની ઓફર આપી છે. તેણે એક વીડિયો સંદેશમાં જણાવ્યું હતું કે યુકેની લોકો તરફથી હું તમને જીવવાની તક આપું છું. જો તમે અમારી સેના સામે આત્મસમર્પણ કરશો તો તમારી સાથે માણસો જેવો વ્યવહાર કરવામાં આવશે. તેણે ઉમેર્યું હતું કે રશિયન સૈનિકો હથિયારો છોડીને યુદ્ધ મેદાનમાંથી ભાગી રહ્યા છે.

## મેડિકલ યુનિવર્સિટીઓ દ્વારા ઓનલાઇન ક્લાસ શરૂ, ભારતીય વિદ્યાર્થીઓને રાહત

ખારકીવ : યુકેનની વિવિધ મેડિકલ યુનિવર્સિટીઓએ ઓનલાઇન શિક્ષણ શરૂ કરી દેતા યુદ્ધને કારણે યુકેન પરત આવેલા ભારતીય વિદ્યાર્થીઓને રાહત થઈ છે. જો કે કેટલાક વિદ્યાર્થીઓએ પ્રેક્ટિકલ ક્લાસમાં હાજરી શક્ય ન હોવા અંગે ચિંતા વ્યક્ત કરી છે. અનેક મેડિકલ યુનિવર્સિટીઓ ખાસ કરીને પશ્ચિમ યુકેનમાં આવેલી મેડિકલ યુનિવર્સિટીઓએ સોમવારથી ઓનલાઇન ક્લાસ શરૂ કરી દીધા છે કારણકે રશિયન દળોના સતત મોર્ટારમારને

કારણે ઓફલાઇન ક્લાસ ચલાવવા અશક્ય બની ગયું છે. ભારતીય વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર અન્ય યુનિવર્સિટીઓ પણ ટૂંક સમયમાં જ ઓનલાઇન ક્લાસ શરૂ કરશે. ભારતીય વિદ્યાર્થીઓના જણાવ્યા અનુસાર રશિયાના મોર્ટારમારની વચ્ચે શિક્ષકો પોતાના ઘરે અથવા સુરક્ષિત સ્થળેથી ઓનલાઇન ક્લાસ લઈ રહ્યાં છે. યુકેનથી પરત આવેલા એક વિદ્યાર્થીએ જણાવ્યું છે કે કંઈ પણ ન હોવા કરતા કંઈક હોવું સારું. મને આનંદ છે કે ક્લાસ શરૂ થઈ ગયા છે.

## યુકેન યુદ્ધમાં રશિયાને ટેકો આપવા અંગે અમેરિકાએ ચીનને ચેતવણી આપી

રોમ : અમેરિકાના નેશનલ સિક્યુરિટી એડવાઈઝર જેક સુલતાન અને ચીનના ફોરેન પોલીસી એડવાઈઝર યાંગ જી સી વચ્ચે રોમમાં બેઠક યોજાઈ હતી. તેમાં બંને પક્ષોના અન્ય વરીષ્ઠ અધિકારીઓ પણ ઉપસ્થિત હતા. જેમાં અમેરિકાએ યુકેન યુદ્ધમાં રશિયાને ટેકો આપવા માટે ચીનને સીધી ચેતવણી આપી દીધી છે. તો બીજી તરફ કેમ્બેને સતત તે વાતને નકારી કાઢી હતી કે તેણે તે યુદ્ધમાં ચીનની શસ્ત્ર સરજામની સહાય માગી હતી.

# જાપાનમાં 7.3નો ભૂકંપ : 4ના મોત, 90 લોકો ઘાયલ, 20 લાખ ઘરોમાં અંધારપટ



ટોક્યો : જાપાનની રાજધાની ટોક્યો નજીક બુધવારે રાત્રે આવેલા ભૂકંપના કારણે ભારે તારાજ સર્જાયું છે. ભૂકંપના કારણે 4 લોકોના મોત થયા છે, જ્યારે 90 લોકો ઘાયલ થયા છે. જેના પગલે સુનામીની ચેતવણી આપવામાં આવી હતી. જાપાનના હવામાન વિભાગની એજન્સીના જણાવ્યા મુજબ ભૂકંપનું કેન્દ્ર સમુદ્રથી 60 કિમી નીચે હતું. ભૂકંપ પછી ટોક્યોમાં 20 લાખ ઘરોમાં અંધારપટ છવાઈ ગયો હતો. આ વિસ્તાર ઉત્તર જાપાનમાં આવેલો છે જ્યાં ભૂતકાળમાં 9.0 તીવ્રતાવાળા ભૂકંપ અને સુનામીને કારણે ભારે નુકસાન થયું હતું. ભૂકંપને કારણે પરમાણુ પ્લાન્ટમાં પણ સમસ્યા સર્જાય હતી. જાપાનની બુલેટ ટ્રેન ઓપરેટર કંપનીના જણાવ્યા અનુસાર તોહોકુમાં બુલેટ ટ્રેન પાટા પરથી ઉતરી ગઈ હતી. તે સમયે ટ્રેનમાં 100 મુસાફરો હતા. જોકે, તેમાંથી કોઈને ઈજા થઈ ન હતી.

## શિકાગોમાં ત્રણ વર્ષના બાળકે ઈઝરાયલમાં કોરોના વાયરસનો ખતરનાક નવો વેરિયન્ટ મળતા મચ્યો ખળભળાટ

વોશિંગ્ટન

અમેરિકાના શિકાગોમાં ત્રણ વર્ષના બાળકે તેની માતાને ગોળી મારીને હત્યા કરી નાખી હતી. મળતી માહિતી પ્રમાણે, માસૂમ બાળક પિતાની બંદૂક સાથે રમી રહ્યો હતો, તે દરમિયાન આ અકસ્માત સર્જાયો હતો. માતાને ગોળી ગરદનના પાછળના ભાગમાં વાગી હતી ત્યારબાદ મહિલાને શિકાગોની હોસ્પિટલમાં લઈ જવામાં આવી હતી. જ્યાં તેમને મૃત જાહેર કરવામાં આવી હતી. પોલીસે પણ શનિવારે બનેલી આ ઘટનાની પુષ્ટિ કરી છે. આ દુર્ઘટના શનિવારે સાંજે મિડવેસ્ટર્ન શહેરના ઉપનગર ડોલ્ટનમાં સુપરમાર્કેટના પાર્કિંગમાં બની

હતી. બાળક કારની પાછળ બાઈકની સીટ પર બેઠો હતો. તેની સામે તેના માતા-પિતા હતા. દરમિયાન, બાળક રમતા રમતા તેના પિતાની પિસ્તોલ પર હાથ રાખવામાં સફળ રહ્યો હતો. સ્થાનિક પોલીસ વડા રોબર્ટ કોલિન્સે એએફપીને જણાવ્યું હતું કે, બાળક કારની અંદર તેની સાથે રમવા લાગ્યો હતો તે દરમિયાન બાળકે ટ્રિગર દબાવ્યું હતું. બાળકના ટ્રિગર દબાવવાની સાથે જ ગોળી તેની 22 વર્ષની માતા દેજાહ બેનેટને ગળાના પાછળના ભાગમાં વાગી હતી. જે બાદ તેમને શિકાગોની હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. જ્યાં તેમને મૃત જાહેર કરાયા હતા.

ચર્ચાલમ

સમગ્ર વિશ્વ કોરોના મહામારીની મહાસંકટમાંથી પસાર થઈ રહ્યું છે. ત્યારે ઈઝરાયલમાં કોરોના વાયરસનો નવો વેરિયન્ટ મળ્યો હોવાના સમાચાર છે. આ વેરિયન્ટથી અત્યાર સુધી બે લોકો સંક્રમિત થઈ હોવાની જાણકારી મળી રહી છે. જોકે, સ્વાસ્થ્ય મંત્રાલયના અધિકારીઓનું કહેવું છે કે આ વેરિયન્ટને લઈને કોઈ ચિંતા જેવું નથી. આ નવો વેરિયન્ટ કોવિડ 19ના ઓમિક્રોન વેરિયન્ટના બે સબ વેરિયન્ટ BA.1 અને BA.2નું સંયોજન છે. સ્વાસ્થ્ય વિભાગના અધિકારીઓએ

જણાવ્યું કે ઈઝરાયલના બેન ગુરિયન એરપોર્ટ પર ઉતરેલા બે મુસાફરોનો ઈ ઝઈ રિપોર્ટમાં આ નવો વેરિયન્ટ મળ્યો છે. સ્વાસ્થ્ય મંત્રાલય તરફથી કહેવામાં આવ્યું છે કે અત્યારે હાલ સમગ્ર વિશ્વને આ વેરિયન્ટ વિશે કોઈ જાણકારી નથી. મંત્રાલયનું કહેવું છે કે ઈઝરાયલમાં નવા વેરિયન્ટના જે બે કેસ સામે આવ્યા છે, તેમાં સામાન્ય તાવ, માથાનો દુખાવો અને સ્નાયુઓની વિકૃતિ જેવા લક્ષણો જોવા મળ્યા છે. જોકે, આ વેરિયન્ટથી પીડિત દર્દીઓને કોઈ વિશેષ મેડિકલ સુવિધાની જરૂરિયાત નથી. ઈઝરાયલના પેનડેમિક રિસ્પાંસ

ચીફ સલમાન જરકાએ આ વેરિયન્ટના ખતરને નકારી દીધો છે. તેમનું કહેવું છે કે અમે આ વેરિયન્ટને લઈને ચિંતિત નથી. ઈઝરાયલની ૮.૨ મિલિયનની વસ્તીમાંથી ચાર મિલિયનથી વધુ લોકોને કોરોના વાયરસ વેક્સીનના ત્રણ ત્રણ ડોઝ લાગી ચૂક્યા છે. તેમ છતાં સંક્રમણના કેસ સામે આવી રહ્યા છે. તમને જણાવી દઈએ કે કોરોના ચીનમાં ફરીથી ચિંતાજનક રીતે વધી રહ્યો છે, જે ચિંતાનો વિષય છે. એવામાં એવી આશંકા સેવવામાં આવી રહી છે કે અન્ય દેશોમાં પણ આ વેરિયન્ટના કેસ જોવા મળી શકે છે.

## ગૌતમ અદાણી કમાણીમાં બન્યા નંબર 1, એલન મસ્ક અને જેફ બેજોસને પછાડ્યા

વોશિંગ્ટન

એશિયાના બીજા નંબરના સૌથી ધનિક વ્યક્તિ ગૌતમ અદાણીએ વર્ષ 2021માં પોતાની સંપત્તિમાં 49 બિલિયન યુએસ ડોલરનો વધારો કર્યો છે. ગૌતમ અદાણીની આ કમાણી ટોપ 3 અબજપતિઓ એલન મસ્ક, જેફ બેજોસ અને બર્નાડ અરનોલ્ટની વર્ષ 2021માં કરવામાં આવેલી કુલ કમાણી કરતાં પણ વધુ છે.

જો કે રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી 103 બિલિયન અમેરિકન ડોલરની સંપત્તિ સાથે સૌથી ધનિક ભારતીય બની રહ્યા છે. જ્યારે પોર્ટ ટૂ એનર્જી ગ્રુપ અદાણી ગ્રુપના પ્રમુખ પ્રમુખ ગૌતમ અદાણી બીજા નંબર પર છે. તેમની સંપત્તિ 153 ટકા વધીને 81 અબજ ડોલર થઈ ગઈ છે. વિસ્તરમાં કહેવામાં આવ્યું છે કે, છેલ્લા 10 વર્ષોમાં જ્યાં



અંબાણીની સંપત્તિ 400 ટકા વધી છે. જ્યારે અદાણીની સંપત્તિ 1830 ટકા વધી છે. HCLના શિવ નાદર 28 બિલિયન અમેરિકન ડોલરની સંપત્તિ સાથે ત્રીજા ક્રમે, સીરમ ઈન્ડસ્ટ્રીઝના સાઈરસ પૂનાવાલા (26 બિલિયન અમેરિકન ડોલર), સ્ટીલ મેગનેટ લક્ષ્મી મિત્તલ (25 બિલિયન અમેરિકન ડોલર) છે.

## આઈઓસી દ્વારા રશિયા પાસેથી સસ્તા ભાવે ફૂડ ઓઈલ ખરીદાયું

રશિયા પાસેથી 35 લાખ બેરલ ફૂડ ઓઈલ ખરીદશે

મોસ્કો

અમેરિકા અને તેના સહયોગી દેશોએ અમેરિકા પાસેથી પેટ્રોલિયમની ખરીદી પર પ્રતિબંધ લાદી દીધો છે. પરંતુ તેનો ફાયદો ભારતને થયો છે. ભારત રશિયા પાસેથી સસ્તામાં ફૂડ ઓઈલ ખરીદવાની શરૂઆત કરી છે. સૂત્રોના જણાવ્યા અનુસાર ભારત અને રશિયા વચ્ચે બંધું જ ગોઠવાઈ ગયું છે, તેના પગલે આઈઓસી દ્વારા પહેલી ખેપનો સોદો નક્કી કરાયો છે. મે મહિનાની ડિલિવરી માટે રશિયા અને ભારત વચ્ચે

ફૂડનો સસ્તો સોદો થયો છે. તેનાથી ભારતને બ્રેન્ટના વર્તમાન દર કરતા પ્રતિ બેરલ 25-30 ડોલરનો ફાયદો થશે. જાણકારોના મતે આઈઓસી દ્વારા આ ફૂડ ભારતના કિનારા સુધી પહોંચાડવાની જવાબદારી પણ રશિયાને જ આપવામાં આવી છે. ઉલ્લેખનીય છે કે, સૂત્રોના અનુસાર ભારત હવે આ સોદાને અંતિમ ઓપ અપાઈ ગયો છે. આ ડીલ હેઠળ ભારત રશિયા પાસેથી 35 લાખ બેરલ ફૂડ ઓઈલ ખરીદશે.

## શ્રીનગરમાં સરપંચના હત્યાકાંડ લશ્કર-એ-તોયબાના ત્રણ આતંકવાદીઓ ઠાર

નવી દિલ્હી

જમ્મુ કાશ્મીરના શ્રીનગરમાં સૈન્ય દ્વારા હાથ ધરાયેલા એન્કાઉન્ટરમાં લશ્કરે તોયબાના ત્રણ આતંકીઓ ઠાર મરાયા હતા. માર્યા ગયેલા આ આતંકીઓ હાલમાં જ ખોનમોહ વિસ્તારમાં એક સરપંચની હત્યામાં સામેલ હતા.

વહેલી સવારે સૈન્ય દ્વારા શ્રીનગરના નોવગામમાં સર્ચ ઓપરેશન શરૂ કરાયું હતું જે દરમિયાન આતંકીઓએ ગોળીબાર કરી દીધો હતો. જ્યારે સરકારે કહ્યું હતું કે છેલ્લા બે વર્ષમાં કાશ્મીરમાં 104 જવાનો શહીદ થયા છે. આ એન્કાઉન્ટરમાં માર્યા ગયેલા આતંકીઓ પાસેથી એક એક-47 અને બે પિસ્તોલ મળી આવી હતી. જે આતંકીઓ

માર્યા ગયા છે તેમના નામ આદિલ તેલી અને શાકિબ છે અને બન્ને શોકિયાના રહેવાસી છે. જ્યારે ત્રીજા આતંકીનું નામ ઉમર તેલી છે. આ ત્રણેય આતંકીઓ લશ્કરે તોયબા સાથે જોડાયેલા હતા. અને સુથાનિક કાશ્મીરીઓ પર હુમલા કરવામાં પણ તેમનો હાથ હતો. કેન્દ્ર સરકારે આંકડા જાહેર કરીને જણાવ્યું હતું કે છેલ્લા બે વર્ષમાં આતંકીઓ દ્વારા ઘુસણખોરીના 176 પ્રયાસો થયા હતા. જ્યારે આ સમયગાળા દરમિયાન જમ્મુ કાશ્મીરમાં 31 આતંકીઓ માર્યા ગયા હતા અને સાથે જ 104 સુરક્ષા જવાનો પણ શહીદ થયા છે. આંકડા અનુસાર 2020માં ઘુસણખોરીના 99 પ્રયાસ થયા હતા, જ્યારે 2021માં આવા 77 પ્રયાસો થયા હતા.

## પાંચ રાજ્યોમાં રકાસ સાથે...

અનુસંધાન પેજ નં.4થી ચાલુ

(સોનેલાલ)ને કોંગ્રેસ કરતાં વધારે ૨.૪૧ ટકા મત મળ્યા છે. કોંગ્રેસ બધી બેઠકો પર લડીને ૨ બેઠકો જીતી અને અનુપ્રિયાની પાર્ટી ૧૭ બેઠકો પર લડીને ૧૨ બેઠકો જીતી છે. કોંગ્રેસનો આ દેખાવ યુપીના ચૂંટણી ઈતિહાસનો સૌથી શરમજનક દેખાવ છે. કોંગ્રેસની આ હાલત દેશના ફાયદામાં નથી. એક સમયે કોંગ્રેસ દેશની એક માત્ર રાષ્ટ્રીય પાર્ટી હતી. ભાજપ અત્યારે દેશમાં સત્તા પર છે પણ ભાજપ પણ રાષ્ટ્રીય પક્ષ નથી. દક્ષિણ ભારતમાં ભાજપનો હજુ પ્રભાવ નથી જ્યારે કોંગ્રેસનો પ્રભાવ દેશના દરેક ખૂણામાં હતો. દેશના દરેક રાજ્યમાં કોંગ્રેસ સરકાર રચી હતી. આ રાષ્ટ્રીય પક્ષ હવે પ્રાદેશિક પક્ષ બનીને રહી ગયો છે. હાલમાં કોંગ્રેસ પાસે રાજસ્થાન અને છત્તીસગઢ બે જ રાજ્યોમાં જ શાસન છે.

કોંગ્રેસ સત્તામાં ના આવે તો પણ મજબૂત બને એ જરૂરી છે. કેમ કે દેશમાં વિપક્ષ મજબૂત તો જોઈએ જ. રાષ્ટ્રીય સ્તરે કોંગ્રેસ સિવાય બીજો કોઈ મોટો પક્ષ સક્ષમ વિપક્ષની ભૂમિકા ભજવી શકે તેમ નથી. ચૂંટણીમાં હાર-જીત થતી હોય પણ કોંગ્રેસમાં તો નેતૃત્વની જ નાદારી છે. ભાજપે લોકસભાની ૧૯૮૪ની ચૂંટણીમાં માત્ર ૨ બેઠક જીતી હતી પણ એવા કપરા સંજોગોમાં પણ નેતૃત્વ સાવ નાદારી નોંધાવીને નહોતું બેસી ગયું. અટલ બિહારી વાજપેયી અને લાલકૃષ્ણ અડવાણીએ હારથી ડગ્યા વિના ભાજપને ફરી બેઠો કરવા કમરકસી. વાજપેયી-અડવાણીએ પાંચ વર્ષ પછી જ ૧૯૮૮ની લોકસભા ચૂંટણીમાં ભાજપને ૨ બેઠક પરથી ૮૨ બેઠક પર પહોંચાડી દીધો હતો.



# HONEST - DEDICATED - TEAMWORK

Don't Let Confusion Cast A Shadow over Buying Your Dream Home.



PINNACLE  
REAL ESTATE GROUP

## CENTURY 21

Innovative Pinnacle Real Estate Group

We Look forward to providing you with an unusually High Level of Service and Commitment giving you a New definition of results in the Real Estate Industry. After all it is your Satisfaction that defines our Success!!!

- Free Staging
- Free Professional Photography & virtual tour
- Free Marketing, Flyers, Newspapers, Media Advertising
- Free Comparative Market Analysis
- Team of Professional for same price as hiring a single realtor
- Over 15 years of combined experience



- No Pressure
- No Obligation
- Just Answers to Your Questions... Its that Simple!

### HIGHEST SOLD IN THE BUILDING IN JUST 2 DAYS!!

20 Tubman Ave #1402  
Dundas & Parliment



West Facing 1+1 At Wyatt Condos! Modern & Sleek Interior. Amazing Open Concept Layout. No Wasted Space. Den Can Be Jr 2nd Bdrm W Closet Space. Lots Of Natural Light. Stylish Euro Kitchen. Lrg Balcony. Unobstructed West View Overlooking Dwn, Cn Tower & Sports Field. Convenient Dwnn Location, Steps To The Aquatic Centre And Outdoor Athletic Grounds, Tlc At Your Door Step. Close To Uoft, Ryerson, Eatons Centre & Distillery District. A Must See!

### JUST LISTED

Mclevin Ave./Neilson Rd



\$699,000

Absolutely stunning, spacious and bright 3 bedroom condo with walkout to a terrace. Perfect for summer BBQ and parties. Many new recent upgrades, new flooring, new kitchen, bathroom vanity, light fixtures and freshly painted. Just pack your bags and move in. Close to all amenities. Medical center just across the building, mall, parks. Minutes to hwy 401.

### JUST PURCHASED

77 Progress ave.  
Belleville



Purchased this Oversize bungalow for only \$601K with a deep lot for a client who was looking for an investment property with good income potential. It's also perfect to build your dream home or severance and build 2 homes.

Call or DM for further details on this both amazing projects.

You have Nothing to Loose... Call us for a Free Consultation on How to Get Started.

Use The Advantage of a Team, Because... Teamwork Makes Your Dreams Work !

## Shamim & Amin Kharodia

Broker of Record / Sales Representative

teamkharodia@gmail.com

300-2855 Markham Rd Toronto ON M1X 0C3

D: (647) 501-6786 | D: (647) 308-2941

F: (416) 298-8303 | P: (647) 666-8676



Grand Century Office


Each office owned and Operated. This is not intended to solicit buyers/sellers currently under contract with any brokerage.



FUNERAL HOME  
& CREMATION CENTRE

416.993.0826

24/7 # 905.305.8508



तमारी सगवड माटे अमे बे इयुनरल सेन्टर ओडर करीये छीये. मारभम अने मिसिसागा. संपूर्ण हिन्दू तथा जैन विधिनी सगवडता. (St. John's Dixie, 737 Dundas St. E., Mississauga, ON L4Y 2B5)

इयुनरल सर्विस, बेजिक कास्केट, डिमेशन अने टेक्स बधां साथे टोटल इक्त  
**\$4270**

वधु माहिती माटे झोन करो. अमारो प्रोडेशनल स्टाइ तमारी भाषामां तमने माहिती आपशे. प्रिपेड इयुनरल अने ट्रावेल इन्सुरन्स

- तमारा डोलर इयुनरल होममां जमा नहि थाय. परंतु सरकारे नीमेली ट्रस्ट कंपनी पासे रहेशे.
- अेक वधत प्लान भरीद्या पछी तमे के तमारा इमिलीये कहीपण वधु पैसा नहि आपवा पडे.
- ट्रावेल इन्सुरन्स - इक्त \$595 अेक वधत आपी जिंदगी भर तमे क्वांय पण निश्चित ट्रावेल करी शकशो. \*

\* This is not a general insurance. Applies only in case of a death away from home.

8911 Woodbine Avenue, Markham, Ontario L3R 5G1

www.chapelridgefh.com • info@chapelridgefh.com